

Chap-3

પ્રકરણ 3

‘માર્ગરૂં અન્ય ગદસાઈન્ય’

પ્રકરણ ૩

સાગર નું ચાન્દ્ય ગધસા છે ત્ય

શુજરાતી ગધસા છે ત્યમાં પદ્મલોખક, સંપાદક-સંશોધક અને વિવેચક તરીકે 'સાગર' નું પ્રદાન આપ્યે આગળના પ્રકરણોમાં વિગતે જોઈ ગયા।

આ પ્રકરણમાં સંવાદોખેખક, તંદ્રીલોખક, તેમ જ વિચારક તરીકે 'સાગર' નું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે.

'સાગર'ના ચાર સંવાદો - : ૧ : 'જ્યાણિયરી અને ઇપસુંદરી'
 : ૨ : 'શૈવાળ અને તાનાથ' : ૩ : 'મજૂનું જોગી અને ફિરિક્ષતો'
 તેમ જ : ૪ : 'ગુરુ મચ્છે-દરનાથ અને ગુરુ ગોરાયનાથ' સંવાદોની
 ભાવના, ભાષાશૈક્ષણી તેમ જ સંવાદત્વની દાઢેથી લોચના કરી છે.
 'મોટ પ્રાણી' અને મોટ પ્રાણી શુણેછુક તેમ જ જ્ઞાનસુધાના તંદ્રીલોખક
 તરીકે 'સાગર'નો પરિચય ત્યક્ત અભ્યાસ પણ રજૂ કર્યો છે. અને
 છેવટે સાગર ની નીચેની બાર પુસ્તકાઓ : ૧ : મુમુક્ષુ વિચારણા,
 : ૨ : જનાતન વિચારણા, : ૩ : પ્રાર્થના પોથી, : ૪ : સ્વીઠનબોર્જિનું
 ધર્મ શિક્ષણ, : ૫ : મહાત્મા વિવેકાનંદનું હૃદયબલ, : ૬ : મહાત્મા
 અમર્દીનનું પરમાત્મત્વ, (૭) : ત્રીજી પ્રભુજના કંકા, : ૮ : ધર્મ વિચારણા,
 : ૯ : સંતોની વાત્સા, (૧૦) : ગૌતમાની વિચારણા, : ૧૧ : ગૌતમાનું
 હૃદય, : ૧૨ : સ્ત્રીપુરુષ વિચારણાનો પરિચય ત્યક્ત અભ્યાસ
 રજૂ કર્યો છે.

સૌપ્રથમ આપ્યે સંવાદોખેખક તરીકે સાગર નું પ્રદાન
 તપાસીએ.

સાગર ના સેવાદો :

સાગર ની પત્રરેખા ચિન્તના તમક ગધસા હિત્યમાં પ્રશસ્ય ઉમેરો કરે છે. તેમ સાગર ના ચાર સેવાદો પણ ગુજરાતી ગધ-સા હિત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર ફળો આપે છે. જાનવર્ધક પુસ્તક-માળના નવમાં વર્ણના પુસ્તકોમાં શ્રી જીવનલાલ અમરશી મહેતા રખા હિત સેવાદમાલાંના આ પ્રકાશન ધ્વારા 'કલાપી,' 'કાન્ત,' 'પ્રેમભૂકિત,' શ્રી વ. ક. ઠાકોર, શ્રી ધૂમકેટુ, શ્રી નરસિંહરાવ દીવેટીએ, શ્રી અતિસુખશક્ર દ્વિવેદી, સૌ. વિધાગોરી ર. લીલાકંઠ, સ્વામી સ્વર્યજ્યોતિ, શ્રીમદ ઉપેન્દ્રાયાર્થ, શ્રી કેશવ હ. શેઠ અને 'સાગર'ના પ્રગટ - અપ્રોગટ સેવાદોનું સંકલન થયું છે.

'સાગર'ના 'સેવાદમાલા'માં પ્રગટ થયેલા એ સેવાદોમાંનો જ્ય શિખરી અને ઇપસુ-દરી 'સેવાદ જાનસૂધામા' પ્રગટ થયેલો. બીજો સેવાદ 'શિવાળ અને તાનાળ' 'સેવાદમાલા'માં પ્રથમવાર પ્રગટ થયો હતો. થો બે સેવાદ ઉપરાંત સાગરે બીજી બે સેવાદો પણ લખ્યા. છ. ઈ. સ. ૧૬૦૬માં લખાયેલો 'મજનૂઝોગી' અને દ્વિરિશ્લો. સેવાદ પણ શ્રી જીવનલાલ મહેતાએ ઈ. સ. ૧૬૧૫માં પ્રગટ કર્યો હતો. 'સાગર' નો છેલ્લો અપ્રોસ્થિધ સેવાદ 'ગુરુ મચ્છે-દરનાથ અને ગુરુ ગોરખનાથ' ડૉ. યોગી-ક જ. દ્વિપાઠીએ શ્રીસાગરાગમ ગ્રન્થમાળાના બીજી પુષ્પકૃપે ઈ. સ. ૧૬૫૫માં પ્રગટ કર્યો હતો.

'સાગર'ના આ ચાર સેવાદોમાંના પ્રથમ બે જ્ય શિખરી અને ઇપસુ-દરી તેમ જ 'શેવાળ અને તાનાળની' રચના એતિહાસિક વસ્તુ ઉપર માઠાયેલી છે. મજનૂઝોગી અને દ્વિરિશ્લો સાગર ની પ્રેમધર્મની તાત્ત્વિક વિચારણાના વસ્તુ પર તેમ જ ગુરુ મચ્છે-દરનાથ અને ગુરુ ગોરખનાથ સેવાદ તત્ત્વજ્ઞાનની ખૂભિકા પર રચાયેલા છે.

સૌપ્રથમ સેવાદમાલામણી જ્યશિખરી અને ઇપસુદરી સેવાદ વિગતે જોઈએ.

: ૧ : જ્યશિખરી અને ઇપસુદરી :

સેવાદમાલા ના ચા સેવાદનું વસ્તુ ઐતિહાસિક ભૂમિકા ઉપર રચાયેલું છે. ભૂવડ જ્યશિખરીના રાજ્ય ઉપર પોતાનું બારે લશ્કર લઈને ચડી આવ્યો છે. પુરિસ્થિતિ ઘૂળ કટોકટોલાલરી છે. જ્યશિખરીના પોતાનાં લશ્કરના કેટલાક સામતો ચુધમાં અપી ગયો છે. કેટલાક વે વફા નિવઢયા છે. પોતાની રાજ્યાની આણલીલપુરનો ત્વાગ કરવો અને કોઈક જરૂરી આશ્રય લેવો અથવા પોતાના મુઠીલર શૈનિકો સાથે તેશરીયાં કરવાં, તેમણી કયો વિકલ્પ પર્દદ કરવો તે પ્રશ્ન પણ ગુરુજરપતિને મુજબી રહ્યો છે. પોતાની રાણી ઇપસુદરી માટે શી યોજના કરવી તે પણ ગર્ભીર પ્રશ્ન અની ગયો છે. ઇપસુદરી ગર્ભવતી છે એટલે જ્યશિખરીને બેવડી ચિન્તા કરવાની છે. ગુરુજરોના ભાવિ પાત્રના રક્ષણની વ્યવસ્થા કરવા માટે પોતાના સાળા સામત સુરપાળને આમચ્છા આપ્યું છે. તે દરમયાન જ્યશિખરી અને ઇપસુદરી વચ્ચે થયેલી વાતચીત આ સેવાદનું મુખ્ય વસ્તુ છે.

આ ઐતિહાસિક વસ્તુના નિઃપણમાં સાગરે બન્ને પાઠોની ઐકણીય પ્રત્યેની સ્નેહની લાગળીની, સચોટ અભિવ્યક્તિ કરી છે. બન્ને ઐકણીય પ્રત્યેના સ્નેહનું મૂલ્ય ચૂકવવાની મણેલી અનુપમ તકનો લાલ લેવાનો દ્વારા નિર્ણય કરે છે. સ્નેહ સ્વાધ્યામાં પરિણમે છે. પરતુ ઇપસુદરી પોતાના પત્રિ સાથે ચુધમાં રજ્ઞપૂતાણીને છાંજ તે રીતે જ પોતાની વીરતાનો પરથો બતાવવાનો હઠાત્રુદ્ધ રહ્યે છે.

પરતુ જયશિખરી પોતાની રાણીની આત્મસમર્પણ અને આત્મગૌરવ તેમ જ સ્વમાનની લાગણીને દેશહિતનો વિચાર કરીને કર્તવ્યના ચન્દ્રમાં હોમીદેવા માટે સમજવે છે. આ સેવાદની ભાષાશૈલી પરત્યે "કવિ નાનાલાલ"ની સ્પષ્ટ અસર વરતાય છે. કવિ નાનાલાલના ભાવપ્રધાન નાટકો 'હનુકુમાર' અને 'જ્યાજ્યંત' માં નિરપાયેલો દ્વારા સ્નેહની વિચારણાનું જયશિખરીના પાઠ ધ્વારા ઓ સેવાદમાં સાગરે પણ અસીંધ્યકૃત કરી છે. જુઓ : "જો મળેલાં છીએ તો, સાથે જ હોવા છતાં, કદમ્બ છૂટાં પડનાર જ નથી. અને સ્નેહના સ્વાતુભવે જો અન્તરમાં એકદ્વારા ઓળખાયેલી જ નથી, તો તો થોગ વિયોગના આસું પણ મિથ્યા મોહના માયા વિ બળાપાજ છે".^૧

દેહનાશવંત છે અને એકબીજ પ્રત્યેનો આત્મપ્રેમ જ અમર છે. કવિ નાનાલાલની આ આત્મસમર્પણની ભાવનાની થાકેલું હદ્ય કથાં^૨ કર્તવ્ય ઉપર તેમ જ આ સેવાદમાં પણ પ્રબળ અસર પડેલો જોઈ શકાય છે : "શરીરના થોગ - વિયોગ તો હેઠધારો માટે નિમાયલાજ હોય છે. અહારાં લહમારાં ઓત્માનાં ગાન જો એક જ મધુરી સ્નેહલીનતાના સુરમાં અણી તાત દઈ શકયાં હોય તો ભાને શરીરો ગમે ત્યારે - ગમે તે વિથુતિમાં છૂટાં પડો ! ઠેલો મોડો એ વસ્તુગુત્તિ તો લણાયલી જ છે ને ?"^૩

જયશિખરી અને ઇપણુનદી વચ્ચેના આ સેવાદની સૌથી નાણળી કઢી ભાષાશૈલી છે. ઇપણુનદીની ભાષામાં ચમક, જુસ્સો કે રજ્જુફૂતાણીને છાજે તેવી ગૌરવચુક્ત ભાષાનો અભાવ વરતાયા વિના રહેતો નથી. પરતુ ઇપણુનદી વિદુષીને છાજે તેવી વિદ્ધિતાચુક્ત વાણી ઉચ્ચારે છે : "હદ્ય અંપ્યોમાં તરવું જોઈ શકું છું, તે વ્હેમાં છુંઘ - શોચનાં પ્રતિ વિભ્ય પણ પારણી શકાય છે".^૪

૧. સેવાદમાલા - સંપાદક શ્રી જીવનલાલ અમરશી મહેતા પૃ. ૧૭૯

૨. એજન પૃ. ૧૭૭

૩. એજન પૃ. ૧૭૬

સાથી રજપૂતાણીમાં આવ શક ગેવ। હિન્મત, સાહસિકતા અને વીરતાના ગુણોને બહે પતિના વિયોગની ભાવિ ચિન્તાથી છું અનેલી, અશ્વારતી લાગણીશીલ અભળા તરીકે રૂપસુનદરીના વ્યક્તિત્વનું ચિત્ર જેના પ્રત્યે ભાવકને બહુ માન ઉપબંધે રેતું આલેખાએનું નથી. જ્યાશીંરીની ભાષા પણ શુર્જરેશ્વરના પાત્રને માટે શોભાસ્પદ નથી. સ્નેહની ફિલસ્ફૂરીના સૂત્રો ઉચ્ચારતો જ્યાશીંરી વિદાન પ્રાણી કે તત્ત્વ ચિત્તક જેવો લાગે છે. ચિન્તવના ભારથી લદાયેલી સંસ્કૃતમય સાધો શૈલી ક્યાંક અવાસ્તવિક અને કૃત્તિમ પણ લાગે છે. અનેના એકબિજ પ્રત્યેના અનન્ય સ્નેહના ધોતક ગેમના સ્નેહની તાત્ત્વિક વિચારણાના સૂત્રાત્મક વાક્યો સંવાદમાં ઘાસ ધ્યાન જર્યે છે. જુઓ : "સ્વમાનની તમારી લાગણીને કર્તૃવ્યમાં હોમી દેવાની છે".^૪

...

"શરીરના યોગ વિયોગ તો દેહધારી માટે નિમાયેલા જ હોય છે".^૫

રૂપસુનદરીની નીચેની વાણી તેના પાત્રને ઉઠાવ આપે છે. પરેતુ તે વધુ લાગણીશીલ બની જતાં તેની અસર લગભગ લુખ થઈ જય છે. જુઓ : "શું દેહના રક્ષણ માટે રણભૂમિ છોડીને ગુજરાતની રાણી વગડામાં સંત્તાતી ફરશે ? એતુ મા બોલો, મહારા યાવડા કુળ શિરોમણી ! ચુધ્યમાં ધોડીલો ઐલાવજો ને વીક્ષણ તરવારો ફરકાવવી એ હમને રજપૂતાણીઓને કુંઈ નવું શિખવવાનું નથી, મહારાજ !"^૬

વિચારકને શોસે તેવા ચિત્તનમાં સુરી પડતી જ્યાશીંરીની ભાષાથી શુરવીર થોધ્યા તરીકેના આ પાત્રના વ્યક્તિત્વનું ગૌરવ

૪. સંવાદ-માલા - સેપાદક શ્રી જવનલાલ અમરશી મહેતા પૂ. ૧૭૮
૫. એજન પૂ. ૧૭૬ : ૬. એજન પૂ. ૧૭૮

જાળવાતું નથી. રાણી રાણુદરી પ્રત્યેના અનન્ય સ્નેહની જ્યશિખરીના હદ્યની પ્રબળ ઉમિના ઉત્કટ આદેશનની પ્રતી તિકરાવતી નીચેની પ્રક્રિતઓ જુઓ : "રાણી ! વીરપલી છો, વીર જનેતા થશો : જો મળેલાં જ છીએ તો, સાથે જ હોવા છતાં, કદમ્પિ છૂટાં
પડનાર જ નથી, તો તો યોગવિધોગનાં આસું પણ ભિધ્યા મોહના
માયાવી બળપા જ છે".^૭

જ્યશિખરીની સ્વગતો કિંતા ધ્વારા તેમની માનસદશાતું
ઉચિત નિર્દેષણ થઈ છે : "ઘારા દોષિકા દહાડમાં એ જ
ઘારા અન્તરની કુમક છે. ભાવિ તો ભગવાનને હાથ
છે, તો પણ - કાલ્યે ગમે તે થાય, તથા પિ તહારી ઓથ છે ત્યાં
સુધી ગુજરાતનું ભાગ હું તો આશાવન્નું અને ઉજાળું જ જોઈ શકું
છું". "પ્રસંગ બહુ કટોકટીનો છે. અરે
આપત્તિયો પણ સમૃદ્ધી રહેતી લગે છે ! ભાવિ પ્રયત્ન છે.
પરન્નું રાણી સગલી છે અને જી વિન્તાએ - ઓહો, જી જ આવે છે ને !"૯

રાણુદરી પોતાના પતિ સાથે સંગ્રહમાં હુશ્મનોને પરથો
અતાવવાનો આગ્રહ રાખે છે ત્યારે જ્યશિખરીની બોધાત્મક શૈલી જુઓ :

"ગુજરાતનાં રાણીના હદ્યની એ જ ભાવના - એજ
ઉછર્ણ હોઈ શકે - સ્વમાનની તહમારી લાગણીને
કર્તવ્યમાં હોમી ફેવાની છે".^{૧૦}

દીધ વિન્તની ભારથી લદાયકી તેમ જ પાત્રના વ્યક્તિત્વને
ઉપસાવવામાં ઉપકારક જોશીલી ભાષાશૈલીનો અસાવ તેમ જ
સ્નેહની તાત્ત્વિક વિન્તારણા રજુ કરતી નાનાલાલ જેવી શૈલીને
કરણે આ સર્વાદ ઉત્તમ કુળમય રચનાનો નમૂનો બની શક્યો નથી,

૭. સર્વાદમાલા - સર્પાદુ શ્રી જવનલાલ અમરશી મહેતા પૃ. ૧૭૬

૮. ઐજન : દ્વ. ઐજન પૃ. ૧૭૬ : ૧૦. ઐજન પૃ. ૧૭૮

પણ સ્નેહ માટે સ્વાધીષુ કરવાની ઉભય પાત્રોની હદ્યસાવનાં
પ્રસંગ ચિહ્ન ઉપસાવવાનો સંવાદ ક્રેષ્ટકનો હેતુ સફળ થયો છે એમાં
શેડું નથી.

: ૨ : શિવાજિ અને તાનાજી :

કંબિ નાનાલાલના નાટકોની ભાવપ્રધાન શૈક્ષિકમાં
રચાયેલો બીજો સંવાદ 'શિવાજિ અને તાનાજી' પણ ચિત્તનસારથી
લાલાયેલો હોઈ કળામય રચના બની શક્યો નથી. 'કલાપી' ના
'નેસ્તા' અને તોળલા 'અને 'મેનાખતી અને ગોપીર્થે' સંવાદોની માફક
લાગણીશીકૃતતાનો અતિરેક, વસ્તુના નાટ્યાલક વિકાસનો અભાવ
અને સિસ્કૃતમય શૈક્ષિને કારણે આ સંવાદ પણ સંવાદકલાનો ઉત્તમ
નમૂનો બનતાં રહેજ્યમાં બચ્ચી ગયો છે. 'જુછ અને કેતકીમાં' સંવાદમાંથાં
ના સંવાદોનું વિવેચન કરતાં શ્રી વિજયરાય વૈધે પોતાનો
અભિપ્રાય આ પ્રમાણે દર્શાવ્યો છે : " પ્રતાપ અને ભામાશા તથા
'શિવાજિ અને તાનાજી' એ બે સંવાદકલાના સારા નમૂના બનતાં
સહેજ્યમાં બચ્ચી ગયા છે. પ્રત્યેક ક્રેષ્ટક વિષયના આટક્ષણથી મુશ્કેલી
થયા છે તેટલા જ વિધાનાં કુશલની આવશ્યકતા વિશે સમજદાર
બન્યા હોત તો બીજુ પરિતમાં ઉંઘે સ્થાને શોખે તેનું તેમનું કાર્ય
થાત. નિષ્પ્રથોજન અતિ વિસ્તારનું અને વિસ્તારમાં પણ રૂઢાં
રસહીણાં ઉપદેશ આપવાનું દૂષણ શિવાજિવાળા સંવાદને પણ તેવી
જ નીચી કોટિમાં ઉતારે છે. વળી અનેક સશસ્ત્ર ચુધ્યોના યોધાઓ
અને તેમાં જ જીવનભર રાયનારે શિવાજિ મહારાજને મુખે અછીસાલક
અસહકારની ભવિષ્યવાણી કેવીક શોખે તેનો વિધાર પણ થવો
જોઈતો હતો". ૧૧

૧૧. જુછ અને કેતકી - શ્રી વિજયરાય વૈધ મૂ. ૬૧

વस्तुनो नाट्यात्मक विकास, केन्द्रित विचारनु संधर्ष
 ध्व।२। निवाहन, पादोना व्यक्तित्वने उपस्थिति माटे उचित
 भाषा शैली संवादक्षणाना आवश्यक तत्वो होइ भावना प्रधान
 शैलीना संवादोनी आ सीधी मोटी मर्यादा छे. "शिवाज अने
 तानाजना संवाद ध्व।२। सागरे तानाजनी शिवाज प्रत्येनी
 स्वाभी लक्षितर्हु दर्शन कराव्यु छे. आ अने पादोना संवाद ध्व।२।
 'सागर' नी तात्त्विक विचारणार्हु सचोट निःपूष थर्हु छे. हुशनना
 अथमांथी शिवाजने छोडवनार तानाजना पाद ध्व।२। तेना
 सात्त्विक उद्दयनी स्वाधिष्ठात्रिनु आवेष्ट्य चित्र सचोट शैलीमां आ
 प्रभाषे २४ थर्हु छे : "महाराज ! दासे तो कर्शु ज कर्हु नथी.
 करवान्नु अनु गज्जु शू ! महाराज साधन मूळी गया हता अने दासे
 तो मात्र यथाधर्म अनो उपयोग ज क्यो छे". १२ "महाराज !
 श्री समर्थनी महाबिलवान प्रेरणा अने श्रमन्तनी सतत पुष्यमयतानो
 ज ए प्रखावने : वाकी तानु ते कोषु मात्र ? थर्हनी पूतली जेवो
 आ तानु ते शु करी शके ? तानु तो निभित्त मात्र ज छे, महिमा
 तो श्री शुद्धेवनी विश्वविजयी प्रभुतानो अने महाराजनी रेजोमयी
 वीरक्षीनो ! आ तृष्णवत तानुने पणे पणे महान येतनया आपीने
 यत्तावनार तो ज ज छे". १३

ज्वनमां अनतो ऐकाद प्रस्त्रि निभित के पण संस्कारी ज्व
 माटे तेना उद्दयना प्रवालने आध्यात्त्विक हिशा तरह लह ज्वनमां
 पूरतो छे. शिवाजना पाद ध्व।२। सूक्ष्मात्मक शैलीमां सागर
 प्रेमर्हु - सात्त्विक उद्दयनी स्वाधिष्ठात्रिनु ज्वनमां केटहु मूल्य छे ते

१२. संवादमाला - संपादक श्री ज्वनलाल अमरशी महेता ५० १८४
 १३. अजन ५० १८१

સચોટ શૈલીમાં સમજવે છે : "એક પ્રસંગ - એક નિમિત વા એક
જ પળ સૌસ્કારી જવને ત્થિધ્યાર્થ બનાવવાને પૂરતી છે".^{૧૪} ...
.... અણું જગતી પ્રેમની જ્યોત એટલે સત્ત્વિક ઉદ્દ્દેશની
સ્વાધ્યાત્મિક જ્ઞાનમાં ઓતપ્રોત છે તે સ્વર્ગના દેવોથી પણ ઉત્તમ
કર્મ સાધી શકે છે".^{૧૫}

સૂત્રાત્મક શૈલીમાં 'સાગર' શિવજના મુખે માનવ જવનું
ધ્યેય આ પ્રમાણે સમજવે છે : "દિવ્યતાતું પ્રકૃતીકરણ જેનામાં
થાય તે હેવ અને એવી દિવ્યતાનો સ્નેહાદર એ હેવપૂજ છે".^{૧૬}
શિવજ અને તાનાજ વચ્ચેના સ્વાદ ધ્વારા સ્વાદલેણકે ધર્મનું
લક્ષ્ણ સચોટ, લાક્ષ્ણિક શૈલીમાં આ પ્રમાણે દર્શાવ્યું છે : "ધર્મ
એટલે જ એકતા - સક્લભમયતા અથવા સમદાચિ".^{૧૭}

મનુષ્યનો સાચો ધર્મ વીરતાના લક્ષ્ણનોંઠ જ નિરપણ કરે છે.
પરમાત્માનું અનન્ય શરણું સ્વીકારી તેનામાં જ પોતાનું સર્વસ્વ
કર્તૃ - પોતાના નિતનું સૈપૂર્ણ શુદ્ધિકરણ કર્તૃ એ જ મનુષ્યનો
ધર્મ છે, એમાં જ માનવીની સાચી વીરતા છે. આ વિચાર રજૂ
કરતાં શિવજ અને તાનાજ વચ્ચેના સ્વાદની લાક્ષ્ણિક શૈલી જુઓ :
"ખડ વીરત્વ તો આત્માના સમપ્રશુમાં જ છે. અનિગ્રહિત મનના
ઉત્ત્માદોની અર્થકર ક્ષણોએ પણ શ્રી હરિનું અનન્ય શરણું ગૃહણ કરીને
સકુલ્પ્રીવિકલ્પો સૌ તરે સૌંપવા અને તેનામાં જવણું એ જ ખરી -
સવોપરિ વીરતા છે. ચિત્ના શુદ્ધિકરણ વિના સાચી વીરતાનું
ઉધ્ધીપન થતું જ નથી. યુધ્યમાં જેટલું બળ જોઈએ, તેના કરતાં
શાન્તિમાં ધર્ષુ - ધર્ષુ વધારે સમર્થી જોઈએ છે. કાપાકાપી અને
આગણીત મનુષ્યોનો વધ એ કુદ વીરતાના લક્ષ્ણ નથી. અરે -

૧૪. સ્વાદમાલા - સ્વપાદક શ્રી જવનલાલ અમરશી મહેતા પૂ. ૧૬૩
૧૫. એજન પૂ. ૧૬૪ : ૧૬. એજન પૂ. ૧૬૮ : ૧૭. એજન પૂ. ૧૬૧

એતો વીરતાને લભવે, કદાચ - તાનાજ ! શાંનિત એ જ સાચા વીરન્દું તો લક્ષણ છે".^{૧૮}

સુખ અને છુંખ, રાગ અને વિરાગ, પાપ અને પુણ્ય, સત અને અસત ગેરું વૈત વસ્તુતઃ નથી જ. સૂદ્ધિને નિયમનાર એક માત્ર પરમાત્માનું જ વસ્તુતઃ સાચું અસ્તિત્વ છે. પોતાના હૃપણનો વિલય કરવો એ જ મનુષ્યનો ઉચામાં ઉચો ધર્મ છે. સર્વ પ્રકારના વૈતથી પર થઈને નિલેઘલાવે જાકુમળવત જીવનમાં રહેતું જોઈએ - જીવનનું કર્માચાર બનદરૂં જોઈએ, એમાં જ જીવનનું સાચું સાચલ્ય છે. ગીતાના કર્મયોગ અને અદૈત વેદાન્તનો સમન્વય સાધતા^{૧૯} સાગર^{૨૦}ની તાત્ત્વિક વિચારણાનો નિર્કષ સચોટ શૈલીમાં લાક્ષણિક રીતે એ પ્રમાણે અભિવ્યક્ત થયો છે : "વસ્તુમાં તો રાગ અને વિરાગ એવી એ વાતો વિદ્યમાન જ નથી, તાતુ ! પરન્દુ, નિઃસરણી^{૨૧} ચહેરાનારની અને મુક્તામે પહોંચેલાની સ્થિતિ અને દર્શિનો કેર સ્વાસ્થાવિક છે. રાગ અને વિરાગ બન્નેનો જીવનમાં લય છે".^{૨૨} સૂક્ષ્મિવાદ અને વેદાન્તની એકાદ્ધતા પણ શિવાજના સ્વાદ ધ્વારા સાગરે એ પ્રમાણે દર્શાવી છે : "એ સૂક્ષ્મી સાન્તો પણ એ જ તત્ત્વસુધા પાપ છે અને મોહમાં મરૈલાને પરમાત્મામાં જીવાડે છે. શ્રી સમયે યોગવાસ્નિ ષઠથની ટોકા શ્રવણ કરાવતાં જીવ અને જગતને પ્રેમ સાગરમાં જબકોળીને જે નૈષિદ્ધક જીવન દાયાર્યું હતું તે જ એ મહાત્માઓનું નિરતરન્દું આહારનિક છે. પાપ અને પુણ્ય, સત અને અસત વસ્તુમાં કર્શું નથી - માત્ર હેતુ પરથી નીપજલી એ કંપિક નિયત્તણા છે. સૂદ્ધિને નિર્દ્દિનાર અને નિયમનાર દર્શિ વિના હતર કોઈ છે જ નહીં".^{૨૦}

૧૮. સ્વાદમાલા - સીપાદક શ્રી જીવનલાલ અમરશી મહેતા પૃ. ૧૬૫

૧૯. એજન પૃ. ૧૬૨ : ૨૦. એજન

શિવજીને તાનાજીને સમજવેલા પોતાના ગુરુ શ્રી સમર્થનો આદેશ શ્રી ગાંધીજીએ વિશ્વવશાંતિના પ્રદાન માટે દશવેલો કાયમી ઉકેલ - સનાતન સત્યનો સ્વિધ્યાન્ત બા પ્રમાણે અભિવ્યક્ત કર્યો છે : "પ્રેમ એ ઐમન્દૂ જવનસૂચ છે, અને તેથો માને છે કે માણસ માટે જો પ્રેમનો જ આશ્રય કરીને જવન ગાળો અને રાજાઓ જો પ્રેમને જ અનુસરે અને અનુસરાવે તો શસ્ત્ર જેવી કોઈ વિધાતક વસ્તુની જ વિશ્વમાં કદાચિ જરૂર પડે નહીં. ઐમાણે ઘારારમાં શ્રી સમર્થનો જ ગુરુ આદેશ જગાડ્યો, કે હુપણીના વિશ્વ માટે જ મનુષ્ય મનુષ્ય બન્યું છે". ૨૧

આ એકિતાંત્રોમાં શિવજીની ધર્મપરાયણતા, ગુરુ પ્રત્યેનો અનન્ય પ્રેમ, ૬૬ શ્રદ્ધા અને સાચા વીર બનવાની જવાંત ભાવનાની પ્રતીતિ થાય છે. વીર શિવજીના પાઠના વ્યક્તિત્વના વિભિન્ન રૂપો - ધર્મનિષ્ઠા, ઉદ્દીરતા, સત્ય, નીતિ અને પ્રમાણિકતા ચુક્ત જવન તેમ જ પ્રેમ પ્રત્યે અનન્ય પ્રેમ અને સદ્ધારણના જવનમાં આચરનાર પ્રબળા સાચા સેવક વીર રાજવી તરીકેનું ચિત્ર પણ સાગરે સચોટ રીતે ઉપસાયું છે. ગુરુની આજા પ્રમાણે આત્મ સમર્પણ, હદ્યશુદ્ધ અને કર્તવ્યપરાયણતા ધ્વારા જવન જવવાના શિવજીના ૬૬ નિરયયમાં 'સાગર'ના વ્યક્તિત્વનું જ પ્રતિ વિષ્ય પડેનું જોઈ શકાય છે.

શિવજી અને તાનાજી વચ્ચેના આ સંવાદના શૈતિહાસિક વસ્તુની પૂર્વખૂબુંમિકા "‘સાગર’ જવન અને કવન”માં શ્રી ચોગ્રીન્દ્ર જ. ત્રિપાઠીએ આ પ્રમાણે સમજવી છે : “ઐમનો બીજો સંવાદ શિવજી અને તાનાજી પ્રમાણમાં વિસ્તીર્ણ છે અને મહત્વનો પણ છે.

મહારાજ શિવાજિના વેશમાં, મુશ્ણિદાયાદથી થોડા ગાડિ
ઉપર એક અરધયમાં પોતાના સરદાર તાનાજને અફધાન સિપાઈના
વેશમાં મળે છે. બન્ને વચ્ચેની વાતથીત થોડા સમય પૂર્વે બની
ગચેલા બનાવોની ચર્ચા નિર્દેખે છે. આણાચે સંવાદનું બાહ્ય ક્ષેવર
ઠિલિલાસનું છે, પણ જેનો આત્મા તો શ્રી સાગરે પોતે પોતાના જ
જવનમાં વણી લીધેલાં જવનનાં પરમ સત્યોનો જ બનેલો છે. એ
સત્યો શ્રી 'સાગર' શિવાજિને મુખે કહેવડાવે છે.

...

"પ્રસરાનુસારે શિવાજિને મુગલોના હાથમાંથી બચવા માટે ચક્રવર્તી
નામના પ્રાણાણને ત્વાં સંન્યાસીના વેણે રહેણું પડે છે ! તે વાતથીત
શિવાજિ અને તાનાજીની વચ્ચે ચાલે છે. શિવાજિ તાનાજને કહે છે કે
કેવા ભાવથી તે ગરીબ પ્રાણાણ ચક્રવર્તી પોતાની માતાને અને
શિવાજિને જમાડીને પછી જ જમતો. પછી શિવાજિ પોતાનું હદ્દય
બ્યક્ત કરે છે કે જે વૃધ્ય માતા શિવાજિને જમાડ્યા વિના કદમ્બાપિ
જમતી નહીં, એ જોઈ - સંન્યાસી પ્રત્યે આટલો આદરભાવ અને
આવી ધર્મપરાયણ વૃત્તિ જોઈ - શિવાજિને ઘણું લાગી આવતું".^{૨૨}

આ સંવાદમાં રજૂ થયેલી ભાવનાના કલાલક નિર્દેખણ અગે
એમણે પોતાનું મતાંબ આ પ્રમણે રજૂ કર્યું છે : "શ્રી 'સાગર' પોતાનાં
પાત્રો ધ્વારા કેવી કુશળતાથી પોતાના જવનસિધ્યાન્તો અને
સનાતન સત્યો વાચકને આકૃષ્ણ અને કલાયુક્ત રીતે આપી શકે છે.
મનુષ્ય માત્રમાં રહેલો શૈતન્યની એકતા, મનુષ્યમાં હોવી જોઈતી
વિશાળ ધર્માદ્ધિ, મનુષ્યના આન્તરમાં સહેવ ચાલતું હરિરિપુણોનું
યુધ્ય શ્રી હરિનું અનન્ય શરણું, વિરબપ્રેમની ભાવના, રાગ અને
વિરાગ - પાપ અને પુણ્ય - સત અને અસત - એ ધ્ય-દોનું માત્ર

૨૨. " 'સાગર' જવન અને કવન", પૃ. ૩૮૩-૮૪

સર્વાખ પુરતું અદ્દિત ત્વ અને વિશ્વશાનિતિનું અગત્ય - આ વધોં સનાતન સત્યોનું શ્રી શિવાજી મુણે એપ્લાને શ્રી સાગરે દિંદરીન કરાયું છે. વસ્તુતઃ તો એ શ્રી સાગરે પોતે પોતાના જીવનમાં વણી લીધેલાં જ પરમ સત્યો છે. અને તેથી જ શ્રી[‘]સાગર[’]વાચકને આટલી સરળ અને ભાવશ્વાહી રીતે આપી શકે છે".^{૨૩}

સ્વામી ભક્ત તાનાજી પોતે દુષ્મનોના હાથમાં કેદ પ્રકાય એવી પુરી દહેશત હોવા છતાં શિવાજીને છોડાવવા માટે તે વોરતા ભર્યું પગદું લે છે. સાગરે નિરસિમાની, વિનાય અને સાચા દેશસક્ત તરીકેના તાતુના વ્યક્તિત્વના સ્વાભાવિક ગુણોનું ઉચ્ચિત રીતે રેણોંકન કર્યું છે. વીર સ્વામીનો વીર સેવક તાનાજી પોતાના કાથે માટે સહેજ પણ ગોરવ અનુભવતો નથી. સ્વામીને વભાવવા માટે પોતે મોતના મુખમાં પણ પ્રવેશ કરી શકે છે તેની પાછા શ્રી ગુરુદેવનો જ મહિમા છે ગેરું તે દફતાપૂર્વક માને છે : "તાતુ તો નિમિત માત્ર જ છે. મહિમા તો શ્રી ગુરુદેવની વિશ્વવિજયી પ્રભુતાનો અને મહારાજની તેજોમયી વીરશ્રીનો ।"^{૨૪} તાતુએ તો કશ્યે કર્યું નથી. કરાવનાર શ્રી સમર્થની અદ્ભુત સત્તા જ છે. તાતુ તો તેના હાથમાં માત્ર રમકડાં જેવો હતો અને છે".^{૨૫}

પાત્રોના વ્યક્તિત્વને અનુરૂપ ભાષા સ્વાદનું અનિવાર્ય તત્ત્વ છે. જ્ય શિષ્યરી અને દખુદરી[‘] સ્વાદની માફક આ સ્વાદમાં પણ વિ ન પ્રાલણ, તત્ત્વ ચિંતક કે ધર્મગુરુને શોભે તેવી શિવાજી અને તાનાજીની ભાષા કચેરી આઉંબરી ઇપ પણ ધારણ કરે છે, કવ ચિત કૃદ્વિમતમાં પણ સરી પડે છે. સસ્કૃતમય ભાષા અને ગહન તત્ત્વજ્ઞાનની ચચ્ચી તાનાજી

૨૩. "‘સાગર’ જીવન અને કવન", પૃ. ૩૮૮

૨૪. સ્વાદમાલા - સ્વપાદક શ્રી જીવનલાલ અમરશ્રી મહેતા પૃ. ૧૮૧

૨૫. એજન પૃ. ૧૮૨

સેવાદ ધ્વારા સાગરે રૈખાંકન કર્યું છે : "હું રાજવી હું અને
સન્યાસીનો તો મહે વેશ જ લીધો છે, એ કોણ નાણે શી ચે રીતે
મહારાઠી ભૂલી જવાયું અને હદ્ય સન્યાસિપ જ બની ગયું, સાધુતા
શી વસ્તુ છે એનો પરિચય થવાથી અભ્યાસ અને અનુભવ સુધ્યાં
મહને કુમશઃ થવા માંડયો - એટસે સુધી કે - સાધુના વેશમાં હું
સાધુ નહીં પણ જાતે સાધુતા વન્યો". ૨૬

શિવાળની આ તાત્ત્વિક વિચારણામાં સાગર ના જવનર્દું
પ્રતિ વિષિષ્ટ જ પડેલું સ્પષ્ટ જોઈ શકાય છે. ઓળખી-ક જ. ત્રિપાઠીએ
યથાર્થ જ કહ્યું છે કે : "આ વાક્યોમાં સ્પષ્ટ થતી શિવાળની
ધર્મપ્રીતિ શ્રી સાગર ની જ ધર્મપ્રીતિ વ્યક્ત કરે છે. એમનો જ
જવન સ્થિધ્યાન્ત રજૂ કરે છે. સુજાતાએ વિવેચનાને લેખકની શૈક્ષિકમાં
રહેલી પ્રવાહિતા, સરળતા અને ઓજસ-પદ પણ લક્ષ્યમાં આવ્યા
વિના નહીં રહે". ૩૦

૨૧૪થી વિરોધ મિદ્ધના જેવી શિવાળની ધર્મપાત્ર વિત
૨૧૪ની તિ હતી. ગીતામાં દશવેલું આત્માનું બીજાર્થી - શાલુઓને
મિદ્ધો - ઉભય સાથેના સમાન, ઉદ્દીર અને પ્રમાણિક વ્યવહાર યુક્ત
માત્ર સદગુણોનું જ અન્વેષણ કરનારી સાધુની તિ શિવાળના વ્યક્તિ-
ત્વનો લાક્ષણિક ગુણ હતો. સાગરે તાનાળના શાય્દોમાં શિવાળની
ઉજવણ કારણીદીના આધારસ્તંખ લાક્ષણિક ગુણોનું સાચોટ ભાષણેલી
ધ્વારા આ પ્રમાણે દર્શાન કરાવ્યું છે. જુઓ : "મહારાજ ! મિદ્
હોવા શાલુ હો ; પરન્તુ સૌના સદગુણોનું સમાન યુદ્ધથી અન્વેષણ
કરવાની શ્રમન્તની ઉદ્દીર અને પ્રમાણિક રાજ્યની તિ પ્રત્યેક
મહારાધ્યે જાણે છે અને વધાણે છે". ૩૧

૨૬. સેવાદમાલા - સેપાદક શ્રી જવનલાલ અમરશી મહેતા મૃ. ૧૮૮

૩૦. "સાગર જવન અને કવન", મૃ. ૩૮૪

૩૧. સેવાદમાલા - સેપાદક શ્રી જવનલાલ અમરશી મહેતા મૃ. ૧૬૦

જેવા વીર સુલટના પાત્રના બ્યક્ટિતલ્વને સચોટ રીતે ઉપસાવવામાં ઉપકારક બનતી નથી. શબ્દોનું માધુર્ય ઓજસ, જુસ્સો, વેગ અને પ્રવાતા હોવા છતાં - ભાષાશૈકીની આ મયાદા સૌંદર્યના કલાતત્ત્વની દાખિલે તરત ધ્યાન જેગે છે. જુઓ : "દાસની મનુઃ યુદ્ધો માને છે, કે મહારાજ સ્વતઃ જાળી જોઈને જ પ્રદૂધથાં હોય ! એ ગ્રાહણનું કહેવું સામ્યાવા ઉપરથી એ અનુમાનને પુરુષ મળે છે".^{૨૬}

તાનાજીની ભાષા કવચિત આડેયરી રૂપ પણ ધારણ કરે છે, અને નાટકીય કૃદ્રિમતામાં સરી પડે છે. જુઓ : "મહારાજ ! પ્રલ્લિવત્ત્સલ છો - ધર્મપ્રાપ્તિના રક્ષક છો - પોષક છો".^{૨૭}

તત્કાલીન સમાજ જીવનને અનુરૂપ શિદ્ર રજૂ કરતાં 'સાગર' શિવાજીના પાત્ર ધ્વારા ભારતીય સૌસ્કૃતિકનું રહસ્ય - આર્થિક હદ્યની શ્રદ્ધા અને ભક્તિની લક્ષણિકતા વિશે આ પ્રમાણે ઉચ્ચારે છે : "હું તો સ્પષ્ટ જોઈ શકું હું કે કાલોંતરે કદાપિ વિધમીઓ આણા ભરતખણુંના વિજેતા થઈ જય અને દેશમાં અનેક ફેરફારો દેખાય, તથાપિ, આર્થિક હદ્યની શ્રદ્ધા અને ભક્તિનાં આવાં સાલુવન ધર્મ માદ્દેરોને કોઈ કશી હાનિ કરી શકે ગે તો અસ્થિ વિત છે. ધર્મ અને ધર્મ એ એક જ ભરતખણુંનું જીવન છે અને આર્થિક હદ્યમાં તે અવિચિત્ર છે".^{૨૮}

શિવાજીના હદ્યની ધર્મપરાયણતા સન્યાસીના બાળ્યવેશને સાંદ્રેષ અનુરૂપ બની રહે છે. શિવાજીના હદ્યનું આ સિન્હત્ય અને પુરુષીય મૃહુ અને વૃજથીયે કઠણ જેવા બ્યક્ટિતલ્વનું ઉચ્ચિત ભાષાશૈકી

૨૬. સૌંદર્યમાલા, - સંપાદક શ્રી જીવનલાલ અમરશી મહેતા મૃ. ૧૮૩
૨૭. એપ્ઝન, મૃ. ૧૮૬ : ૨૮. એપ્ઝન, મૃ. ૧૮૭

શિવાજની જીવનભૂકીનું નિર્દેશન કરાવતી સચોટ વાણીમાંથી
એ નમૂના જુઓ : "માણસ અતે માણસનું ભિડુ કે વૈરી કહાપિ હોતું
નથી - હોવાનું સંસ્કર્તૂં નથી, તેનામાં રહેલા ગુણો અને તે ધ્વારા
ઉપસ્થિત થતાં કખો જ સ્નેહી કે શાનુ પરસ્પરને બનાવે છે - મનાવે
છે, એ ત્રિગુણાત્મક જીવનને આ તથા ઉદ્ઘાટિથી ઉલ્લંઘને સમીક્ષણ કરતાં
તો કોઈ કોઈનું દુષ્ટન કે કોઈ કોઈનું ભિડુ નથી જ, તાતુ ।"^{૩૨}
"માણસમાત્ર જો પ્રેમનો જ ચાશ્ય કરીને જીવન ગાળે અને રાખ્યો
જો પ્રેમને જ અનુસરે અને અનુસરાવે તો શસ્ત્ર જેવી કોઈ વિધાતક
વસ્તુની જ વિરાવમાં કહાપિ જરૂર પડે નહો"।^{૩૩}

૬ સાગરીસચોટ સૂત્રાત્મક શૈક્ષિમાં કેટલાંક વિરતન સત્યો
આ પ્રમાણે રજૂ કર્યા છે :

વીરો તો વિલુની વિલુટિ છે.^{૩૪}

ધર્મ એ એક જ ભરતાંડનું જીવન છે.

ધર્મ એટલે જ એકતા - સકુલમયતા અથવા સમદ્ધિ
સમભાવના જ નહોં પણ ઉડી એકતા。^{૩૫}

રાગ અને વિરાગ બનેનો જીવનમાં લય છે.^{૩૬}

શાન્તિ એ જ સાચ્ચિદીર્ણનું તો લક્ષ્ય છે.^{૩૭}

દિવ્યતાનું જેનામાં પ્રકટીકરણ થાય તે દેવ.^{૩૮}

અર્દ વીરત્વ તો આત્માના સમર્થિમાં જ છે.^{૩૯}

૬ જય શિખરી અને ઇપસુદરી' સેવાદની માફક આ સેવાદ પણ
વિતનભારથી લદાયેલો હોવા અતાં જીવનના વિરતન સત્યોનું સચોટ
નિર્દિષ્ટ અને શિવાજના બ્યક્ટિલ્વની પ્રયત્ન છાપ ઉપસાવતો આ

૩૨. સેવાદમાતા - સેપાદક શ્રી જીવનલાલ અમરથી મહેતા પૂ.

૩૩. એજન, પૃ. ૧૮૨ : ૩૪. એજન પૃ. ૧૮૨ : ૩૫. એજન પૃ. ૧૮૭

૩૬. એજન, પૃ. ૧૮૨ : ૩૭. એજન પૃ. ૧૮૫ : ૩૮. એજન પૃ. ૧૮૮

૩૯. એજન, પૃ. ૧૮૪

સેવાદ સર્જન કલાના મધુર અંશો - ઉમિસુસ્પર્શી ચુક્ત નાટ્યક્ષમતા।
અને પાદ્રો વિત ભાષા શૈલીને કારણે ગુજરાતી સાહિત્યના સેવાદ્દેશે
પ્રશસ્ય ઉમેરો છે.

સેવાદ્દેશે તરીકે સાગર નું સ્થાન નાનાલાલ, કલાપી,
શ્રી કેશવ હ. શેઠ અને ધૂમકેતુની હરોળમાં છે, જુઈ અને કેતકી માં
શ્રી વિજયરાય વૈધે પણ સેવાદમાલા ના મૂલ્યાંકનમાં આ સેખકોના
શેડ જ કોરિના આ સર્વોત્તમ સેવાદોની લાક્ષ્ણીકૃતા આ પ્રમાણે
દશાવી છે : "ગુજરાતી ભાષાના કેટલાક સર્વોત્તમ સેવાદો આ
સંગ્રહમાં જોવામાં આવે છે, તેમાંના જેસલ અને તોળલાં : કલાપી :,
હલદીધાટ : ૨૮, નાનાલાલ : , શિવાળ અને તાનાળ : સાગર :,
પ્રલાપ અને ભામાંશા : શ્રી કેશવ હ. શેઠ : તથા સિધ્યરાજ અને
જશમાં : ધૂમકેતુ : - જેટલા નાટ્યાત્મક ધારનાર ભાવાત્મક શૈલીનો
છુ". ૪૦

"સાગર" જીવન અને કવન"માં શ્રી યોગી-ના જ. ત્રિપાઠીએ
જ્યા શિખરી અને રફ્ઝુદરી² સેવાદની ભાષા તેમ જ ગધ વિશે આ
પ્રમાણે અભિપ્રાય દર્શાવ્યો છે : "જ્યા શિખરી અને રફ્ઝુદરી'નો
સેવાદ ટૂંકો જ છે. પ્રસ્તિ ભૂવર્ણના ઓક્મણનો છે. જ્યા શિખરી વિચારમાં
હે કે પોતાની પંની રફ્ઝુદરી સગભી હોવાથી લડાઇમાં પોતે
માયો જથ તો પણ રફ્ઝુદરીને કુંઈ પણ નુકશાન થર્થું ન જોઈએ ;
કારણ કે અને આત્મી છે કે ભવિષ્યની રાજ્યાતા છે. આખોય સેવાદ
સરળ અને સેસ્કારી ભાષામાં લખાયેલો છે. અને શ્રી સાગર ના
શિષ્ય અને ઓજસ્ય બયા ગધનો સુદર નમૂનો પૂરો પાડે છે". ૪૧

૪૦. જુઈ અને કેતકી, શ્રી વિજયરાય વૈધ મૂ. ૬૦

૪૧. " સાગર જીવન અને કવન", મૂ. ૩૮૩

: ૩ : મજનૂ જોગી અને ફિરિશ્ટો : -

લેલાં મજનૂની ફરસી સાહિત્યમાં બહુ જાળીતી પ્રેમકથા અને સ્વારદું મુખ્ય વસ્તુ છે. ગણનવી વારદાણના શાહેબાં તેસ અને મિસરના કાળની દીકરી લેલાંના પ્રશ્નાયની કથા ઇશ્કેમન્જીની ઉન્નત ભૂમિકાનું નિર્ધારન કરાવે છે. હુનિયાની ફાની ચીજો ઉપર જીવદુલ્લ પ્રીતિ નથી એવો તેસ લેલાંને જુગે છે અને પોતાના પૂર્વ-જન્મની સ્મૃતિના સંસ્કર ઘેના હદ્યમાં જગી ઉઠે છે. અને લેલાંમાં પોતાનો Bean ideal સૌનાદીપ્રતીક નિહાળો છે. પરંતુ હુનિયાની આખરને લાંઘે કાળને અનુ પ્રેમ મંજૂર નથી. એટલે પ્રેમના નામથી મજનૂને ઝેરનો ખાલો સોકલવામાં આવે છે. તે પોથી જી, છતાં તેની કશી અસર થતી નથી. કાળને આત્મયેં થાય છે અને બનેની શરીરથી પર કેવળ અસૌંદ્રિક પ્રેમની ઘેને ખાતરી થાય છે. તેમ છતાં તે એક દિવસ રાતોરાત મજનૂને મૂકીને પોતાની દીકરી સાથે મક્કા તરફ ચાલ્યો જય છે. સ્વારમાં લેલાંને ન જોતાં મજનૂ દીવાનો લેલાં..... લેલાં પુછારતો મક્કાના રસ્તે તેમની પાછળ દોડવા માંડે છે અને તેમને પકડી પાડે છે. પોતાના પ્રેતાની આજા પ્રમાણે લેલાં મજનૂને તમે અહો ઠહેરો એમ ત્યાં ઝડપ નીચે પોતે પાછી ન કરે ત્યાં સુધી થોસી જવા માટે વિનંતી કરે છે. પોતાની માશુકની આજા પ્રમાણે મજનૂ એ ઝડપની નીચે પોતાની માશુકનું નામ પોકારતો પ્રશ્ન તપ્તયામાં લીન થઈ જય છે અને એને સમાધીદશાનો સ્વાતુભવ થવા માંડે છે. એ દશામાંથી એને ચલિત કરવા માટે -- કસોટી કરવા માટે ઈજરાઈલ નામનો એક ફિરિશ્ટો સ્વર્ગમાંથી આવે છે. અને બને વચ્ચે ઇશ્કેમન્જી અને ઇશ્કેહકીકી વચ્ચેના સેદ અગે તાત્ત્વિક ચર્ચા

થાય છે. આ સુવાદમાં ફિરિશ્તા અને જોગી વચ્ચેનો સુવાદ સાગરે પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કર્યો છે. સુવાદનું વસ્તુ સાગરે પોતે જ સુવાદના પ્રારંભમાં આ ખું છે. ૪૨

સુવાદના પ્રારંભમાં ^{‘હદીસ શરીરે’} માંથી સાગરે એક અવતરણ આ ખું છે. સુવાદમાં અભિવ્યક્ત થયેલી સાવનાનું રહસ્ય આ અવતરણમાંથી સમજ શક્ય છે. જુઓ : “માણસ માણસને જોવાનો આયનો છે. હશે મિનજી એ હશે હકીકીની સીડી છે. હશેની દીવાનગી તેનું નામ કે જે અઙ્કળની બધી વાતો રેદ કરે છે. હશેનો અભિન એવો છે કે જે મહેષુદ્ય યાને માશુક વગર બીજી બધી વાખતોને જલાવી હે છે”. ૪૩ સુવાદના પ્રારંભમાં આ પેલી ગંગાની નીચેની પંક્તિઓમાં પણ બંને ભાવનાઓ વચ્ચેના અસેદનું જ પ્રતિપાદન થયું છે -----

“નહિ ખાયશ હે જનતકી, ન ખાયશ હૂર ગિલમાંકી
મુક્ખ ખાયશ હે લેલાંકી, મેરી લેલાં મિલા મૌલા
તરા અહેસાં બૃદ્ધ હોગા”.

મીસરના એક જીલમાં મધ્યાન્હનો સમય છે. મજનૂસે પોતાની માશુકના નામમાં પોતાનો દેહ જોગળી નાખ્યો છે. અને પ્રણયની સમાધિમાં લીન છે. ત્યાં ફિરિશ્તો પ્રગટ થાય છે અને મજનૂની પરીક્ષા લેવા માટે એ તત્પર થાય છે. ફિરિશ્તાની સ્વગતો કિતમાં ‘સાગર’ એની આ નિયત આ પ્રમાણે દશાવે છે : “એના દિલની તાકાત કેટલી છે. એ હજુ અઝમાવવું જોઈશે. અત્યારે એની મહારે કસોટી કરવાની છે. હશેનો રોધ તો ધૂમરો છે. જોઈશે એમાં હન્સાનની કૂચ્છે એના દિલનું કૌવત !” ૪૪

૪૨. મજનૂ જોગી અને ફિરિશ્તો, પૃ. ૩-૬

૪૩. શૈજન, પૃ. ૮ । ૪૪. શૈજન, પૃ. ૧૧

કિરિશ્તો મજનૂને જગાડે છે. અને પોતે લાવેલો "ઝુદેઈ
ધગામ" એને સભળાવે છે. પરંતુ મજનૂ તો ક્રિસ્ટિયન ના જપમાં
જ ગુલતાન છે એટલે એને કિરિશ્તાની કશી હરકાર નથી. મજનૂ
પોતે માને છે કે પોતાની માશુક લેલાં જે જ એનો ઝુદે છે. ઝુદે
અને માશુક એવી બે સિન્ન વ્યક્તિઓનું અસ્તિત્વ એને મન નથી.
"ઝુદ માલેકના જ ઝુદેઈ ફરમાનથી અહો ઠેરેલો છે. માલેકના
ઝુદના તસ બ્વરમાં જ ગિરફતારી છે ને અભમનો પચગામ પહોંચાછવાને
પણ માલેક ઝુદ રવચ હાજર થનાર છે. તૈયાર છૂ - તૈયાર છૂ -
તે હર્દીભેદ, નિગણ્યાન દિલ્લારનો પચગામ ઉઠાવવાને".^{૪૫}
અને મજનૂ પોતાના ઈશ્કની મસ્તીમાં જ પોતાને છોડો દેવા અને
નાહક ચચ્ચી કરવાનો પોતાને વપ્ત નથી એવું સ્પષ્ટ કહેવા છતાં
કિરિશ્તો તેને બેછિશ્તમાં લઈ જવાની દરખાસ્ત મૂકે છે. મજનૂ
કિરિશ્તાને એનો જવાય આપે છે : "ઇશ્કનાં મુખારક કદમથી
થાવન થયેલો જગાંલ આગળો, તહારાં લાખો બેછિશ્તની કિઝુંત
એક ઝૂટેલો કોડી પણ નથી ! તણી હોતી જ નથી તહારા
બેછિશ્તની કોઈપણ સાચા આશક ને ! મહેદારી અપત્તી નથી
બીજુને જેમ છૂ તેમ અમનગમનમાં છૂ - ઇશ્કદારીની ચાદીમાં
હરદમ ખુશબ્દી છૂ - હરદજ કરી હે, તહારાં બેછિશ્ત, કિરિશ્ત !
જગાવો હે ઈશ્કની ધૂની ને બની જ આશક !"^{૪૬}

કિરિશ્તાને જ આશક બનવાતું આમદ્દાશ આપતા મજનૂને
તેની આપણુંદીથી ગફકતમાં ન પડવાની રે સૂચના આપે છે.

૪૫. એજન, પૃ. ૧૫

૪૬. એજન, પૃ. ૧૬

પરતુ પોતાની આપણુંદી એ પોતાની સમબન્ધી મીઠી નગર અને
તેના જ લફકહુરમાંથી જન્મી છે ગૈલી સ્પષ્ટતા કરતાં ફિરિશ્ટો
મિત્રતાનો દાવો કરીને તેને આ પ્રમાણે સમજવે છે : "મજનૂ
દીવાના ! અને તો, બેહિશ્ટના અટ ણાસ ફિરિશ્ટા ; ૭૫૨
તુ હતથાર સુધ્યાં રાખી શકે". ૪૭

.....

"આપણે છુટા પડીએ તે પહેલાં તહેડિ બહેતર મહારે,
તને સમજવંદું જોઈએ. હિલના ઇરાદાથી તું શુનહગાર નહીં હોય,
મજનૂ ! તો ગફકતને લીધે ચા કુમ અચુકને લીધે પણ, શું તુ
ભૂલેલો નથી, વાર ! બિરાદર". ૪૮

ફિરિશ્ટો મજનૂને તેની પ્રણય તેપરથાનું કારણ પૂછે છે.
પ્રેમયોગનો સ્વિધ્યાંત સમજવતી મજનૂની ઉક્કિતમાંથી સાગર^૨ ની
પોતાની જ ભાવના નિરપાયેલી જોઈ શકાય છે : "સ્વિલાય
સાથી તલબ તો હરકોઈ ઇન્સાન કર્શે જ કરી શકે ન હિ.
.... આશક હોય વગર આદમ જત ખરી હ્યાંતિ
કદી જવી શકે ન હિ, ઇગરાઈલ ! જેને ખરી જવતું હોય તેણે ખરા
આશક જ થવું જોઈએ". ૪૯

ફિરિશ્ટો મજનૂને તેની માશુક વિષે પૂછે છે અને શેના
પ્રત્યુત્તરમાં મજનૂં કહે છે કે, "હું અવ્યાસા બિર લેલાંનો જ છુ".
ફિરિશ્ટો મજનૂને તેની ખૂલ આ પ્રમાણે સમજવે છે : "ાનલહકુ
ઓઈને લેલ હહકુ પુકારે છે એજ તહેડી ચૂકની સાચિતી પૂરી છે.
પિછાન પિછાન હજ પણ ગફકતને પિછાન, ને, હુકુસ્ત કર તહેડી
જહાલત ઓ દીવાના !" ૫૦

૪૭. ઐજન, પૃ. ૨૦ : ૪૮. ઐજન, પૃ. ૨૧

૪૯. ઐજન, પૃ. ૨૪ : ૫૦. ઐજન, પૃ. ૨૫

મજનૂં કિરિશ્તાને આપેલા પ્રત્યુત્તરમાં પોતાની હદ્યમૂલ્યિ -
લેલાના જ પોતાના માલેકનું દર્શન કરે છે. એહા કહે છે : "નહીં !
બિરાદર ! લેલ હેઠાં પુકારં છું ને એજ પૂરેપૂરં વાળિય છે.
મહેબૂબ માલેક છે ને તેનો જ કાયુ ઘારારા દિલ્લિ પર પૂરેપૂરો છે.
એજ માલેક એક હથું છે. ને એજ હથકનો અચાલ હરખમેશ કયાં
કરં છું. ચૂક નથી - ચૂક નથી - બિલ્કું ચૂક નથી. સમજમાં
તફાવત છે કિરિશ્તા !"^{૫૧}

પરંતુ કિરિશ્તાને આ ખુલાસો ગૃહિય લાગતો નથી. ઓરતનો
પ્રેમ એ બદનની બદી છે, અને ખુદાનો જ પ્રેમ તે મંજૂર રાખે છે.
મજનૂં એનો પ્રત્યુત્તર આ પ્રમાણે આપે છે : "ખુદાએ મહને પેદા કથો
કે ખુદની ખુદીએ પેદા કથો, એ બાળત તૂં ધારે છે એટલી દૂકી
નથી, કિરિશ્તા ! ભગર કહે તો ખરો જરા કે તૂં પોતે તો
એ ખુદા નથી ને ?"^{૫૨}

તે કિરિશ્તાને પૂછે છે કે "એ પેદા કરનારથી તું તો વાકેફગાર
જ હોઈશ કરાં ?" મજનૂં કિરિશ્તાના જવાય ધારારા તેને બાંધી કે
છે. "ખુદાનું અસ્તિત્વ કયાં નથી ? સર્વત્ર છે". એવો કિરિશ્તાનો
ઉત્તર લાક્ષણિક છે : "ખુદા કયાં છે ? બેછિશ્તમાં છે ! ને બેછિશ્તમાં
જ નહીં પણ અમી આસમાં ને દરિયાવમાં એવી કોઈપણ ચીજ ચા
જગાહ નથી કે જેમાં સે પાક પરવરદીગારનું અજ્ઞાન નૂર મોજૂદ ન
હોય, કયાં છે કયાં છે શું પૂછે છે ક ઓ મજનૂં ! તે તો બધે છે -
બધે છે, ને બધામાં છે ; દીવાના !"^{૫૩} અને મજનૂં કિરિશ્તાને
તેના જ શાખામાં આ પ્રમાણે જવાય વાળે છે : "હું તેનામાં તેને

૫૧. એજન, પૃ. ૨૬ : ૫૨. એજન, પૃ.

૫૩. એજન, પૃ. ૨૮

ફિરિશ્તો તેને બેખુદા યા કાફિર બનનારને માટે
૬૨ વેલો નસીહતો ની ધમકી આપે છે અને બુતપુરશ્તી છોડો
દઈને અલ્લાહના ઈશ્વરમાં દૂધી જવાની સાચી સલાહ આપે છે。
પરંતુ ફિરિશ્તાની આવી ધમકીથી ડગી ભય શેવો આશક મજનૂ
નથી. તે તો સિધ્યાત્માં માને છે કે પોતાની મહેષુદ્ધ એ જ
ખુદા છે. પોતાની માશ્કુક અને ખુદા એવી યે વ્યક્તિઓનું અસ્તિત્વ
જ નથી; પરંતુ પોતાનાથી પર થઈને ખુદની ખુદી છોડો દઈને
અભિજમાં પોતાનું અહેપણું ઓગાળીને સાચા પ્રેમી થવું એ જ હું
કોઈના જવનનું ધ્યેય બની રહે છે : "મહારો છી-દગ્ધોનો તો
કશો જ ખ્યાલ કરવો, એ વિદ્યુલ હક્ક નથી - મઝહબે ઈશ્વ
મુત્તા વિક, એ જરૂર જ ગેરકાયદે છે. જુદા માલેક છે ; ને જેને
માલેક છે તેને આપુદ્ધી - પોતાની માશ્કી કશી, ન હોઈ શકે.
માશ્કુક એક માલેક માનું છુ". ૫૮ "આશકનાં જ ચ શ્મ જોઈ શકે
એવું એ ખુદ ખુદાઈ હુશ્ન, તું જતે આશક હોયા વગર કુદિ ન
ફિલાની શકે, ફિરિશ્તા ! ખુદા એક છે - એક છે ને બેશક એક
ખુદા જ છે". ૫૯ ઈશ્વર અને ખુદા એવી યે ભિન્ન વસ્તુઓનો ઈન્કાર
કરતાં મજનૂના મુખે 'સાગર' પ્રેમયોગનો સનાતન સિધ્યાત્મ એ પ્રમાણે
સમજવે છે : "એટનું આશકો ખુદાને ફિલાને છે તેટનું બીજી કોઈ
ફિલાનું નથી - ફિલાની શકતૂં નથી. ખુદા શુ છે ? શુ છે ખુદા ?
ઈશ્વર, જતે ખુદા છે ; ખુદા જતે ઈશ્વર છે. ખુદા અને ઈશ્વર એવી,
કોઈ યે ચીજો એકમેકથી અલગ નથી". ૬૦
નેક નૂરે ઈશ્વર એ જ ખુદા છે. ઈશ્વર એક જ છે. આલમ આખી ઈશ્વર છે
અને ઈશ્વર જતે ખુદા છે : "એ નૂરની બેકદર જહાં એ જ દોષાદ્ધ છે.
ગોયા એજ અદ અરફનું અધારે છે". ૬૧

૫૮. ગેજન, પૃષ્ઠ ૩૬ : ૫૯. ગેજન, પૃષ્ઠ ૩૬

૬૦. ગેજન, પૃષ્ઠ : ૬૧. ગેજન, પૃષ્ઠ ૬૧

પણ હિરિશ્ઠો ઈશ્કે હકીકીનું જ રદ્દું કરે છે. એને મજનૂર
પૂછે છે : "આરામ છે મહને, ઠગરાઈલ ! દિલ્દારના નામની
ચાદીમાં, ને ઈશ્કનું ! જે જમ પીધૂ છે તેની નશાદારીમાં !
ને બીજું ધૂનમાં અધરદાર છું - પૂર હુશ્વિયાર છું ! મગર શું તેં જ
કબૂલેલું નથી કે ઈશ્કની દિલ્દાર કૈલામાં ખુદ ખુદાઈ નૂર જ
ઝગમગે છે ? ઈન્કાર કરી શકે છે તૂ આમાં રોશન થતાં અન્યાય
એ રાગનો". ૬૨

હિરિશ્ઠો મજનૂર સમક્ષ છેલ્લી દલીલ રજૂ કરે છે, "તારી
માશુક ખૂબસૂરત નથી". એનો ઉત્તર આપતાં મજનૂર આશકનું સાચું
લક્ષ્ય નીચે પ્રમાણે દર્શાવે છે : "સિવાય નૂરે ઈશ્ક બીજું શું જ્યાંહે
ખૂબસૂરત છે ? યા કોઈ શકે ? જે ચલે નૂરને ખુદયખુદ પીણે છે.
તે શું ઓરતનું બદન જુદે છે ? જે આણ તહેને કશો યે ખ્યાલ છે ?
બદનની ખૂબસૂરતી, યા બદસૂરતી એ હુનિયાડારીનો વેપારી
મામલો કયાંથી દાખિલ થયો તહારા હિરિશ્ઠના દિલમાં ?" ૬૩

::::: ::::: :::::
"અચાલ કર ગોયા મિટ્ટીની બીજાની ખૂબસૂરતી જતે તો, મિટ્ટી
નથી ને મિટ્ટીની આણે જોયેલી તસવીર, તમામ - સાચે સાચી
નથી". ૬૪

સાચા આશકની મસ્તીનો પોતાનો અનુભવ હિરિશ્ઠને
તે સમજવે છે : "જે જિગાર તેની આણના શરાબનૂર એક જુ-દ પણ
ચાણે છે, તે જતે જ શરાબની મસ્તીમાં ગુમ થઈ જય છે". ૬૫

પોતાની માશુકમાં સર્વસ્વ સમર્પણ કરનાર આશકના દિલનું
સાચું ચિંત્ય મજનૂર પોતે આ પ્રમાણે રજૂ કરે છે : "મહારે માલેક તે

૬૨. એજન, પૃ. ૪૧ : ૬૩. એજન, પૃ. ૪૨

૬૪. એજન, : ૬૫. એજન, પૃ. ૪૩

છે કે જેને રગે રગે ને દમ વિ દમ હું પિછાનું હું કોઈથી બનાવ્યો
બનતો નથી એ - ઈશ્ક, - ઈગરાઈસ । ઈશ્કની માલેકી કબૂલું
હું શેખ નહીં, મુશ્કીલ યા ઉસ્તાદ નહીં મગર માલેક ખુદ ઈશ્ક
એક જ ને વિનાદો તેનો જ ગુલામ છે". ^{૬૬} "ઇશ્ક જતે અલ્લાહ
છે - અલ્લાહ જતે યકીનારી છે, અને એજ ફના - ફિલ્સાહની
ગરમી વ રોશની, લેલ લહુક - લેલ લહુક પુકારે છે". ^{૬૭}

આશકને મિઠીની આખને બદલે અસલ હકીકતની નગરથી
જોવાનો આસ કી મિયો પ્રાપ્ત થાય નહિ તો ઈશ્કેમજીની કશી
ચિંપત નથી. એ સ્વિધ્યાત્રના નિર્દ્ધાર માટે સાગર મજનૂરની વાણીમાં
ફિરિશ્તાને પ્રેમયોગની ભાવનાનું રહસ્ય સમજવે છે : "હકીકતની
નગર એ જ એક આખાદ, કી મિયો છે કે જે આખાદલીને રસ્તે હર
ચીજને તેના, અસલ નૂરમાં રોશન કરે છે. હવસના ગુલામને ઈશ્કનો
વિનાદો બનાવે છે, હેવાનને ઈન્સાન બનાવે છે, ઈન્સાન ને આશક
બનાવે છે ને અશ્રૂકને ખુદ વિ ખુદ, માશુક બનાવે છે - અરે ઈશ્કના
નૂરમાં ટ્રાક્ટન બનાવે છે". ^{૬૮}
એ મલ્ઝેદારી તે જ ખૂબ્સૂરતીમાં છે, એ જ ખૂબ્સૂરતી ચશે જુગરમાં છે.
એ જ ચશેન્જિગર નૂરેઈશ્કનાં વિન્યાસ છે. જે કોઈ ચાહે, તે ચશેહેડકુ
ઘોલી શકે છે. દૂર નથી - દૂર નથી, આસમાન, યા વૈહિકીત
જેટલે દૂર જવાને કશી જરૂર નથી. ગલેકી રગ્સે હકુ નાંદીક હેગા ।" ^{૬૯}

ફિરિશ્તો મજનૂરને વૈહિકીતની મૌજમજ ખોગવવા માટે આમંત્રણ
આપે છે પણ મજનૂર પોતે સાચો આશક છે અને એટલે સાચા આશક તરીકે
તે ફિરિશ્તાને આ પ્રમાણે જવાય આપે છે : "ઇશ્ક એ જ મળહય છે ને

^{૬૬.} એજન, પૃ. ૪૫ : ૬૭. એજન

^{૬૮.} એજન, પૃ. ૪૭ : ૬૯. એજન, પૃ. ૪૮

એથી બીજી કોઈ મૌજ વધારે હોઈ શકતી નથી. ઈશ્ક એજ,
આશકનો અંબ છે".^{૭૦}

.....
"ઇશ્ક એ જ હરેક ચીજનો જેમ અવસ મુકાય છે તેમ ઇશ્ક એ જ
હરેક ચીજનો છેલ્લો મુકાય છે".^{૭૧}

આશક પોતાના માર્ગિમાં અડગ છે એટલે ફિરિઝો તેના
માર્ગિમાંથી તેને હરાવવા માટે તેને ધમકી આપે છે, પરંતુ મજનૂ
તેનાથી ગસરાયા વગર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે : "જેને તું
મહારાજ દિલ્લિસ સમજે છે તે તો હિન્દુઓનો, નકશો છે યા નક્કશ છે
હૃદયછૂં ! અસ્થ તો તે છે, કે જે એક જ છે - છે અને હૃમેશ જ છે.
બદનમાં બદન તે છે - ૨૦૫માં ૨૦૬ તે છે".^{૭૨}

..... "અયાલે ઈશ્કની એક જ રોશની ઝગ્ઝગી રહી છે - એજ
રોશની - એ જ નૂર - એ જ હુસ્ને સનમ - એ જ એ જ અનામી
નામ - લેલ લહેચું ! લેલ લહેચું !"^{૭૩} "મહને
હરાવવાની તો લહારી વધી જ કોણિષ ફોકટ છે ફિરિઝ્ઞા !
સબ્બય ઉર જેવી કોઈ બાબત હકીકતમાં છે જ નહીં - અને દોષય ?
જ ઈશ્કને પિછાની ન શકે - જ ઈશ્કની કદર કરી ન શકે અને
ઈશ્કનાં કદમની ઘાંડ જે ચૂમી ન શકે, તે લહારાં બેહિસ્તનો
રહેનારો હોય તો પણ ; હકીકતમાં એ કિન્દાગી દોષયની જ છે".^{૭૪}

દુનિયાદારીની દિલ્લી ખુદ ખુદીમાં અને બદનની જ ખૂબસૂરતીમાં
માને છે. સાચો આશક માશુકની ઇહમાં ખુદાની ખુદાઈ જ જુદે છે.
એની આણે મિટ્ટીની નથી, ખુદ શરાખની પ્રેમની અનેલી છે. મજનૂના
છેલ્લા ઉદ્ઘારોમાં ફિરિઝ્ઞાને તેની વધી દલીલોનો ઉત્તર મળી
જય છે": "ઈશ્કના ધેલા થવામાં જ કિસ્મત બડભાગી છે,

૭૦. એજન, પૃ. ૫૦ : ૭૧. એજન, પૃ. ૫૧

૭૨. એજન, પૃ. ૫૨ : ૭૩. એજન, પૃ. ૫૨ : ૭૪. એજન, પૃ. ૫૩-૫૪

દ્વિરિક્તા ! હુનિયાદારીને ઘારો જોનારી આંખ મિટ્ટીની
છે ને ખુદ, ખુદાઈ દીદાર જોવાને બદલે તે મિટ્ટી જ જુથે એમાં
કોઈનો કશો હલાઝ છે જ નહીં. કહેવાનું કહી શકાય તેટલ્લું
અધ્યાત્મન કહી શકે ભગર મહારી અંધો ત્હને, શી રીતે લગાડું ?
ત્હારી ખુદીને તૂ છોડો હે ને બેસ્ટી, જો મહારી મસ્નાદ ૫૨
કે શું હેણાય છે. ત્હને એ ઓ ઇગરાઈલ ! "૭૫
. "ઇશ્ક જેની માશુક તે આશક. આશક એટલે માશુકનું દિક્ષ.
ને માશુક તારા અલ્લાહની આંખ". ૭૬

દ્વિરિક્તાની કસોટીમાંથી મજનું પાર ઉત્તરે છે. અને
સેલાંના આવાજથી ખુદ અલ્લાહ ઇગરાઈલને આ પ્રમાણે કહે છે :
"દોસ્ત છે મહારો મજનું - ઘારો છે મહારો એ જ્યાં જ્યાં,
એ કદમ્બ મૂકશે ત્યાં ત્યાં બેઠિસ્તથી અભ્યલ વનાવીશ, આપીશ એને
એની કૈલાં - ખુદ હું એની કૈલાં બન્યો હું બન્યું હું ને બન્યા કરીશ". ૭૭

.....
"અલ્લાહ ઇશ્કનો ગુલામ છે, ઘારનો તાયેદાર છે ને આ
હુનિયાદિપી દરિયાવમાં આશકનો બેડો પાર છે. જેને મહારી
ગરભ છે લેણે પોતાની અકુલ છોડો દઈને આશક થવું - પાગલ
થવું ને આવા જોગી થવું સબ્બાય, આવાના જ હાથમાં માલો
દાનાઈના ફૂલ અબનાની, ચાવીઓ હું આખરે બિનિઃસ્સ કરું હું". ૭૮

'સાગર'ના આ સંવાદનું વસ્તુ બીજે વણે સંવાદોથી સિન
પ્રકારનું હોઈ તેની નિર્દ્દિષ્ટશૈલી પણ વિશિષ્ટ પ્રકારની છે.
ઇશ્કેમન્જી અને ઇશ્કે હક્કીકીમાં વસ્તુતઃ કશો બેદ નથી. પોતાની

૭૫. એજન, પૃ. ૫૭ : ૭૬. એજન, પૃ. ૫૮

૭૭. એજન, પૃ. ૬૦ : ૭૮. એજન, પૃ. ૬૦

સૌર્યમૂર્તિમાં આશક પરમાત્માભૈરની જાવના નિહાળી શકે તો
 સાચા પ્રેમની અને તે ધ્વારા પ્રેમ જીમનો સ્વાતુભવ જવનમાં સિધ્ય
 કરી શકે. સૂકીવાદનો આ સિધ્યાત્મ મજનૂના પાત્ર ધ્વારા
 તર્કયુક્ત દલીલો ધ્વારા સાગરે સિધ્ય કરવાનો પ્રયત્ન કર્યો છે.
 આ સંવાદની વિશેષતા એ છે કે બેને પાત્રો વચ્ચે ખૂબ સાહજિકતાથી
 સંવાદદેખકે પાત્રને અનુભવ ભાષા તેમજ શૈલી પ્રથોજયાં છે. માત્ર
 કોઈ જાવના અભિવ્યક્ત કરવા માટે જ લખાયેલા સંવાદ કરતાં
 આ સંવાદના પાત્રાલેખનમાં પાત્રોનું વિશેષ વ્યક્તિત્વ સાગર
 ઉપસાવી શક્યા છે. મજનૂના ઉદ્ગારોમાં આશકની મસ્તદશાનું
 નિરૂપણ તેમજ પોતાની માશુકના પ્રેમમાં અનન્યતા, અહગ શ્રદ્ધાં
 અને જગત પ્રાયેની લાપરવાહીનું પણ દર્શાય છે. પોતાની
 માશુકના પ્રેમમાં નિષ્ઠા, અહગ શ્રદ્ધાં અને ધૈર્યને કરણે તે ફિરિશ્ટાની
 અનેક પ્રકારની ધમકીઓને પણ વશ થતો નથી, એટલું જ નહિએ
 પણ યુદ્ધયુક્ત દલીલો ધ્વારા ફિરિશ્ટાને પોતાનો માર્ગ
 મળું પ્રેમાણેનો સાચો માર્ગ છે અની ખાત્રી કરી આપે છે. વસ્તુની
 નાટ્યક્ષમતામાં જોડદાર ભાષાશૈલી તેમ જ પાત્રના વ્યક્તિત્વને
 અનુરૂપ જાવનાની સચોટ અસ્વિવ્યક્તિ પણ ઉપકારક બની રહે છે.

‘સાગર’ની વિચારધારા પર પદેલી સૂકીવાદની પ્રયત્ન
 અસર આ સંવાદના વસ્તુના નિરૂપણમાં પણ જોઈ શકાય છે. ‘સાગર’ની
 ભાષાશૈલીમાં પ્રવાહિતા, જુસ્સો, પ્રાસાહિતા અને કાવ્યમયતાને
 કરણે અસ્વિવ્યક્તિમાં પણ લેખક વેધકર્તા અને સચોટતા સાધી શકતાં
 છે. સંવાદનું લાક્ષણીક અગ – પાત્રો વચ્ચેના કોઈ સંધર્ષનું નિરૂપણ
 અથવા તેની પરાકરણનો અનુભવ વાચકને થતો નથી. એટલે
 નાટ્યાત્મક પુરિસ્થિતિને ઉપકારક બેવા સંધર્ષનો અભાવ આ

સૌંવાદની સૌથી નથળી કહી છે. માત્ર સિધ્યાત નિરપણના હેતુ
માટે જ આ સૌંવાદનું આક્ષેપન થયું છે અને સૌંવાદકે પોતાનો એ
હેતુ સફળતાપૂર્વક સિધ્ય કર્યો છે એમાં રાકા નથી. સિધ્યાત નિરપણની
સચોટ અભિવ્યક્તિ તેમ જ પાત્રને અનુરૂપ મસ્તી જુસ્સાં અને લક્ષ્યવેધી
ભાગશૈલી આ સૌંવાદનું મહત્વનું અણ છે. ભાવપ્રધાન શૈલીમાં લખાયેલા
સૌંવાદોમાં આ સૌંવાદ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે.

: ૪ : ગુરુ મચ્છે-દરનાથ અને ગુરુ ગોરાણાથ :-

ગુરુ મચ્છે-દરનાથ અને ગુરુ ગોરાણાથનો આ સૌંવાદ "સ્વાનુભવ,
શાસ્ત્ર અને પ્રેરણા મિશ્રિત હોઈ ગુરુના ધરની ઐટલે કે પરમાત્માના
પ્રદેશની અજ્ઞાન અજ્ઞાન વાતો આપણને કહી બય છે અને જ્યાં કાલનો
વ્યાપ નથી એવા અનુભવના પ્રદેશમાં આપણને સહજ પ્રવેશ કરાવે છે".^{૭૬}

આ સૌંવાદનું વસ્તુ આ ધ્યાતિમિક અનુભૂતિ પર આધારિત છે :
"કેવળ ભક્તિ જ નહીં પણ ગુરુપ્રાણાને ભક્તિ અને પ્રાણનું અહેત,
અગવાન કપિલહેવનું નિરીક્ષવર સાંપ્રદ્ય નહીં પણ ભગવાન પર્વત લિનું
સેક્વર સાંપ્રદ્ય, શાસ્ત્રર લખવાનું તે તો ધોયેલા દિલ ઉપર -
કાગળ ઉપર નહીં અને સાચો યોગ તે તો રાજ્યોગ જ ; નહીં કે
હઠ્યોગ - આવા કેદ કેદ સ્વાનુભવ મન્ત્રો આ દૂકા પણ રહેસ્યપૂર્ણ
સૌંવાદમાં આ સન્ત પુરષે આપણને આપ્યા છે".^{૭૦}

સહજવસ્થાનો પોતાનો સ્વાનુભવ સમજવતાં ગુરુ મચ્છે-દરનાથ
શિષ્ય ગોરાણને આ પ્રમાણે કહે છે :

૭૬. ગુરુ મચ્છે-દરનાથ અને ગુરુ ગોરાણાથ - શ્રી સાગર શ્રમ
ગ્રન્થમાણા પુષ્પ ઉજુ પ્રસ્તાવના - યોગી-દ જ. લિપાઠી પૃ. ૨
૮૦. એજન

અરુંહિં મર ગયે સોડહિં મર ગયે !

મર ગયે અજપા જથ !

ચલો ગોરખ ! વો ધર જઈયે,

જહાં નહીં કાલ્પકો વ્યાય

ગુરુ ગુરુ ગુરુ દેવકી જય !^૧

ગોરખના મુણે પણ સાગર સહજવસ્થાના સ્વાત્નુભવની બૂભિકા
જ સમજવે છે : "પોતે તો, પ્રભુ ! નિરન્તરના એ ધરમાં જ વસી
રહ્યાં છો. જિસ ધરમે ન તો હૈ જ્ઞાનેકા ઔર ન તો હૈ આનેકા".^૨

જગતને જોવાની સાચી દર્શિ - પરમાત્મા સાચેની અસેદમયતા।
આ સ્વાત્નુભવ માટે બુક્તિ અને શાધ્યાનું મહત્વ આ પ્રમાણે ગુરુ
મચ્છૈનદરનાથ પોતાના શિષ્યને સમજવે છે : "પણ, વચ્ચો, એમ
એકલી ભક્તિની જ શુદ્ધ દર્શિથી આ અધિલ નાટકનું સમાધાન
આપણે નહીં કરીએ. વાત સત્ય છે કે એકલી ભક્તિની જ શુદ્ધ
દર્શિ આ અધિલ નાટકનું સુનદર સમાધાન કરે છે".^૩

ચિત્તશુદ્ધિ વિના ગમે તેટલો પુરખાર્થ પણ નકામો નીવડે છે.
આ ત્રસાધના માટે ચિત્તશુદ્ધિ - હદ્યશુદ્ધિનું મહત્વ સમજવતાં ગુરુ
શિષ્યને આ પ્રમાણે ઉદ્ઘોષે છે : "આપણું શાક્ષતર લખવાને ધોયેલા
દિલ વગર બીજી કોઈ બૂભિકા ત્રિકાલમાં યે પાત્ર નથી. અગવાન
શેકરાયાર્થી ઔર વેદાન્તકે આચાર્ય લોગ ઉસીકો હે ચિત્તશુદ્ધિ
કરૈ રહે હે".^૪

૧. ગુરુ મચ્છૈનદરનાથ અને ગુરુ ગોરખનાથ મૂ. ૪

૨. એજન, મૂ. ૫

૩. એજન, મૂ. ૫

૪. એજન, મૂ. ૬

આ તમાતુલ્લવની મર્યાદા ત્રિક સત્યોની રહ્યાંખાં
સચોટ અભિવ્યક્તિ તેમ જ વેદાન્તની ગહનતો આ રીવાદનું વિશ્વિષ
લક્ષ્ય બની રહે છે. માત્ર એક જ દિવસની શુદ્ધ શિષ્યની દુકી છતાં
વિશાદ ચર્ચાના નિર્દ્દિષ્ટમાં સાગર ની લાક્ષ્યિક શૈલી તેમ જ મર્યાદા
આસ ધ્યાન જેચે છે.

તર્દાની લેખક તરીકે સાગર :-

મોટ પ્રાલણ જાતિના અન્યુદ્યમ માટે સમાજસુધારણાની સાવનાથી
સાગર ઈ. સ. ૧૯૦૮માં સરખેજમાં^૬ મોટ પ્રાલણ શુદ્ધેચછક મંડળની
સ્થાપના કરી હતી. આ મંડળના આક્રયે પોતાના તર્દીપદે સાગરે
^૬ મોટ પ્રાલણ શુદ્ધેચછક માસિકનો પ્રારંભ કર્યો. ^{૮૫} ઈ. સ. ૧૯૦૮ના
અન્યુદ્યારીના પ્રથમ અંકમાં આ માસિકનો ઉદ્દેશ સમજવતાં તર્દીપદેથી
સાગરે પોતાની સમાજસેવાની નિસ્વાર્થ સાવના દર્શાવી હતી.
જુઓ : "આપણા સમાજની હાલની સ્થિતિ જો રહેઠી જતી ન
હોય તો તે સમૃદ્ધાંશી વિચારો અને ઉપાયો કરવાની જોખમદારી
સમાજમાંના દરેક કેળવાશેલા મનુષ્યને શિર છે અને તે લહેનું ન નિવારી
શકાય તેવું કર્તવ્ય છે. . . . દરેક જીણ પોતાના જીબ અને
અનુભવના લાભ, આપા વગેને આપવાને જન્મથી જ વન્ધુચેલો છે.
સમાજની રહેઠી કે પડતાં સમાજમાંના દરેક મનુષ્યની સાથે એકલો
તો નિકટ સમૃદ્ધ રહ્યે છે કે વ્યક્તિ સમાજથી કદ્દી જૂદી થઈ શકે
જ નહોં. . . . હાલનો દેશકાળ સૌથે એકતાનો સાંકળથી
જોડાઈને સાથે રહી કર્તવ્ય કરવાનો છે, સમૃદ્ધિવધારવાનો છે, અને
આપણે સૌ મોટ પ્રાલણ સર્જા ધરાવનાર વન્ધુઓ પરક્ષપર વિચારોની

૮૫. આ માસિક પત્રનો જન્મ સરખેજના મોટ પ્રાલણ શુદ્ધેચછક મંડળના
ઉત્સેજનને આખારી છે. - મોટ પ્રાલણ શુદ્ધેચછક પુસ્તક ૧ -
અંક ૧ અન્યુદ્યારી ૧૯૦૮ મૃ. ૬

આપ લે કરી શકીએ એક બીજના સમાજની સ્થિતિ જ્ઞાની શકીએ,
એકબીજનાં હદ્યો સમજ શકીએ. આપણે સૌં પરસ્પર .
સ્નેહ કરવાનું શિખીને ગૈચય કરીએ એ સધળાં કાયોમાં એક અગત્યના
સાધનરૂપ થવાનો આ માટ્સ્યિક પદ્ધનો મુખ્ય ઉદ્દેશ છે.
એનો ઉદ્દેશ સ્થાનિક નહીં પણ સાર્વત્રિક અને સામાજિક છે.
આવો વિશાળ ઉદ્દેશ રાખીને સમસ્ત સમાજની સેવા કરવાનો આ
પદ્ધનો હેતુ છે".

સમાજ્યેવાના આ સામુહિક યોગમાં સમાજના વૃધ્ય અને અનુભવી
પુરુષોને પોતાના અશીર્વયનોથી વધાવી - નિભાવી કેવા માટે
સાગરે ઉભ્યે સ્પૂર્કત સ્વેગતી કાવ્યમચ બાનીમાં આ પ્રમાણે વિનંતી
કરી છે. "આપ આ પદ્ધના અસ્યુદ્ય માટે માગલિક અન્ધોચાર અને
સુખાંશિત સ્તોત્રોનો ધોષ કરી એના સ્થૂલમાં સૂક્ષ્મ તત્ત્વો ઉમેરાય
એવા સ્કલ્પો નિશદ્ધિન પ્રેર્થી કરજો ! તહે આ પદ્ધ તરફ સ્નેહભાવ
રાખશો અને તહમારા સ્નેહીઓની યાદીમાં આ પદ્ધનું નામ ઉમેરજો !
કવિઓ, ક્ષેમકો, સુધારકો અને શિક્ષિત સજ્જનો ! તહે આ પદ્ધને
સમાજની સેવાનું એક સાધન સહુમજુને, તમારા વિચારો ધ્વારા
સમાજની સેવા કરવાનું તહમારું કર્તૃવ્ય સદા સમરણમાં રાખજો, અને
આ પદ્ધનું પાદન અને પોષણ કરજો". ૮૬

આ માટ્સ્યિક સમાજિક હિતને માટે કર્તૃવ્ય નિષ્ઠા રાખીને
સમાજના અન્ધુઓના હદ્યની વિશાળતા વધારવાનું સાર્થું સાધન બની
રહે એવી સુધારવના સાથે પ્રેમસ્વરૂપ પરમાત્માને ઉપર્યુક્તમાં કરેલી
વિજ્ઞાન તંત્રીના સામ્ય હદ્યની ભાવના તેમ જ વ્યક્તિત્વને યથાર્થીરીતે
અલિવ્યક્ત કરે છે: "તહારી નિઃસીમ દ્યાને લીધે જ જે માંગ લિક

૮૬. ઐજન,

કાર્યને આજે અમારે હસ્તે આરમ્ભ થાય છે તે કર્તાવ્યપ્રવર્તનમાં, તું
સત્યસ્વરૂપ, જીનસ્વરૂપ, અનન્ત જગદ્ગીરવર, અમારા દીન હદ્યનો
નિયામક થણે ! સમાજના હિતમાં વ્યક્તિત્વનો સ્વસ્નેહ અને સ્વહિત
સમાઈ જ્ય અને વ્યક્તિત્વના હદ્યમાં સમાચિતના હિતને પહેલું સ્થાન
મળે એમ અમારા અને અમારા વાચક વન્ધુરોનાં હદ્યમાં વિશાળતા
વધારવાનું આ માસિક પદ્ધને એક ખરેખરું સાધન બનાવજે".^{૮૭}

આ માસિક પદ્ધના મુખ્યપૃષ્ઠા પર સંસ્કૃતમાં મોટે પ્રાલિંગ સમાજનો
વિજય થાય, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સર્વને પરમાત્મા સ્નેહ
માણે હોરે એવી વિજાપ્તિ તેમ જ ઉપનિષદનું જ્ઞાનીયું વાક્ય મુલ્લિષ્ઠ
નયત પ્રાપ્ત વરાનિન્યોધત પોતાના જીવનસ્થૂલ તરીકે મૂક્યું હતું
સમાન્ય રીતે મોટે પ્રાલિંગ સમાજના રીત રિવાજોનું અનિષ્ઠ દૂર
કરવા માટે, તેમ જ સમાજની સર્વપ્રકારે ઉન્નતિ થાય તેવા તમામ
પ્રયત્નો કરવા માટે ડાકોરમાં યોજયેલી "ચાતુરૈદી મોટે પ્રાલિંગ
કોન્ફરન્સ"માં હદ્યપૂર્વક આગળ પડતો ભાગ કેનાર વકીલ દલપત્રામ
અલોપરામ લિપાઠીને આ અકમાં શ્રદ્ધાંજલિ આપી છે. તેમ જ
વાચકોને જ્ઞાતિના આગેવાન ગૃહસ્થોનાં સંક્ષિપ્ત જીવનવૃત્તાંતની
માહિતી મોકલવાની પણ વિનતી કરી છે. મોટે પ્રાલિંગ ના
સમાજના છ. વિભાગો થવા ઉપરાન્ત, ચાતુરૈદી મોટે પ્રાલિંગનો પણ
એક સમાજ એકદ્વારે ટકી રહી શક્યો નથી ; એટલું જ નહીં, પણ
મૂળસ્થાન મોઢેરા છોડ્યા પછી ઉપન, દસ્કોશી, અઠુત વિશી, બાવિશી,
ઓગ્રામા અને એવા એવા ધણા જુદાજુદા જથ્થાઓ આપણા એકદ્વ
સમાજમાંથી વિછિન્ન થઈ ગયા છે.

૮૭. એજન,

મોટ પ્રાલણ સમાજના આ જુદાજુદા વિભાગોમાં સેવ
વધારવાનો રેમજ નિકટ વ્યવહાર - સંબંધમાં આવવાનો અને તે
ધ્વારા સમાજની નવરચના કરવાનો ઉદ્દેશ મોટ પ્રાલણ શુદ્ધેચુક
ધ્વારા^૧ સાગર^૨ ધ્વારા અશે સાફળતાપૂર્વક પાર પાડી શકયા હોત, પરતુ
બીજું વધુ પૂર્વાં થાય તે પૂર્વૈ આ માસિક સાગર ને પોતાના સત્ય,
નિષ્પક્ષપાત્રી, નીઠર વ્યક્તિત્વને કારણે જાતિજનો તરફથી પૂરતો
સહકાર ન મળતાં બધ કરું પડ્યું તત્ત્વીકેખક તરીકેની કર્તવ્ય નિષ્ઠા,
વિગતોની ચોક્સાઈ, સત્ય અને પ્રમાણિકતા રેમ જ સાચ દિલ્લીથી
વિચારોની નિષ્ઠિક રજૂઆત^૩ સાગર^૪ના તત્ત્વીકેખોમાં રેમજ પ્રારંગિક
નોંધમાં જોઈ શકાય છે । "મોટ પ્રાલણ શુદ્ધેચુક"^૫ ના પ્રથમ અકમાં
પ્રારંગિક નોંધમાં દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ઉચ્ચ કેળવણીની
આવ શ્યકતા પર ભાર મૂકૃતાં સમાજના દરેક ગામની ડિરેક્ટરી -
વસ્તીપત્રક - તેયાર કરવાની દરેક ગામના કેળવાયેલા આગેવાન
અનુભવી મનુષ્યોની જવાબદીરી પરતે પણ અગુણ નિર્દેશ કર્યો છે.
જુઓ : "બીજી જાતિઓમાં ઉચ્ચી કેળવણી કીધેલા અનેક પુરષો દેશની
જુદી જુદી હિસ્થાપનોમાં આગેવાનિસ્થયો ભાગ હો છે, ત્યારે આપણી
મોટ પ્રાલણની જાતિમાં ઉચ્ચી કેળવણી કીધેલા પુરષોનો જ અસાવ
છે. આનાં કારણ અને ઉપાય શોધી કાઢવાની
આપણી સૌનાં અગત્યની ફરજ છે".^૬ દરેક ગામના વસ્તીપત્રક
અંગે સૂચના આપતાં પોતાના ગામથી જ આ કાર્યનો પ્રારંસ કર્યાનો
ઉલ્લેખ પણ થેમાં છે : "સરણેજની ડિરેક્ટરી અમે તેયાર કરાવવાની
શરાંત કરી છે, અને બીજા ગામોએ પ્રયત્ન કરે થૈમ આ પ્રસંગે સૂચના
કરીએ છીએ. ડિરેક્ટરી થી થતાં લાખ સૌ કોઈને જાણીતા છે".^૭

૧૧. ગેજન, પૃ. ૧૪

૧૨. ગેજન

જુદા જુદા વિષયો પરત્વે છેલ્લામાં છેલ્લી માહિતી પોતાના માસિકમાં આપવાનો ઉત્સાહ તેમજ એત બીજુ જ અંકમાં જોઈ શકાય છે. તે સમયના ડેઢુટો ઈન્સ્પેક્ટર ૨૧.૭૮.મચારામ શેખુનાથના પુસ્તક "કચી કચી ન્યાતો કન્યાની અછતથી નાની થતી જાય છે તેનાં કરણો તથા સુધારો કરવાના ઉપાય વિષે નિર્ણયમાંથી" મોટે શ્રાવણ વિષે કરેલી નોંધ વિસ્તારપૂર્વક પ્રગટ કરી છે. એમાંથી તૌંદ્રી તરીકે નીચેના મુદ્દાઓ પરત્વે સમાજસુધારક સાગરે ઘૂણ ભાડ મૂક્યો છે. : ૧ : "કુળાકુળાનો બેદ ના રાખવો, : ૨ : બાળવિવાહ નિષેધ, : ૩ : વૃધ્યવિવાહ નિષેધ, : ૪ : એક જીવતાં બીજી સ્ત્રી ન કરવી, : ૫ : કન્યા વિક્ષય નિષેધ, : ૬ : તઠ વગેરેના સધળા બેદ મિટાડી દેવા, : ૭ : ન્યાતના સારા સારા સમજુ અને વિચારવાટ માણસોએ મળી તન, મન, ધનથી શ્રમ લઈ, પરસ્પર એકતા કરી સારાંસારાં કાયો આદરવાં"૧૦

"આચોની ઉન્નતિના ચાલુ ચર્ચાના સામાન્ય વિષયો"માં સ્વદેશી ખાંડ વાપરવાનો આગુહ, કેળવણીનો પ્રચાર, સ્ત્રીકૃળવણી, સમાજના અનિષ્ટો તેમજ સ્થિતિ સુધારવા માટે માર્ગદર્શિન તેમજ સ્વદેશભક્તિ વિષયક - એમ વિભિન્ન વિષયો ઉપર વિભિન્ન લેખકોનાં ભત્તયો રજૂ કરવામાં આવતાં. ૨૧ની લિવિંગના વિભાગમાં સમાજની ચડતી-પડતી તેમ જ સ્ત્રીપુકુષોનું કર્તવ્ય તેમ જ સ્વદેશભક્તિ વિષયક લેખો પ્રગટ થતાં. જાતિના પદ્ધતિકે જુદા જુદા મંડળોના સમાચાર પણ આપવામાં આવતાં. દરેક મંડળનો દુંકો અહેવાલ પણ પ્રગટ કરવામાં આવતો. જુદાંજુદાં પુસ્તકોનાં અવલોકનોનો સ્વર્તિ વિભાગ તેમ જ ચચ્ચાપદ્ધ અને તેના પ્રત્યુત્તરનો વિભાગોનો પણ આ પદ્ધમાં સમાવેશ થતો.

૧૦. 'મોટ શ્રાવણ શુષેષિક', પૃ. ૨૪

‘મોટ પ્રાલણ શુલેચ્છક’ના જુદાજુદા અકોની તર્ફીની પ્રાસંગિક નોંધ રેમ જ રેમના કાંયો અને કેટલાંક પુસ્તકોનાં અવલોકનો પરથી જુટાતિની સુધારણા અને નવરચનાની દિશામાં જગૃતિ લાવવાના ‘સાગર’ના પ્રયત્નો જોઈ શકાય છે. સમાજની ધર્મ, કેળવણી, રેમ જ રસ્કારમાં થતી જતી અવનતિ દૂર કરવાના પ્રયત્ન કેણે આ માસ્કિકનો ફાળો નોંધપાત્ર ગણી શકાય તેવો છે. સમાજસુધારણાની દિશામાં પાયાનું કામ કરનારાઓમાંના એક તરીકે આ માસ્કિક ધ્વારા રેના તર્ફીએ કરેલા મહત્વના કાયોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની રહે છે.

અમદાવાદની મોટ પ્રાલણ જુટાતિમાં મતસેદ પડતાં જુટાતિના અગેવાન પુરુષોને ઉદ્દેશીને એક પ્રાસંગિક નોંધમાં તર્ફીએ આ પ્રમાણે નિર્હેશ કયો છે : “અતિશય દિલ્લિગીરી સાથે અમારે આ બનાવની નોંધ કેવી પડે છે. આપણે સધળા પ્રાલણો છીએ. જાણ મુનિઓનાં સાન્તાનો છીએ, અને બીજ તમામ વર્ણના લોકોને ખરે મારે દોરવાનું આપણું પ્રાલણોનું કર્તવ્ય છે. આપણે પોતે જ જો ખરેખર વિજત્વ મેળવીએ નહીં, માત્ર નામના જ પ્રાલણો રહીએ, અને તે છતાં પણ, શ્રેષ્ઠતાનો દાવો કરીએ તો હાલના આગળ વધેલા જમાનામાં આપણું માને કોણું ? ખરેખર, પ્રાલણોએ તો સૌથી પહેલું જગતું જોઈએ કેમકે તમામ વર્ણના ગુરુઓને શિર તો ધારું વધારે જોણય રહેલું છે. આપણે પોતે નહાની નહાની વાતોને આગળ કરી, પરસ્પર જુદા થઈ જઈએ તો બીજ જુટાતિઓને આપણે કર્તવ્યના કે ઉદારતાના પાઠ શીરીતે શીખવી શકીએ ? શારીરિક માનસિક અને આધ્યાત્મિક - સધળી બાબતોમાં આપણે પાયમાલીની છેક જ નજીક આવી પડ્યા છીએ”. ૬૧

અતમાં 'સતગર' આ બાવતમાં અમદાવાદી ભાઈઓને ઉહાપણું અને ગભીરતાથી વિચાર કરવાનો અનુરોધ કર્યો છે: "આશા છે કે, કારણો ગમે તે હોય નહાનાં હોય કે અહોટો હોય, તો પણ દરેક ભાગના સહમતું આગેવાનો આણા સમજના હિતની આતર પોતાનો મતસેદ છોડી દેવાની ઉદારતા બનાવશે, અને છૂટા પડી ગયેલા - તૂટીને છિન્નાંનિન કરી નાખેલા કષાયાંની આણી મળા બનાવી પોતાના સમજને નવા એકદ્વારાના બળથી દીપાવશે". ૬૨

૬ મોટે પ્રાલાણના જુદાજુદા જથ્થાઓના ગામોની યાદી પણ પ્રાચ્ય કરી પ્રગત કરવાની પ્રણાલીકાનો પ્રારંભ દ્વીજ અક્ષમાં થાય છે. નવસારીના શ્રી ભાલયેદ રવિશેકર જ્યોતિષીની "સુરત અનુભૂતિની મોટે વિપ્ર વસતિ સ્થળ"ની યાદીનો એક નમૂનો આ પ્રમાણે છે : -

"જલાલ પોર આમળી વાયેર આટ વેસમું ;
ધનો રિ થીખી વરોટિ પૂણી આવરાવમું
વલ્સાઠ નાગસારિકા મરોસિ પોસરા ગણો,
ખસડા ધર્મ સૂરતે વસે છે મોટે પ્રાલાણો". ૬૩

જાતિમાં થાયેલાં આગેવાન પુરુષોનાં ઐદ્જનક મરણોની નોંધ કેતાં 'સતગર' જુવાન મરણો પાછળ થતાં જમણવારના અનિષ્ટ પર આ પ્રમાણે વેધક કટાક્ષ કર્યો છે : "આવા પ્રસંગો આપણને કર્યો પાઠ ભણાવી શકે ? એવું તે કોણ માની શકે, કે આવા પરમ શોકના પ્રસંગો - સાંભળીને વજ જેવી છાતી પણ ફાટી જય શેવી હદ્દપારની રોકુળ વચ્ચે પણ, ધીની ધારો વહેવરાવીને વધારે કી તી મેળવવાનું ફુનિયાદારીનું ઉહાપણ બતાવશે ? પરંતુ નોંધ

૬૨. શૈજન, પૃ. ૨૯

૬૩. શૈજન, પૃ. ૩૫

લેતાં, એ ભાઈઓના મૃત્યુથી થતાં શોકમાં ઉલ્ટો પમણો વધારો
થાય છે કે, એક બાજૂથે શારીરિક સગપણ વિના જ ભાઈઓની
અભિભાસથી થોડાર અંસુ વહેતાં હતાં, અને બીજી બાજૂથે શારીરિક
સગપણના સમૃદ્ધી જનો-પોતાને શિક્ષણનો અને નિપુણતાનો, કે
વ્યવહારની કુશળતાનો ચાંદ મળેલો કહેવરાવવા છતાં - પોતાના
જીવાન અન્ધુઓના મરણના પ્રસ્તુતાનો ઉપયોગ ઉપર ધીનાં જમણ
જમાડી કી તી મેળવવામાં કરતા હતાં". ૬૪

શિક્ષિત કહી શુકૃય તેવા ભાઈઓ પણ આત્માની સફગતિ
માટે સ્થાયી પુણ્યકાર્ય કરવાનું શિક્ષણ લેવાને બદલે ધીની નદી
વહેવરાવીને જીતીરીનું રક્ષણ કરવામાં આવા આફતના પ્રસ્તુતાનો
હુરપ્રયોગ કરે ત્યારે ગમના સાચા ઊંઘયા પુરષોએ નમૃતાપૂર્વક
ખરો માર્ગ બતાવવો જોઈએ. એવી સ્પષ્ટ વાત સાગરે આ પ્રાસંગિક
નોંધ ધ્વારા સચોટ રીતે કહી છે : "આવા જીવાન મરણોમાં
પીરસાતા ધીનો રંગ અદરથી તો રાતો જ
હોય છે. અને એવું રાતું ધી જમાડિનું કે જમાડિ એ બેમાંથી એકે કાર્ય
આચ્ચ ઇથિના વશજોને તો બિલકુલ શોભે એવું કે ધટે એવું નથી જ.
એવાં રાતાં લોહી જેવાં ધી, રોડકળ વચ્ચે જમાડવાથી જ જો
કી તી મળતી હોય તો ઠસ્યરના રાજ્યમાં એવી કી તી કરતાં
નિદાની કિઝ્યત હજરો ગણી વધારે જ અકૃય છે. આપણે
અલાણોએ - શિક્ષિત મનુષ્યોએ આમ નયળાઈમાં રહેવાનું નથી.
ઓટે ચીલે હઠીલા થઈને હવે ચાલ્યા જવાનું નથી. છતાં, જો
એનાં એ જ રહીશું તો આ લોક અને પરલોકમાં જવાય દેવો બહુ જ
ભારે થઈ પડશે. શિક્ષિત મનુષ્યોએ તો પોતાનું આન્તર્યુલ વધારનું

જોઈશે. અરેણરા કેળવાયેલા હોઈયે, અને શિક્ષણની અસર જો હદ્ય ઉપર થઈ હોય તો તે આચરણમાં જ્ઞાતવી જોઈશે". ૬૫

માન્યતા પ્રમાણે ૬૬ આચરણ સમજ્ઞુધારક સાગર ના વ્યક્તિત્વનું વિશેષ લક્ષ્ય હતું એ પ્રાર્થણિક નોંધમાં જીતિના શિક્ષિત ભાઈઓને જુઠી કીતિમાં તણાયા વગર આગળ આવીને પોતાના દાખલાથી સમજને પદાર્થપાઠ શિખવવાનો અનુરોધ કર્યો છે. એ જ તર્ફી નોંધમાં ઈંદ્રો-નના રાજ હેવી બીજી અને થોડસ બેકેટના દ્વારા સાચા કર્તવ્યથી તસુ પણ વિચિત્ર થવાને બદલે પોતાના પ્રાણનું અલિદાન આપવાનો બેકેટ આપેલા જોધનું સમરણ કર્યું છે. અને સ્પષ્ટ જ કહ્યું છે કે : "જો ઓટું લાગ્યું હોય તો ઓટું લખ્યું છે એટલા માટે નહિ પણ પોતાની અદરના બળની ન્યૂનતાને લીધે જ છે ; કેમકે, જ્યારે શિક્ષિત બન્ધુઓ જાળી જોઈને જ સત્યની અવગણના કરે, અને કીતી અને માનની તૃષ્ણામાં તણાઈ જય ત્યારે જ્યાંથી ૧૭૧૨, ત્યાંથી જ ધાર આવે. આશા છે કે સત્યના અધિકારી બન્ધુઓ તો, હજ પણ કર્તવ્યપરાયણતામાં પોતાની સભિને જગ્યા કરવામાં આપર ગયેલી નહિ ગણે". ૬૬

યોથા અંકુમાં પ્રારંભમાં જ સાગરે સાચા આચી ઔદ્ઘીલ્લવનની ભાવના પોતાના ક્રીજ જવનની દિશા કાચ્ય ધ્વારા પ્રગટ કરી છે. જુઓ : -

"ઓદાર્થીપૂર્ણ વિજ-જીવનની દિશાયે !

ઇચ્છા પ્રયાણ કરવા ! પણ, ન્યૂનતા છે !

.....

૬૫. એજન, પૃ. ૪૩

૬૬. એજન, પૃ. ૪૪

હેઠોશ હૃત્કિમ બધા ૫૭૮૧ નકામા
ને હું જઈશ હૃત્કિ-જવનની દિશામાં".^{૪૭}

સવસ્તાતિના હિતના કાર્યમાં હનામી નિર્ણયો, સ્કોલરશીપ
તેમ જ અન્ય પ્રકારનાં સમારક ફોનો વહીવટ કરવાનું કાર્ય પણ
તંત્રીએ ર્વેચ્છાએ સ્વીકર્યું હતું પરિણામે "સ્વ. ગિરધરસાહ
કેશવલાલ દ્વારા સમારક ફોન", "નારાયણશીકર જેઠારામ વ્યાસ
ફોન", "સૌ. અન્નપૂર્ણા સમારક ફોન", "સ્વ. ઉજમણાઈ સમારક ફોન",
"જ્ઞાનાઈ યાદોપવિત સમારક ફોન" જેવાં સમારક ફોનો વહીવટ
એમણે કાર્યદક્ષતાપૂર્વક કર્યો હતો. "આપણી ન્યાતનાં જુદાંજુદાં
મહાં, એમનું બળ, એમની સત્તા અને દેશોનું મહાન કાર્યોમાં
એમનો ઉપયોગ"- આ વિષય પરનો હનામી નિર્ણય સ્વ. ઉજમણાઈ
સમારક નિભિતે તેમ જ "સદગુરુની સ્ત્રીનો ગૃહસંસ્કર કેવો હોઈ શકે ?"
હનામી નિર્ણય સૌ. અન્નપૂર્ણા સમારક નિભિતે તેમ જ "સંધ્યા વાનાદિ
નિત્યકર્મકાંડનું સશાસ્ત્ર અંતર રહસ્ય" હનામી નિર્ણય સ્વ. નારાયણ-
શીકર વ્યાસના સમારક નિભિતે રૂપદ્વા ચોળને લખા વ્યાખ્યા હતા.
પાછાથી હનામી નિર્ણયો માસિકમાં પણ પ્રગટ કર્યો હતા. આ
સમારક ફોનના બિનિયોગ અગેની પ્રાર્થનિક નોંધમાં પુસ્તકો વગેરેની
મદદ તેમ જ સ્કોલરશીપ માટેના જુદાંજુદાં સમારક ફોનો પણ
નિર્ણય કર્યો છે. મોટ પ્રાલાણોનું ધર્મશાસ્ત્ર "ધમરણ્ય"નું ભાષાંતર
કરાવવા માટેની વ્યવસ્થા સંબંધી બહેરખબર ચોથા અકમાં તંત્રીએ
આપી છે. અને એ રીતે એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આ કાર્ય
સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું નાહિ. ચોથા અકમાં શ્રી મહિશશીકર
હરીશશીકર શાસ્ત્રીના 'શ્રી શક્રાયાર્થ ચરિત્ર' પુસ્તકનું અવલોકન

૪૭. એજન, પૃ. ૪૨-૫૦

કર્યું છે. આ અવલોકનમાં 'સાગરે' ક્ષેણકની પદ્ધતિ પરતે આ પ્રમાણે નિશ્ચિકતાથી ટોકા કરી છે : "ખૂભિકામાં કેટલાક વિચારો મનન કરવા જોગ છે, પરંતુ ધ્યે સ્થળે ગૃહકારે પોતાના વિચારોથી પ્રતિકૂળ સિધ્યાન્ત ધરાવનારાઓ ઉપર તથા સુધ્યારા ઉપર બહુ સખ્ત ભાષામાં આક્ષેપો કર્યો છે. શાસ્ત્રોનાં સમૂહી પ્રમાણોનો ઉલ્લેખ કર્યો વિના જ આવા કરડા આક્ષેપો કરવાની પદ્ધતિ અમે પર્સિદ્ધ કરતા નથી".^{૪૮}

શ્રી ભાઈલાલ જમનાશેકર ઉપાધ્યાયની નવલકથા "દર્શા" ભાગ - ૧, ૨, ૩ તથા શ્રી ભોગની-નુદ્રાવ રતનલાલ દિવેટોચાની નવલકથા "ઉધાકાન્ત"નાં અવલોકન આઠમાં એકમાં પ્રગટ થયો છે. આ અવલોકન પરતે પ્રારંભમાં જ્ઞાનયું છે તેમ, "૨૧. ઉપાધ્યાયની આ નવલકથાનું સાહિત્યના સૂક્ષમ દર્શાવું હોય મધ્યમાં મૂકી અવલોકન કરીશે તો ધારું વધારે કહેવાની હજા થઈ આવે તેથું છે, પરંતુ ગૃહ વિવેચન એ આ માસિક પદ્ધનો વિશીષ્ટ ઉદ્દેશ છે જ નહિ".^{૪૯}
 " દર્શા નવલકથામાં વસ્તુ સંકલના અને ભાષા વગેરેમાં ઉચ્ચ
 આદર્શની કેટલીક વ્યૂહના" ^{૧૦૦} ની ટોકા તેમ જ સ્વદેશની પરિસ્થિતિનું બરાબર ચિત્ર ચિત્રરી આપવામાં 'ઉધાકાન્ત'ના ક્ષેણકનો સફળ પ્રયત્ન
 હોવા છતાં રસ્કષ્ટતિ કરનારા બે પ્રકારોની કલ્પના તેમ જ દિવેટોચાના
 કેટલાક કિલાં અને અશુદ્ધ પ્રયોગોનો નિર્દેશ વિવેચક તરીકેનું
 'સાગર'નું તાટસથ્ય સૂચયે છે.^{૧૦૧}

ચોથા એકમાં ધર્મજ મોટ હિતવધીક સમાજ, જલાવાડી મોટ
 સમાજ, સૂરત અઠૂટ વિસી, કલોલ અને સરણેજનો સમાજ તેમ જ પાચમાં

૪૮. ઐજન, પૃ. ૬૪ : ૪૯. ઐજન, પૃ. ૧૨૬

૧૦૦. ઐજન, : ૧૦૧. ઐજન, પૃ. ૧૨૮-૧૩૦

અકમાં મોટેશ્વર સમાજ, વડોદરા, મોટ ભિત્ત મંડળ કપડવણજ
વિગેરે મંડળોનો પરિયય તેમ જ રેમના ધ્વારા થતી વિસ્તીન
પ્રવૃત્તિઓનો પણ નિરૈશ કર્યો છે. એ ૧૯૦૮ના પાંચમા અકમાં
પોતાના જ ગામમાં, પોતાના જ કુટુંબમાં, દેવલોક પામેલી ૧૨
વર્ષની છોકરીના બારમા નિમિત્તે કરવામાં આવેલો જમણવાર અને
તેમાં ભાગસ્તીનાર શિક્ષક ભાઈ બહેનોની માનસદશા પર તીવ્ખ કટાક્ષ
‘૧૨ વર્ષની બળકીના બારમાના’ બઉઅં માં તરીકોનોંધમાં કર્યો છે.
જુઓ : “જ શિક્ષકો કેળવાયેલા કહેવરાવવા છતાં આવા નહાનાં
બાળકનાં બારમાના બઉઅં જમતાં પણ કાસ ન પામે એ શિક્ષકો
આપણાં બાળકોનો “મનુષ્ય” શી રીતે બનાવી શકે. એ અમારા
ખ્યાલમાં આવતું નથી. ધ્વારકાની છાપ લઈ આવનાર દરેક સાધુનાં
હદ્દયમાં સુજનતાના સંસ્કાર હોવા જ જોઈએ એવો કંઈ નિયમ નથી,
તેમ, અમને લાગે છે કે, શિક્ષણની કોલેજોના ચરણમાં એ થાર વરસ
પીલાઈ આવીને ગમે તે રીતે શિક્ષકની જીઠી છાપ મેળવી આવનારા-
ઓમાં “શિક્ષક” તરીકેની ઘરી લાયકાત કે “મનુષ્ય”ના સંસ્કાર
નહિ જ આવતા હોય”. ૧૦૨

એ પ્રાસ્તિક નોંધમાં તરીકેના હદ્દયનું ફુલ - વેદના તેમ જ
સમાજની હુંદશા કરનાર આવા શિક્ષણધારીઓ પરતે તિરસ્કાર
અને અનુકૂળપાની લાગણી પ્રગટેલી જોઈશ્યકાય છે. સરઘેજના કેટલાક
ગૃહસ્થોની મદદ ધ્વારા અમદાવાદમાં અસ્થાસ કરતા વિધાથીઓ
માટે એક બોડેઇ સ્થાપવાની યોજના અગેની સૂચના પણ એ અકમાં
છે. અનું કાર્યવાહક તરીકે તરીકેથે પોતે સ્વીકાર્યું હતું એ દિશામાં

થયેલા સ્તુત્ય પ્રયત્નોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની રહે છે.
જો કે વ્યાસેક માસ પછી જ પૂરતા સહકારના અભાવને કારણે
"સરણેજ બોડીંગનું અવસરાન" ની લહેરાત તંત્રીને કરવી પડે છે.^{૧૦૩}

અમદાવાદમાં એક મજાન બાડે રાખીને, અપ્પુરતાં સાધનો મેળવીને વિધાથીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. માસિક ૩૮. ૫-૦ દરેક વિધાથી પાસેથી ક્ષેવામાં આવતા બાકીના અર્થ માટે ઈંડ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું સાર્વ દ્વિક હિતનું આ કાર્ય પૂરતી મદદ અને અનુકૂળતા તેમ જ સહકારને અભાવે સફળતાપૂર્વક લાંઘા સમય સુધી ચાલી શક્યું નહીં.

ઇંડા અક્ટમાં જુવાન મરણોના અજુગતાં જમણવાર અંગે સાગરે કાઢક શયદોમાં આ પ્રમાણે ટીકા કરી છે : "આવાં જુવાન મરણો નિયિતે ન્યાતને જમાડવામાં આવતું મિટાન કેવળ અજુગતું છે એટદું જ નહીં પણ શાસ્ત્ર મય્યાદ અને માનવન્ન પૂર્વજોની આજા વિરુદ્ધ છે. આવા પ્રાસનાં જમણ જમાડવાથી પુષ્ય થાય છે, એવું માનવારની જુઠી દાદીની હવે બિલકુલ ટકી શકે એમ નથી. અરી હકીકતતો એ છે કે, આવાં જમણવારો કરવાથી આપણે આપણી સમ છીના વાતાવરણમાં ઉલટાં અસ્વચ્છ, અશુદ્ધ અને અસીધ્ય અસુરી તત્ત્વોળોભેરો કરીએ છીએ, એટદું જ નહીં પણ, આપણા હદ્યમાં કઠોરતા, પામરતા, રંકોથ અને અવિધાજન્ય કદેશ વગેરે વિરોધી ગુણોનાં પરમાણુઓને જાણી જોઈને દાખલ કરીએ છીએ.
... ... ન કરવાનું પ્રેત લોજન જેણું જમણ કરીએ છીએ ...
... આ તે આપણું ડાપણ કે મૂર્ખતા ?"^{૧૦૪}

૧૦૩. એજન, પૃ. ૧૨૨

૧૦૪. એજન, પૃ. ૮૫

‘આસુર ભોજનનો દ્વારા અને અધર્મ’ શીષ્ક હેઠળ આ જ તત્ત્વીનોંધયાં
સમાજના આ અનિષ્ટને કારણે થયેલી પડતીનો નિહેશ કરી સપ્ત
શાયદોમાં પ્રહારો કર્યો છે. જે તત્ત્વીના દ્વારા નિર્ણય, હિંમત સત્ય-
નિષ્ઠાનું તેમ જ પ્રવણ વ્યક્તિત્વનું દર્શાવે છે. જુઓ : “ગુલ
ભોજનના પુણ્યકાર્યને નામે જુદ્દી અને ખોટી રીતે ન્યાતો જમાડવાની
રાઠને વશ થઈ જઈ કીર્તિનો અધિક એવાં નહીં જમવાનાં જમણો
ઉપર જ ગણ્યવામાં આવે, એ હકીકતને અમે સમાજની પડતીનાં મુખ્ય
કારણોમાંનું એક ગણીયે હીએ ૧૦૫ પ્રસંગનો વિવેક પણ
છેક જ છોડી દેવામાં આવે ત્યારે જમાડું કા છિજને સાડે લાગવું
જોઈએ ? મુરોઝુલાંની મિજબાની તો પણ ચરણાં પ્રાણીઓ પણ
પસાન્દ કરતાં નથી, તો આપણે પ્રાણીઓએ પણ કરતાં પણ વધુ કુર
જડ હદ્યના થઈને, જેને ધેર મરણ થયું હોય ત્હેને ઉશ્કેરીને ત્હેની
પાસે મિજબાની લેવી એ કેટલું નિષ્ઠુર છે ? સમૃતિઓ અને શુતિઓ
તો પોકાર કરી રહી છે કે, વેદ જાણાર પ્રાણીઓને જ આત્માના
શ્રાધ્ય નિમિત્તે જમવાનો અધિકાર છે. સંગાં વહાલાંને શોકમાં
લાગ લેવાનો છે, આ શવાસન આપવાનાં છે, અને હું અના હું ખમાં
સહાય કરવાની છે. બેગાં અળેને મિજબાની ખાઈ જવાની રેથી !
નજીકનાં રાગા વહાલાં મૂલ્ય પાછળ ન્યાતો જમાડવાની ઉશ્કેરણી
કરીને વિથોળી આત્માનું કર્યું હિત કરવાનો યત્ન કરે છે એ
ઘુલાસો ન થઈ શકે રેવી વાત છે. ૧૦૬

આત્માની સદગતિનું ખર પુણ્યકાર્ય અદ્કાવીને ઉલદું પોતે
જ એ આત્મ જરૂર, એ જવાયદારી આપણે સૌને માયે કંઈ ઓઈ નથી.

૧૦૫. એજન,

૧૦૬. એજન,

ઈશ્વરના દરણારમાં આ અધર્મનો જવાય દેવાતું શું આપણને
જારે નહીં પડે ? ૧૦૭

"અમે પોતે આવાં અધર્મી જમણ જમતા નથી ને જમાડતા
પણ નથી" શીર્ષક હેઠળ તરીકીની આ ટીકા પાછળના પ્રસંગનો
ઉલ્લેખ પણ સૂચક રીતે નીચે પ્રમાણે થયો છે : "હકીકત એવી છે કે
આ પદ્ધતા તન્દીનાં બન્ધુપત્ની : શ્રી મણિભાઈ દા. ત્રિપાઠીના
પત્ની સૌ. ભવીષણેન : ૧૫-૧૬ વરસાની કવચ્ચે ખેગના પ્રાચાજનક
રોગથી આકસ્માતિક મૃત્યુ થયેલું આવા હું અદાયક પ્રસંગે અમને
કે અમારા હુદ્દુઘ્નને આપવાતું કર્તવ્ય કરવાને અદ્દે
અમારે ન્યાતને મિષ્ટાનની મિજબાની આપવી જ જોઈએ. એવું
સહમજવવા અમને અમારું ધારાં સગાઓ અને સનેહીઓ આવ્યાં હતાં.
વધારે નવાઈ નેવું તો એ છે કે અમારી પાસે આવી મિજબાની
કરવાનારાંઓ અમને એવું સહમજવતાં હતાં કે મિષ્ટાનની મિજબાની
કરવાથી કી તી વધશે". ૧૦૮

ગામની કેટલાક વયોવૃદ્ધ પુરુષોની સમિથી અમના
આત્માની સદગતિ નિમિતે શાસ્ત્રીકિધી પ્રમાણે પ્રાતસોજન કરાવી,
અમુક રકમનો વ્યય ન્યાતની કેળવણીમાં કરવો એવી યોજના ન કરી
થઈ હતી. પરંતુ તે પ્રમાણે થઈ શક્યું ન હે. આ પ્રસંગ વિશે સાગર
ટીકા કરતાં આ પ્રમાણે લખે છે : "કર્તવ્ય નિષ્ઠામાં સરળતા
અમલમાં મૂક્તાય તો જ એ કાચો સમ છિમાં હેશની અસર કરી શકે
છે, એવી અમને સરળતા તરફ આસ્થા હોવાથી, અમે સહામેનાં
વિરુદ્ધ મનનાં સમ્યાંધીજનો સાથે હસ્તામી અકુલે ચાલી, રાતોનો

૧૦૭. એજન, પૃ. ૮૬

૧૦૮. એજન, પૃ.

કુદુપયોગ કરવાનું ઉચ્ચિત ધાર્યું નહીં રેમ અમે પોતે ખોટે બીજે
ચાલી જનાર હિંમત વિનાનાં વાયલાં સમ્બન્ધીઓ સાથે
ધસઠાયા જવાનું પણ પસન્દ કર્યું નહીં. અમે એક જ્યૂહે જ મારે
વળવાનું પસન્દ કીધું છે. વહિવટ, રઠિ અને ન્યાય પુરઃ રસર
અમારા પોતાના નામથી અમે ન્યાતને અમે અમારા સમ્બન્ધીઓને
અને બીજાઓને અમારા નામથી આમન્દાણ નહીં કરવાની ખાસ તાકીદ
કીધી હતી, એટદું જ નહીં પણ અમે પોતે પણ તુલ્લી સરખેજમાં
હાજર હોવા છતાં, એ અધર્મના જુલમી બનાવમાં બિલકુલ ભાગ
નહીં કેવાની અડગ પ્રતિજ્ઞા પાળી હતી. લાદુ કરવા જ જોઈએ,
એવી સહાયે ઉસેલા સેનાનીઓની ભી અનુપ્રતિજ્ઞા વખતે કંઈક
વિપરિત પરિણામ લાવે તો એવું પરિણામ એ વિજય ગણ્ય નહીં,
એમ સહમજ અમે અમને વ્યાજભી લાગતું કીધું છે". ૧૦૬

આ પ્રસંગ ધ્વારા પોતાને પ્રાપ્ત થયેલા અનુભવોથી અને
પાછળથી પહેઢા તેના પ્રત્યાધાતોને કારણે નિરત્યાહી બની સામજ
સુધીએટાના કાર્યને પડતું મૂકી 'સાગર' સમજાયુધારસ્થા સરખેજ છોડી હે છે.
ઓગષ્ટ ૧૯૦૮થી માણુકેશ્વર મહાદેવ, અમદાવાદમાં રહેવાની
વ્યવસ્થા કરી લે છે. આ પ્રસંગે લાણાયેલા કાંબ્ય સત્ય વિજય માં
‘તો યે ઉરે ના જે કલમ હજેત, સત્ય, હનેહ અનુસરે’ની નીતિની
પોતાની પ્રણાલિકા ચાદુ રાખે છે.

‘આ પણી જાતિમાં સ્વર્ણી કળવણી’ શીર્ષક હેઠળ પ્રાર્થણિક
નોંધમાં સાગરે સ્વર્ણીઓના કર્તાંય વિશે દશવેલો આ વિષય પરનો
શૈમનો મૌલિક દાખિલો રજૂ કરે છે : “સ્વર્ણીએ માત્ર નિશાળની
જ મિસ્ટ્રેસ નહીં, પણ, ગૃહરાજ્યની મિસ્ટ્રેસ બનવાનું છે અને જરી

રીતે, પતિના હદ્યમ નિદરની મિસ્ટેસ થવાનું છે.

કેળવણી માટે દેખાવની જ નહીં, પણ, અનદરની હોવી જોઈએ.

આસ મહત્વ હદ્યના શિક્ષણને આપણું જોઈયે. પરમેશ્વરની દ્યાથે આપણી બહેનોનાં હદ્યોમાં શિક્ષણના પરા આન્તર સીસ્કુલર જન્મ પામી, એમનામાં ખર્દી સ્ક્રીટ્લ પોષાય અને એ ધ્વારા ભાવિતું વિશેષ દીક્ષિતમાન નિવાર એ જ અમારા મનનો મનોરથ છે".^{૧૧૦}

દેખો માટેના પુરસ્કાર અગે પૂછાવતા એક મહેતાજ બન્ધુને ખરો ખુલાસો આપતી નોંધ આ ક્ષેત્રમાંના દરેકને માટે એટલી જ સાચી ઠરે છે. જુઓ : "જાનિ સેવાના વિકિત ક્ષેત્રમાં -હાનકડી કલમ માત્રના જ હથિયારે સ્વાપણ કરી ઊજૂમનાર મનુષ્યો પેસ। કદીયે મેળવી શકતા નથી ! આ તો સેવાનું પવિત્ર ક્ષેત્ર છે, અને એવું અટપણું વિલક્ષણ ક્ષેત્ર છે કે, એમાં કમાવા કરતાં ખોવાનું ધર્ઘુ વધારે હોય છે ! પેસ। વિના આ સેવા જો તહેમને નિઃસ્વાદ જ લાગતી હોય તો, છેવટે અમારી સલાહ છે કે, આપે સ્વજ્ઞાતિના બીજી ધર્થાધારી ભાઈઓને અપીલ કરી નાણાનું એક સારું ફોડ એકદ્વારા કરવું, અને મહેતાજ દેખકો માટે અમારે સ્વાધીન સોંપણું".^{૧૧૧} સેવાના ક્ષેત્રમાં સાચા દેખધારીઓને જ પ્રવેશ મળે તો રાજકુરણના ધણા પ્રસનો હલ થઈ શકે એ સમજી શકાય તેમ છે. મહેતાજ દેખકો માટે એમની વિત વિરહ વેદતાનું નિવારણ કરવા માટે અપીલ કરી ફોડ એકદ્વારા કરીને પોતાને સોંપવાનો ઉપાય સાગરે કરોક્ષયુક્ત શૈલીમાં એમને બતાવ્યો છે.

મોદુલ પ્રાણાણ શુભેચ્છિક મંડળના પ્રાણરૂપ શ્રી લક્ષ્મીરામભાઈને ત્યારું મરણ થતાં અસુર ભોજન ન કરવા માટે જુન માસમાં સામુદ્રાચિક

૧૧૦. એજન, પૃ. ૧૦૫

૧૧૧. એજન, પૃ. ૧૦૪

વધારો પ્રગત કરી અપીલ કરી હતી. પરંતુ તેને પૂરી સફળતા મળી નહીં. આ વૃત્તાન્ત અગે સાગરે જણાવ્યું છે કે : "અમારી અપીલ છેક જ નિષ્ફળ નિવઢી નથી. અપીલની સુનાવણી થઇ છે.
 એ વચોવૃધ્ય ગૃહસ્થે અસુખોજનના અનિષ્ટ રિવાજના કિલ્લાને તોડી પાડવાને પોતાનો મજબૂત હાથ અમારી સાથે શાભિલ કીધો છે. ... આ વૃત્તાન્ત સરઘેજના સુધારાના ઈતિહાસમાં ખાસ ઝોટે અક્ષરે નોંધી રાખવા જોગ છે". ૧૧૨

દેશકાળની પરિસ્થિતિને અનુસરીને પ્રખના કર્તવ્ય પરતે તંત્ત્રીએ રજૂ કરેલા મનનીય વિચારોમાંથી થોડાંક અવતરણો જોઈએ. સમય બંધુ જુદો છે, હું અને મહારાજાં કરીને પેસી રહેવાનો નથી. સૌથી સાથે મળીને, સ્નેહભાવથી જોડાઈને કંઈક સેવા કરવાની છે. બંધુ દીર્ઘદિન વાપરવાની છે. જ્માનો અન્યનનો છે. ઉષેરાઈ જઈને મતસેદની દિવાલો બાંધવાની નથી, પણ એ જવરદસ્ત દિવાલોને શાન્તિથી સહી સહીને તોડી પાડવાની છે. ખૂલવાન્નું બધું એકદમ ભૂલી જવાન્નું છે, અને, નજર બંધુ લાંબી પહોંચાડવાની છે. આ પણી લાયકાત વધારવાની છે, અરા હિજ થવાન્નું છે, અને સૂક્ત વાતાવરણમાં રસ અને આદૃતા રેડી ચુવાન અન્ધુઓએ કર્તવ્યપરાયણતાના ક્ષેત્રમાં હવે ધૂમવાન્નું છે. પોતાનો જ વિચાર ન કરો, પોતાના ભાઈઓનો અને ત્હેમના હિતનો પહેલો વિચાર કરો. સમાજનું હિત થતું હોય કે દેશસેવા થતી હોય તો પોતાનો "પ્રિન્સિપલ" એ સેવાના મહાન યજ્ઞમાં હોમી દો ! ભસ્મિભૂત કરી દો. અને એ આદૂતિ વ્યર્થ નહીં જ જય ! સચ્ચાઈની હેડાઈ હેડો ત્હેમાં કોઈ વારતું નથી, "સત્ય"ની ઓળખવાને પહેલાં અધિકારી થાયો ! "મહારાજ જ કહેલું સાચું છે", એવો હુરાગુહ કરવાનો તો આ વખત જ નથી સૌનો ઉદ્દેશ એક સરખો જ છે". ૧૧૩

"સૌને સૌના અધિકાર પ્રમાણે સેવા નો ભાર ઉપાડવા દો
અને પરિણામે વિજય થશે. ઉત્તાવળ વિલકુલ ન કરો. ઉત્તાવળ તો
અનાવસ્થા માંથી જન્મે છે. આપણે તો આસ્તિક પ્રભ છીએ. કર્તૃવ્ય
કરવાનો જ આપણાને અધિકાર છે, પરિણામનો નહીં".^{૧૧૪}

શ્રી બંકીમણીએ આપેક્ષા વન્હેમાતરમના દિવ્યમન્જું રહસ્ય
સમજવતી નોંધ રાખ્યકિંત પરલ્લેના 'સાગર' ના મૌલિક વિચારને
યથાર્થ રીતે અભિવ્યક્ત કરે છે: "બેશક, દરેક હિન્દી બાળકે
વન્હે માતરમ મન્જુના સાચા ઉપાસક થંડું જ જોઈએ અને એમાં જ
એના જન્મનું સાર્થક છે, જવનની સફલતા છે, અને એમાં જ એની
મુક્તિ છે; પરંતુ, એ મન્જું સહમજપૂર્વક શાન થંડું એ સૌથી પહેલું
જરૂર નું છે".^{૧૧૫} "આપણાં સંકુચિત હદ્યોમાં સેવા મુદ્દ્ય જન્મે અને
આપણી પામરતા, કઠોરતા અને જતની મમતા દૂર થાય અને
આપણાને ચૌદાર્થી, વિશાળતા, સહિષ્ણુતા, સ્નેહ અને અસેદના પરમ
ગહન પાઠો સુભ્રિત થાય એ માટે એ મન્જું તત્ત્વોનું તત્ત્વ છે, સારમાંનો
સાર છે અને એનો સ્નેહ પ્રજવલન્ત મહિમા અપાર છે".^{૧૧૬}

વન્હુઓ, ભૂમિ તો જડ છે, પવરા માટીની બનેલી છે, અને
વન્હન એટસે ? ભરત ભૂમિતાનાં તમામ બાળકોને અલિ સ્નેહપૂર્વક
યાહંથી અને એમની સર્વ વિધ સેવા કરવી એ જ ભરતભૂમિ માતાની
સેવા છે. આપણે સૌ એક જ માતાનાં આત્મ જ છીએ અને પરસ્પર
સહોદર સેવા કરવાને જન્મયાં છીએ. આવી અનુપમ સેવામાં જેટલા
ખોગ આપવા પડે તે સધળા આપવાને સન્તોષથી તૈયાર રહેલું એ જ
કર્તૃવ્ય છે. આવી એકતા અને અસેદની સૂચના વન્હેમાતરમ ના" ધ્વનિ-
તાર્થ છે".^{૧૧૭}

૧૧૪. ઐજન, પૃ. ૧૦૮ : ૧૧૫. ઐજન, પૃ. ૧૧૮

૧૧૬. ઐજન, પૃ. ૧૧૬ : ૧૧૭. ઐજન, પૃ. ૧૧૬

સાચી સ્વદેશસ કિતનું રહસ્ય પણ સાગરે આ પ્રમાણે સમજાવ્યું છે : "આ પણો સ્વદેશી ભાઈયાનો દેશમાં હું અની હું અની છે અને આ પણે અમન્યમન કરીયે છીએ ! આ પણે ન્યાતવરા કરીયે છીએ - ઉપર ધીના જમણ જમી ખૂબ તૃપ્ત થઈયે છીએ, અને સ્વદેશમાં ભૂખાને ભોજન અને ગરિબને પોણા આપવામાં આ પણે પાછાં પગલાં લરીયે છીએ ! " દેશમાં કોઈ લૂલાં છે, કોઈ કાગડાં છે, કોઈ આંધળાં છે, કોઈ ગરીબ છે, ... આ સૌં સહોદર વર્ગી છે. અને એમને દવાની કે હુણાની મદદની જરૂર છે. જૂઠાં અભિમાન ત્યજ દઈયે, આ પણામાં વન્ધુત્વની ખરી લાગણી ઉધતી છે તે જગ્યાત કરીયે, અને હોલવાઈ ગયેલો જુનો સનેહ અઠિન ફરી પ્રજવાનિત કરી એકવ્યતાનું બણ મેળવીયે તો આ પણે માટે શું અશક્ય છે ? આ પણે નનદનવનના મહેલમાં મહાલવાને અધિકારી થઈ શકીયે પણ પ્રયત્નો તો કમર કસીને કરવા પડે અને પરસ્પર રહાવાનું અને રહેવાનું વ્યાલીખ પહેલું મેળવવું પડે". ૧૧૮

સાચા સ્વદેશ ભક્તનાં હદ્ય તો બીજી સ્વદેશી સહોદરને હું અની જોઈ હું અથી કમ્પી ઉઠે - ઇવી જય અને એ પોતે સુધી રહી શકે જ નહીં - સ્વદેશ સેવાને ઝુંડો તો ભગવો છે, અને સ્વદેશસ કુત થવા માટે આ પણે આ પણો હદ્યમાંથી સ્વમત, સ્વમાન અને સ્વસ્નેહને એક દમ દેશનિકાલ કરી હદ્યને ભગવાં કરવાં જોઈયે ; અને જયાં સુધી આ પણે એ અન્ધારાં હૂર નહીં કરીયે, ત્યાં સુધી દેશસેવાના પરમ પવિત્ર યજ્ઞમાં આ પણે બિલકુલ ઉપયોગી થઈ શકીશું નહીં. શાંખેક પાંડિત્ય છોડી દઈયે અને જ્ઞાનું આચારમાં મૂકીયે તો જ કર્યે થઈ શકે. દયાલુ પરમાત્મા આ પણને સૌને સાચી સ્વદેશ સેવાના રૂપ પાઠ શિખવો એ જ અમારું ઈ ક્રિયત પ્રાપ્ત વ્ય છે". ૧૧૯

બીજ વર્ષમાં માસિકનું નામ મોટ પ્રાલણ રાજીને તેના જવનસૂટ તરીકે સત્ય વિજ્ય કાચની પદ્ધિતઓ મુખ્યપૃષ્ઠ ૫૨ પ્રગટ કરવાની પ્રણાલીકા શરૂ કરી હતી. બીજવારના પ્રથમ અક્માં પ્રાસાદિક નોંધમાં સાગરે જણાયું છે કે : "મોટ પ્રાલણની સમસ્ત સમ જીવમાં હિતના કે સેવાના કર્તાભ્ય વિચારનો એક અદ્ધ્ય પરમાણું ગમે તે રીત્યે પણ સંચાર પામી શકયો હોય તો આ પદ્ધને વેઠાં
પહેલું નુકસાન તે નુકશાન નહીં પણ તહેનું અહોસાચ્ય છે.
આપણી મોટ પ્રાલણની સમ જીવમાંથી અવનત સ્થિતિનો અરો ઘયાલ જો એક પણ હદ્દયને આભ્યો હોય, હાલની દશાથી એક પણ હદ્દયમાં આધાત લાભ્યો હોય, લાગણીનું સહજ આદોલન માત્ર પણ જો એ કે હદ્દયને પહોંચી શક્યું હોય તો બેશક, આ પણ કરેલું કંઈકપણ
કામ એણે વેઠેલું કંઈક પણ હોય, તો તે સાર્થક છે". ૧૨૦

આ અક્માં તંત્રીએ લખેલા શ્રી ગિરધરલાલ કેશવલાલ દ્વારાં અને શ્રી પ્રાણશેકર ગૌરીશેકર હોરાનું સંક્ષિપ્ત જવનય રિચ તેમ જ મિ. ડાયલ્યુ. ટી. સ્ટેડના સ્નેહ વિષયક વિચારો અને દેખકનો ધર્મનામક દૈખ ખાસ ધ્યાન એણે છે. ફેલ્લાંટોથી મે ૧૯૦૮ ના ૨-૫ લેગા
અક્માં શ્રી દાણભાઈ શુક્લ તેમ જ તંત્રીના પેતાશ્રી શ્રી દામોદરદાસ માસ્તરનું જવનય રિચ પણ દેખક સાચી સરળ છતાં સચોટ પ્રાસાદિક ગધશૈલીનો ચથાર્થી પરિચય કરાવે છે. શ્રી ગોકુલદાસ શાસ્ત્રી પાસે ધમરણયનું ભાષાન્તર તૈયાર કરાવી તેમાંથી કેટલોક ભાગ પણ પ્રક્રિયા કર્યો છે. ધર્મરણયનું મહત્વ દશાવતી તંત્રીની પ્રસ્તાવના આ શાસ્ત્રગ્રન્થ પર મહત્વનો પ્રકાશ નાણે છે.

૧૨૦. ^૬ મોટ પ્રાલણ શુક્લશેકર, વર્ષ ૨, પૃ. ૬

‘મોટ પ્રાલણ શુભેચ્છક’ અને ‘મોટ પ્રાલણ’ માસિકના તંત્રીલેખક તરીકે સાગરે મોટ પ્રાલણ સમાજની સુધારણાની દિશામાં મહત્વનો ફળો આપ્યો છે. સાગર ના વ્યક્તિત્વના વિશિષ્ટ ગુણો -
તટસ્થતા, નીઠરતા, નિષ્પક્ષપાત જરૂર વલણ, અને સત્ય નિર્ણય -
તેમ જ સરળ, પ્રાસાદિક અને માસિક શૈલીનું દર્શાવતી તંત્રીનોંધો
પરથી જોઈ શકાય છે કે માત્ર દોટ વર્ષની મોટ પ્રાલણ શુભેચ્છક ના
તંત્રી તરીકેની કારક્રમીમાં પણ સાગરે મોટ પ્રાલણ સમાજ સુધારણાની
દિશામાં મહત્વનો ફળો આપ્યો છે.

‘જાનસુધા’ ના સંપાદક તરીકે ‘સાગર’ :-

ઇ.સ. ૧૯૦૮-૧૦ - એ વર્ષ દરમ્યાન સાગરે એમના અનન્ય
મિત્ર શ્રી રમણભાઈ નીલકંઠ વતી એમની સમાજસુધારણા વિષયક તેમ જ
ઈતર પ્રવૃત્તિઓનું ભારણ વધી જતાં ‘જાનસુધાના તંત્રી’ તરીકે કાંઈ
કર્યું હતું ‘મોટ પ્રાલણ શુભેચ્છકના’ ઓક્ટોબર ૧૯૦૮ અંક ૧૦માં
‘જાનસુધા’ માટે આ પ્રમાણે અહેરાત પ્રગટ થઈ હતી. “જાનસુધા -
આ માસિક પત્ર કેટલીક મુહૂર થયાં થનિય મિત થયેદું હતું પણ હવેથી
તેને નિયમિત રીતે પ્રસિધ્ય કરવાની યોજના કરવામાં આવી છે.
ચાલુ વર્ષના છ અંકો પ્રસિધ્ય થઈ ગયા છે, પણ અંક લગભગ તૈયાર
થવા આવ્યા છે, અને ત્યાર પછી દર માસે અંક પ્રસિધ્ય થશે”.

ગુન્થ અને ગુન્થકાર ભાગ રમાં સાગર ની જવનરેઝ પ્રગટ
થઈ હતી. તેમાં નીચે પ્રમાણે આ અગે નિર્દેશ થયો છે : “કેટલોક
વખત તેથો ગુ. વ. સોસાઈટીની ઓફિસમાં ગુજરાતી કોષના કામમાં
રહ્યા હતા. તે અરસામાં તેમણે કલાપી વિષે કેટલાક મનનીય લેખો

લખયાં હતા. તેમણે "જાનસુધાનું સંપાદનકાર્ય કર્યું હતું લગભગ એ
વર્ષ સુધી તેમણે "મોટ વ્રાહણ" નામના માલિક પદ્ધતિ રેખી થાંયું
હતું". ૧૨૧

આ સ્થિવાય બીજુ પુરાવા મળતા નથી ઈ.સ. ૧૬૦૮ થી
૧૬૧૦ના "જાનસુધાના અકોમાં સાગર" અને "કુંજ" ની કૃતિઓ સાચેષ
પ્રમાણમાં પ્રગટ થઈ હતી. એ ઉપરથી પણ આ હકીકતને સમર્થન
મળે છે.

"જાનસુધા" ના સંપાદનમાં સાગરે આ પેદી સ કિય સહાય
શ્રી રમણસાઈ નીછકોઠના અગત મૈદ્વીભય સંઘદોત્તુ ધોતક અની રહે છે.

સદ્ગુરૂવું તિની "સાગર" ની બાર પુસ્તિકાંશો

: ૧ : મુમુક્ષુ વિચારણા : -

ઇ.સ. ૧૬૨૬-૨૮ના વધો દરમ્યાન સાગરે બાર પુસ્તિકાંશો
લખી છે. આ પુસ્તિકાંશોમાં સૌથી વિશેષ અગત્યની "મુમુક્ષુ વિચારણા"
છે. "મુમુક્ષુ વિચારણા" ઇ.સ. ૧૬૧૮માં કીમના શ્રી પુરુષોત્તમદાસ
રાણિઓદાસ પર લખાયેલો લાયો પત્ર છે. આ ત્યાંથી માટે
મુમુક્ષુએ શું કરવું જોઈએ ? એ અંગે વિસ્તારપૂર્વક લોકશોય શૈલીમાં
સાગરે ભર્ગદર્શન આ ખૂબુ છે અને પરમાત્મા પ્રત્યે અન્ય પ્રેમ, શર્ધા
અને ગુરુભક્તિ ધ્વારા પ્રથળ પુરુષાર્થ આ દરીને જવનસાફલ્ય કરી
દેવાનો અનુરોધ કર્યો છે. આ પુસ્તિકાની સાતમી આવૃત્તિમાં
પ્રસ્તાવનામે જણાવ્યું છે તેમને : "આ પુસ્તક મુમુક્ષુઓ માટે ખૂબ
ઉપયોગી નિવડયું છે". ૧૨૨

૧૨૧.

૧૨૨. મુમુક્ષુ વિચારણા, પ્રસ્તાવના, પૃ. ૧

પદ્મના વારભમાં યુક્તિલઠની ભૂમિતિ ભણવા માટે જેમ કોઈ
જુદો રાજમાર્ગ નથી તેમ મુમુક્ષુ માટે હરિનામના જ્યે વગર અન્ય
માર્ગ નથી એ વિગતે સમજાવ્યું છે. રૈસ ૧૨૩ખી ક્રિદોષના રોગીને
માર્ગ વતાવનાર શુકુરપી વૈધનું મહત્વ પણ સમજાવ્યું છે. ૬૪૧ ન્તરોદી
ધ્વારા 'સાગર' સમજવે છે કે આ રોગીની માફક ગુમુક્ષણે પણ અમુક
પ્રકારની પરહેજ પાળવી પડે છે, જે વિના અન્યમાર્ગ નથી. ૧૨૩

મુમુક્ષુતા જ્ઞાત કરવા માટે શુકુની સૂચનાનુસાર પોતાનું જવન
ધાર્મિક વાતાવરણયુક્ત વનાવવા માટેના નિયમો પણ રાગરે વતાવ્યાં
છે. ૧૨૪ પુરી ચોવ્યતા પ્રાચ્ય થતાં સદગુરુ આપોણાપ આગળનો
માર્ગ વતાવવા માટે પ્રૂત્યક્ષ થાય ગેમ ગુંડ સ્વાનુઃસવ વડે ઐમણે
દશતાપૂર્વક કહ્યું છે. ૧૨૫

યુદ્ધિવાદી યુગમાં રાગરે પરમાત્મા પ્રત્યેના અનન્યપ્રેમ -
અકૃત અને શિદ્ધાં વિના માર્ગમાં આગળ વધી શકાય નહીં એ
વિશદતાથી સમજાવ્યું છે. જુઓ "પોતાની યુદ્ધિને અને પોતાની
દલીલોને પણ જે પ્રીતિમાં પેસવાની જગા જ મળે નહીં, એ પ્રીતિનું
નામ શિદ્ધા છે; આવી શિદ્ધાયુદ્ધિ બધી બાયતો કરતાં ઉથી છે;
કેમકે એ દૈવી પ્રકૃતાની ભાતા છે". ૧૨૬

મનને હરિનામમાં લીન કરી દેંનું એ જ ગાયાં માર્ગ છે.
જુઓ : "વારંવારના જ્યે અને નામસમરણથી અને વારંવારના એક જ
મનનથી એમને તો શ્રી હરિના નામનું ગેલું જ દેલું લાગી ગયેલું કે
એમના મન અને યુદ્ધિને બીજી બાયતોમાં રસ પડેજ નહીં અને આપણે

૧૨૩. મુમુક્ષુ વિચારણા, પૃ. ૫-૬

૧૨૪. શૈજન, પૃ. ૭-૮ : ૧૨૫. શૈજન, પૃ. ૬ : ૧૨૬. શૈજન, પૃ. ૧૦

પણ એવી જ દેશની એ જ ઉપાયથી મેળવી શકીએ ૧૨૭ - અનુભવી શકીએ".

પરમાત્માનું અનન્ય વિસે સમરણ, ભજન અને ગેનો જ પરમ-
પુરુષાર્થ આદરો જીવનધ્યેય પ્રાપ્ત કરવા માટે 'સાગર' આ પ્રમાણે
ઉદ્ઘોધન કરે છે : "કમર કસીને ભજન કર્યા વિના ભવસાગર કોઈ
તરી શક્યું નથી અને તરી શકે નહીં અને દિલને અરો રંગ ચડાવ્યા
વિના તો કોઈનું ભજન ફળયું નથી અને ફળી શકે નહીં. . . .
હૈયું કાયમનું હરિરણી થાય એવો આશ્રમપૂર્વક જપ અને એનું વારેવાર
ચિન્તનમનન અને દ્વીકરણ આવ શક છે". ૧૨૮

પશ્ચિમની કેળવણીના નશાથી વ્યામોહ પાગેલા વિત્ત માટે
વિવ્યુર્વક રામનામના જપ ધ્વારા માર્ગમાં આગળ વધવાનો ઉપાય
સાગરે વિગતે દર્શાવ્યો છે : ૧૨૯ "બધાં જ સંતો અને બધાં જ શાસ્ત્રોને
દ્વારો પ્રકારે એક જ વાત કહેવાની છે કે જીવાત્માણે પરમાત્માના
નામમાં ગમે તે રીતે ધેલા થઈ જવું પોતાના
હૃદયની વિશુદ્ધ અને નાશવંત પદાર્થો તરફ દિલની અનાસ કિંત શે
તો હરકોઈ સુજ મનુષ્યનો ધર્મ છે. પ્રલુના પ્રેમ
વિના અરો તૃપ્તિ કોઈ પામી શક્યું જ નથી અને પામી શકે પણ
નહીં". ૧૩૦

'મુમુક્ષુ વિચારણાના અતમાં સાગર કહે છે તેમ : "જીવાત્માણે
પરમાત્માનો સ્વાતુલ્લવ પોતામાં થવાને શુશુ કરવું જોઈએ શે ગહન
પ્રદાનની એક જ બાજુ એટલે ભક્તિની જ બાજુ થાપણે ઉપર ઉપરથી
આ પત્રમાં વિચારો છે. માનવું અને કરવું એ મુમુક્ષુના

૧૨૭. એજન, પૃ. ૧૨
૧૨૮. એજન, પૃ. ૧૫
૧૨૯. એજન, પૃ. ૧૭
૧૩૦. એજન, પૃ. ૧૯

યાહેતા દરેક જવાત્માનું અનિવાર્ય કાર્ય છે." ૧૩૧ સાગરે જવાત્માએ પોતાના ચેંચળ મનને જગતની નાશર્વંત બાબતોની પ્રીતિમાંથી પ્રભુની પ્રીતિમાં શી રીતે વાળી શકાય એ જ મહત્વનું માને છે અને તે અગેનો સરળમાર્ગ સાગરે આ પુસ્તિકામાં સચોટ અને લોકખોર્ય શૈલીમાં દષ્ટાન્તો આપી વિગતે સમજાવ્યો છે. પત્રને અતે 'સાગર' જ્ઞાને છે તેમ : "ગુરુ અથવા ઉપદેશક થવાનું પોતાને ગમતું નથી તેમ છતાં અલે દખાવે ગિદ્ધતાના ઇપમાં ઉપયોગી થવાના ઉદ્દેશથી જ થા પત્ર તેમણે લખ્યો છે". ૧૩૨

સ્વર્તંદ્ર રીતે પુસ્તિકાડેપે પ્રગટ થયેલા આ વિસ્તારી પત્ર 'મુમુક્ષુ વિચારણા' માં સાગરે સ્વાત્માભવ વહે સાદી, સરળ, સચોટ અને લોકખોર્ય શૈલીમાં ભક્તિમાર્ગનું રહણ્ય સમજાવ્યું છે. કોઈપણ મુમુક્ષુને ઉપયોગી થવાનો પત્રલેખકનો હેતુ જીધ્ય થયો છે એ આ પુસ્તકની સાત આવૃત્તિઓ થઈ છે કે પરથી જોઈ શકાય છે.

: ૨ : સનાતન વિચારણા : -

સનાતન વિચારણા નામક ઇ.સ. ૧૯૨૬માં પ્રસ્ત્રે થ્ય થયેલી નાની પુસ્તિકાની પ્રસ્તાવનામાં રાગરે પોતાના તખલ્લુસનો અર્થ આ પ્રમાણે સમજાવ્યો છે : "સાગર એટલે મન્વતીત - માનવ પર એકતાનું પણપાત્ર આવો અર્થ એડ બ્રહ્માંડ નિમિતે હેઠાં સાગર એટલે સમાનતાનો જીન્યું આવો અર્થ મહાવિરાટ નિમિતે". સનાતન વિચારણા નું સારુંઝાત્વ સમજવતાં પ્રસ્તાવનામાં સાગર પ્રેમનો યમ નિયમયુક્ત વ્યાત્ર વિધાના શાસ્ત્ર તરીકે ઉલ્લેખ કરે છે.

૧૩૧. શેજન, પૃ. ૩૬

૧૩૨. શેજન

પ્રેમ અને ધર્મનું અદવૈત રામજીવતાં "સાગર" લાક્ષણીક શૈક્ષિકમાં કહે છે કે :
 "પ્રેમ અને ધર્મ એવી હોઈ બે જીન વિથિતિઓ છે જ નહીં ; ...
 ... એક સાચો અદવૈતવાદી એ સમર્થ પ્રેમવાદી છે અને એક સાચો
 પ્રેમવાદી એ સમર્થ અદવૈતવાદી છે". ૧૩૩

પ્રેમ અને પ્રજ્ઞાન એટલે જ સાચી પૂર્ણતા બન્નેનું અદવૈત સધાય
 ત્યારે જ સ્વાતન્ત્રયાવ પૂર્ણતાએ પહોંચે એ સમજવતાં "સાગર" દાખિંતશૈક્ષિકમાં
 આ પ્રમાણે કહે છે : "પ્રેમ અને પ્રજ્ઞાન એટલે જ ગોળી વેદવિધા અને
 આ જ પ્રાણનું પ્રાણ વિના બીજું દર્શિતીન છે, અને બીજ વિના
 પહેલું અપણ છે". ૧૩૪

"સનાતન વિચારણા" ના પ્રારંભમાં પરમાત્મપ્રેમ એ જ સાચો
 ધર્મ છે. પરમાત્મપ્રેમ વિના અન્યધર્મ હોઈ શકે જ નહીં એ સમજવવા
 માટે ધર્મની વ્યાપ્તયા લાક્ષણીક રીતે "સાગર" આ પ્રમાણે અપે છે :
 "જીવાત્માને પહતાં ધારણ રાખે, ઝીલી રાખે એ ધર્મ તાત્પર્ય કે
 પરમાત્માના સુંધરમાં જીવાત્માને નીચે પડવા હે નહીં પણ પરમાત્મામાં
 જ દુંધ રાખે એ ધર્મ". ૧૩૫

પ્રેમ અને વૈરાગ્ય એવી બે જુદી દ્શા વસ્તુમાં નથી. સાચો
 વિરાગી એ જ સાચો રાગી-પ્રેમી હોઈ શકે. વેદાન્તની ભાષામાં
 પ્રેમ અને વૈરાગ્યનું સ્વરૂપ વસ્તુતઃ જીન નથી એ પણ સાગરે વિગતે
 સમજવ્યુ છે. ૧૩૬ પ્રેમ અને જીવાન એવી જીન દ્શા પણ હોઈ શકે નહીં.
 સાચો પ્રેમી, સાચો જીવાની પણ છે. ભક્તિજ્ઞાનનું અદવૈત "સાગર" આ
 પ્રમાણે સમજવે છે : "પ્રેમ અથવા ભક્તિ અને જીવાન એ બે જુદાં રહેતાં
 નથી. સાચો રાગી એ સાચો જીવાની પણ છે. રાગી એટલે પ્રેમનાં

૧૩૩. "સનાતન વિચારણા", પ્રસાદબના, પૃ. ૩

૧૩૪. એજન, : ૧૩૫. સનાતન વિચારણા, પૃ. ૧

૧૩૬. એજન, પૃ. ૨

મહાસાગરમાં હુણી ગયેલો - ખોવાઈ ગયેલો - જેને પોતાનું
જુહુ અસ્તિત્વ છિતમાં છે જ નહીં બેબો, એટસે જેણે વિરીવબ્યાપી
આત્માનો સર્વત્ર રાક્ષાટકાર કર્યો છે. અને જેણે અને જ એક
સાથું અસ્તિત્વનું તત્ત્વ જોયું હૈ. બીજું બધું જેણે અવસ્થું છિતમાં જ
નથી, બેનું બધું હૈ". ૧૩૭

પરમાત્મપ્રાપ્તિ માટેનાં બે સાધનો પ્રેમ અને શ્રદ્ધાનું
મહત્વ દર્શાવતી 'સાગરની લાક્ષણિકશૈલી જુણો : "પ્રેમ એ
ભગવાનનો બાપ છે, અને શ્રદ્ધા એ ભગવાનની જનેતા છે, અને
ભગવાન પોતે અનન્તપ્રેમ અનન્ત આનંદ છે. સનાતન શાન્તિ છે !" ૧૩૮

પ્રેમ અને શ્રદ્ધા ધ્વારા હુનિયાદારીનું ઉહાપણ છોડી
દેનાર આત્માનુભવી બને છે. 'સાગર' સ્વાનુભવ વહે આ સત્ત્ય
લાક્ષણિક બાનીમાં આ પ્રેમણે રજૂ કરે છે : "ભગવાનનો રામસાગર
ભોગવવને પ્રેમને અને શ્રદ્ધાને બન્નેને એ દૃપ્તિના જોડાને અદરના
કેવળ એકાંત ઓરડમાં એકઠાં રાખવા જોઈએ અને પ્રેમને મરજ
માડક ઘૂણ છૂટથો મનસર ઘેદવા હેવો જોઈએ. હરકત ચા અદેલ
અચે રેને લાત લગાવો અને હુનિયાદારીનું ઉહાપણ એકદય સાગી
જશે". ૧૩૯ શ્રદ્ધાકુમારી પ્રેમદેવતનું ધર અંડે
છે. શ્રદ્ધાદેવી રૌખાંયવન્તી થાય છે અને જ્યોતીર્દ્ધપુરુષાને
જણે છે ! અને ભગવાન બાલકુણ્ણાનાંપર અથવા ગ્રીકપુરાણો જેને
અમર બાલક કહે છે તે હેવીને પેટે અવતરે છે. ૧૪૦

૧૩૭. ઐજન,

૧૩૮. ઐજન, પૃ. ૩

૧૩૯. ઐજન,

૧૪૦. ઐજન, પૃ. ૪

: ૩ : પ્રાર્થનાપોથી :-

પ્રાર્થનાપોથી નામની નાની મુદ્રિતકામાં વસ ન્ત તિલકા,
શિખ રિણી, ઉપજાતે, શાહૂલ વિક્રી ડિત છદોમાં, સંસ્કૃતમાં તેમ જ
ગજકના છદમાં રથાયેલી પ્રાર્થનાઓ પ્રાતઃ સ્તવન, નિત્યસ્તવન અને
૨૧ ક્રિસ્તવન સંગ્રહાઈ છે. આ પણે પ્રકારે લાખેલી પ્રાર્થનાનો ભાવ
એક સરખો જ છે, અને તે માટે સાગરે વિભિન્ન છદો પ્રયોજયાં છે.
'સાગર' ની છદ પ્રભુત્વશક્તિની પ્રતીતિ કરાવતી આ પ્રાર્થનાઓના
એ નમૂનાઓ જુઓ :

અહો ! સ્વામી ! સ્વામી ! પ્રભુજ મુજ હો ! પ્રાર્થું જ, વિભો !
ઉહું શ ચાથી ત્યાં સતત મુજમાં હું રહુ, પ્રભો !
કરું જે જે, સ્વામી ! મન, વચનને કર્મ થકી હું,
તને હોજો, હોજો, પરમ પ્રભુ ! તે સર્વ ગમતુ. ૧૪૧

અલ્લાહ ! ઓ મારા ધણી !

મૈલા ફજરની વાનગિ ;

ઓસ્તરથી જણુ જ્યારથી,

હુ સોથતી હો ત્યારથી,

જે જે કરુ, કહુ તે ઉપર -

ઓમીન ! ઓમીની હો નજર !

અલ્લાહ ! અગર મારા ધણી !

ઓમીન ! ફજરની વાનગિ !

આ પ્રાર્થનાઓ 'સાગર' ની પરમાત્મા પ્રત્યેની અનન્ય પ્રેમવૃત્તિ અને
દદ્દ્રથાની પ્રતીતે કરાવે છે. ૧૪૨

૧૪૧. પ્રાર્થનાપોથી, પૃ. ૫

૧૪૨. ઐજન, પૃ. ૮

: ૪ : મહાત્મા સ્વીઠનબોર્ડનું ધર્મશિક્ષણ : -

‘કાલ’એ ‘કલાપી’ધારા સ્વીઠનબોર્ડના ધર્મવિધાનોની પ્રયત્ન આસર ‘સાગર’ ની વિધારણા પર પડી છે એને તેને પરિણામે જ મહાત્મા સ્વીઠનબોર્ડનું ધર્મ શિક્ષણ પુસ્તિકાનો ઉદ્દેશ થયો છે.
સાગરે સ્વીકારેલા સ્વીઠનબોર્ડના દશસૂદ્ધો આ પુસ્તિકાયાં સાગરે સમજવ્યાં છે. ૧૪૩

૧. પરમાત્મા યુદ્ધ પ્રેમસ્વર્ગ છે એને યુદ્ધ પ્રજ્ઞાન સ્વર્ગ છે.
૨. પરમાત્માને ચહેરું એટલે સાચા ઉપયોગોને ચહેરું
૩. દાન અથવા ઉદારતાથી જેમ મનુષ્ય વિઘૂટો પડે છે, તેમ તેમ તે પ્રજ્ઞાનથો વિઘૂટો પડે છે.
૪. જીવનની વાતો માણસાને દેવ નથો બનાવતી, પણ યુદ્ધ જીવન એને દેવ બનાવે છે.
૫. બીજાઓ કરતાં મહોટા થવાની હથી તે સ્વર્ગ નહીં, પણ નરક નાની હૈ.
૬. સત્ય એ હિતનું : કલ્યાણનું : સ્વર્ગ છે.
૭. પ્રેમ, પ્રજ્ઞાન એને ઉપયોગ : એટલે સેવા : એ એક પછી એક આવે છે.
૮. પ્રેમ એ મનુષ્યનું જીવન છે.
૯. સવિતાદેવ જે તે દ્વિબ્યપ્રેમ છે તેમાંથી સૂચિત્વનું કાર્ય કુર્દાં થયું
૧૦. આધ્યાત્મિક જીવનનું જનન એ પુનર્જનન - હૃજત્વ છે.

સાગરે સ્વીઠનબોર્ડના દશસૂદ્ધો સ્પષ્ટતાપૂર્વક સમજવ્યાં છે.

‘સાગર’ની પ્રેમયોગની ભાવના પરતે સ્વીઠનબોર્ડની પ્રયત્ન આસર જોઈ શકતાય છે. સાતમું સૂત્ર સમજવતાં સાગરે પોતાની રીતે

૧૪૩. મહાત્મા સ્વીઠનબોર્ડનું ધર્મ શિક્ષણ, પૃ. ૧-૬

અર્થધટન કરતાં કહે છે કે : "પ્રેમ અથવા ભક્તિ યાને લીનતા એ પ્રભુને પામવામાં સૌથી પ્રથમ છે. પ્રભુના જ લક્ષ્ય હિન્હુ તરફ અ જિમુખ થતી ચિત્તની તમામ વૃત્તિઓનું પૂરા પ્રયોગી વહન, એ જ પ્રેમ અથવા ભક્તિ. આવો પ્રેમયોગ (Concentrates Love) પ્રણાનનો ઉત્પાદક છે અને ઉપયોગ અથવા સેવા એ એનું પરિણામ છે, અથવા લક્ષ્ય જ છે. હિન્હુસ્તાનના મહાત્માઓએ ભક્તિ, શરીર અને જવનું કિંત આવો જ કુમ ધરે પ્રસંગે બતાવ્યો છે". ૧૪૪

આ ચૂદ્રો સમજવતી 'સાગર' ની વ્યાખ્યાશૈલી રૂપે અને અસરકારક છે અને જ્ઞાધ્યાન્તોના વિશે નિર્પણમાં ઉપકારક બની રહે છે. 'સાગર' ની વિચારધારાને સમજવામાં આ પુસ્તિકા ઝૂબુ ઉપયોગી છે.

: ૫ : મહાત્મા વિવેકાનનું હૃદયાલ :

સ્વામી વિવેકાનને રોમ જ સ્વામી રામકૃષ્ણ પરમહંસની તાત્ત્વિક વિચારણાની પ્રથમ અસર 'સાગર' ની વિચારધારા પર ત્વે પહેલી જોઈ શકત્ય છે. મહાત્મા વિવેકાનનું હૃદયાલ નામની પુસ્તિકામાં સ્વામી શ્રી વિવેકાનનું એક ઈતિહાશ પત્રનું ભાષાન્તર છે. સત્યનું ચિત્તન, મનન અને અનુસરણ કરવા માટે સ્વામી વિવેકાનને આપેલી સલાહ સાગરે પણ પોતાના જવન જ્ઞાધ્યાન્તમાં સ્વીકારી છે. વિવેકાનનું પત્રનું નીચેનું અવતરણ જુઓ :

એ સત્યના પરમાત્મન ! તું જ મહારો એકાડો નેચામક
છ. દોષિત થા હુશ્નની પવા વગર તું સત્યને જ
દૃષ્ટાથી ધારણ કરી રહે અને આ પળથી જ થા લોકને તેમ પરલોકને
તેમ જેના બધા વિભાગોને અને આખાસોને તું તળ હે. १४५

આ પદ્મનો 'સાગર' નો અનુવાદ મૂળનો ભાવ વથાર્થ રીતે રજૂ
કરે છે અને એ દર્શિતો પણ ધ્યાન ઘેરે તેવો છે.

: ૬ : મહાત્મા અમર્સૈનનું પરમાત્મત્તુત્ત્વ :-

આ મુસ્તિકા ધ્વારા સાગરે અમર્સૈનના પરમાત્મા - 'Over soul'
નામના નેવધમાં વ્યકૃત થયેલા વિચારોનું દોહન રજૂ કર્યું છે.
સાગરે અમર્સૈનનો અદ્વૈતવાદી વેદાન્તી તરીકે પરિચય કરાવ્યો છે,
અને તેમની તાત્ત્વિક વિચારણા દર્શાવી છે.

પ્રભુમય હિતકારી જીવન વહેનારા આત્માઓને તે પરમાત્મા
પોતાની પેઠે જ ચાહે છે. તેણો મરે તો પ્રભુને પોતાને
મરવું પડે. "હે-ન્નીમોરના આ અવતરણ સાથે શ્રીકૃષ્ણ પાંડવોને
આપેલા વચ્ચનની શાપ્યાં શિક્ષા સરખાવી પૌર્વિત્ય અને પાશ્યાં ત્ય
વિચારકો વચ્ચેની સમર્પતા પ્રારંભમાં દર્શાવી છે". १४६ વળી,
હિતકારી જીવનનો સંબંધ કલ્યાણકારી સનાતનના સાથે છે તેમ
પરમાત્માની સાથે પણ છે. એ વિચાર પણ સાગરે દર્શાવ્યો છે. १४७
અમર્સૈનની આત્માની વ્યાપ્યા - સધળા જીવનને સધળા કલ્યાણનો
સમૂહ એટલો કે પૂર્ણિતા એકું સ્પષ્ટીકરણ કરી જીંગોપણ બૃહાર્ધ
વિના અમૃતત્વ પ્રાપ્ત થઈ શકે નહીં, શેવો અસિપ્રાય પણ દર્શાવ્યો
છે. १४८ પોતાની શાગવી શૈલીમાં 'સાગર' આ વિચાર આ પ્રનાણે
સમજવે છે : "નહાતું અહમ - દેહમ (Egoism) ભૂતાય, ખોવાય,

૧૪૫. મહાત્મા વિવેકાનંદનું હૃદયબિલ, પૃ. ૫

૧૪૬. મહાત્મા અમર્સૈનનું પરમાત્મત્ત્વ, પૃ. ૧-૨

૧૪૭. શેજન, : ૧૪૮. શેજન, પૃ. ૩

અપદ્યિ, ત્યારે જ મહોદું શહમ જગ્યાત થાય, સવરંખાનુશાલ થાય,
આત્માનુ પ્રકટ સાનિધ્ય અનુભવાય. ૧૪૬

સાચો સાધક પોતાનું હૃદય પરમાત્મત્વમાં સમપી હે છે ને
એ પ્રમાણે તે તમામ પોતાપણું ગુમાવીને સર્વમાનને સર્વશ કિતમાન
અદ્વૈતમાં ભણે છે.

એક બીજો સ્થિતાન્ત પણ સાગરે સ્પષ્ટ, સાદી અને સરળ
જાનિમાં આ પ્રમાણે દર્શાવ્યો છે : "સત્યને કશા પુરાવાની
અગત્ય નથી. સત્યનો અનુભવ એ જ સત્યનો કસોટી અને સત્યનું જ્ઞાન
છે. અને સત્યનું જ્ઞાન સત્ય સાથેનાસેહના - પ્રમાણમાં જ થઈ શકે.
પરિણામે તો સત્ત થિત અને આનંદની અભેદમયતા છે. ૧૫૦

બુદ્ધિ અને હૃદય વિનિતીય અને વિરોધી છે એટલે સાગર^૧
બુદ્ધિયે ઉત્પન્ન કરેલા સવાલોનો નિર્ણય કરવા માટે અમુક ઉત્તેષ્ઠ
ચુધી હૃદયમાં જાતે પ્રવાસ કરેલો હોવો જોઈએ એવી શેર્માનની
વિચારણા સ્પષ્ટ પણે સમજવે છે : "થૈત ન્યમયને અર્પણમય એ દિવ્ય। તેન
પદાર્થમાટ્ટને પ્રકાશના 'સાગરમાં' તદ્દૂપ કરો હે છે. તે માટે સવોપણે
ઉન્નતિ તરફ આત્માના વિકાસ તરફ લઈ જનારી, આત્મપ્રગતિ
દાખલનારી હૃદયમાંથી આવેલી નીતિ - સવોપણે છિત તરફ
લઈ જનારી નીતિ ને અદરના પ્રજાન સૂરની સંતતે છે". તે
નીતિ પ્રમાણે અનુસરવું જોઈએ". ૧૫૧

શા નિર્બધમાં શેર્માને દેણકોનું બે પ્રકારે વગ્નીકરણ કર્યું છે તે
પણ સાગરે પોતાની રોને દર્શાવ્યું છે. અદર જાતે પ્રવાસ કરી

૧૪૬. ઐજન, પૃ. ૩-૪

૧૫૦. ઐજન, પૃ. ૫

૧૫૧. ઐજન, પૃ. ૬

ઓદનારાઓ, રાહિત્વને માત્ર સાધન તરીકે ગણી નવી હુનિયા।
 તરફ નિષ્ઠાન્તપણે આગળને આગળ ચાલ્યો જ્યા છે. વ્યાસ, હોમર,
 ડેન્ટી, ભવસૂલિ, માધ, ગેટી અને સ્વીડનબોર્જને પહેલા વર્જના।
 ક્રેખકો તરીકે ગણાવે છે. કાલ્પિકાસ, શેક્સ પિયર, વર્ડ્જવર્ધ,
 ગોવર્ધિનરામ ક્રિપાઠી કે નરસિહરાવ હેવેટિયા બીજ પ્રકારના
 ક્રેખકો છે. બીજ પ્રકારના ક્રેખકો પોતાની મોહક કલાથી હુનિયાને
 તાજુય કરી હે છે પણ, પ્રસુના રાજ્ય તરફ હુનિયાને શેક તસુ પણ
 તેઓ આગળ ચલાવી શક્યા નથી, શકે તેમ નથી. ૧૫૨

સાગરે જીતમાં ઐમર્સનનું નીચેનું અવતરણ આપ્યું છે જે 'સાગર' ની
 તાત્ત્વિક વિશારધારાના ધડતરમાં સેમ જ તેમના વ્યક્તિત્વ પર
 ઐમર્સનની થયેલી પ્રયત્ન અસરનું ધોતક છે: "હુ જો પૂરેપૂરી પ્રેમ
 ગરબીમાં આરામ લેતો જ પડયો છુ અને વિશુદ્ધ પ્રેમના આતેનથી
 જ જો હું બળયા કરું છુ તો મહારે કેલ્લિન કે સ્વીડનબર્જનું કામ
 જ શું છે ?" ૧૫૩

મૂળ અંગ્રેજ અવતરણ આપ્માણે છે :

When I sit in that presence who shall dare to
 come in ? When I rest in perfect humility, when I
 burn with pure love, what can calvin or Sweedenborg
 Say ? 154

૧૫૨. ઐજન, પૃ. ૭

૧૫૩. ઐજન, પૃ. ૬

૧૫૪. The works of Ralph Waldo Emerson -

Vol.II - 'Essyas' Page 241.

: ૭ : અર્થ પ્રખુજના કક્ષા :

અર્થ પ્રખુજના કક્ષા નામની સંગુરુતૃત્તિના તૃતીય અક્ષમાં દીવાને સાગર, દિતર રમાં પ્રસિદ્ધ થયેલા અર્થ પ્રખુજના રણ કક્ષા, અર્થાં પ્રખુજના મહિના, તથા સતતવાર અને દીવાને સાગર દિતર એની પ્રેરણ થિયો જુદી પ્રસિદ્ધ કરી છે.

આ પુસ્તકાના મુખ્યપૃષ્ઠ પર નીચેની પદ્ધતિઓ 'સાગર' ની જવનસાધનાનો ખર્ચ દર્શાવે છે :

પ્રેર વિકાતા મૈં સુધ્યા - માથા કાટે હુદુ -
અખ ! દેત વિદ્યાન કૌળ્યે - તુર્ત દીજ્યે કદુ
શુકુ શુકુ ગુરુદેવકી જર્ય ! ૧૫૫

પોતાના સિધ્યાન્ત નિર્દ્યા માટે જુનો અસ્ક્રિત પ્રણા વિકાત પ્રમાણે સાગરે પણ કક્ષા, મહિના, વાર અને તિથિઓ રથી છે.

સાગર ની કવિતા મૂલ્યાંકન પ્રકરણ ૪૫૦ આ પ્રકારોની સમ્રોક્ષા કરી છે અને એટલે એનું પુનરાવર્તન કર્યું નથી.

: ૮ : ધર્મવૈચારણા :

ધર્મનું સાચ્યું સ્વરંપ રામજવતી ધર્મવૈચારણા નામની નાની પુસ્તકામાં સાગરે સ્પૃષ્ટતાપૂર્વક જ્ઞાતયું છે કે : "અસ્ક્રિત અથવા અપ્રીતિ એ જ હું અનું કે પાપનું કે અન્યાનનું કારણ છે. અન્યાનનું સુધ્યાં કારણ અસ્ક્રિત અથવા અપ્રીતિ જ છે". ૧૫૬

૧૫૫. અર્થાત પ્રખુજના કક્ષા, પૃ. ૧

૧૫૬. ધર્મ વૈચારણા, પૃ. ૩-૪

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને મનોનિગ્રહ માટે દશાવેલ થાર્ગી -

અરચાસ અને વૈરાયનું મહાત્વ પૂણ રાગરે વિગતે સમજાયું છે.

શાક્ષેત્યોગની સાગરે આપેલી વ્યાખ્યા જુઓ : "શાક્ષેત્યોગ શૈટલે શાક્ષેતમાં વૃત્તિમાટ્કની લીનતા શૈટલે શાક્ષેત એ જ જીવન - શાક્ષેત એ જ મનનું કાર્ય ; શાક્ષેત એ જ યુદ્ધનું કાર્ય ; શાક્ષેત એ જ વિતની બધીયે લાગણ્ણીઓટું કાર્ય. આંદું જ્યારે ભક્ત જીવન થાય, ત્યારે મનને જરૂર જ પ્રકાય. આ જ રાજમાર્ગ છે". ૧૫૭

ધર્મ વિચારણાને અતે 'સાગર' મન, યુદ્ધ અને વિતની આપ્યી જીવનની પ્રિપુટીને ભજનનું મહાકાર્ય સોંપી દઈને ચુણ અને શાન્તિનો રવાનુભવ કરવા માટે ઉદ્ઘોધન કર્યું છે.

: ૬ : સેતોની વાતો :-

ઇ. સ. ૧૯૨૭ સદગુરુ વૃત્તિની 'સાગર' ની ૩૧૨ પુસ્તકાઓમાંની નવમી પુસ્તકા લશીકે પ્રગટ થયેલી ચોવીસ બોધાત્મક વાતાઓમાં શરળ, સાધી છતાં સાવવાઈ શેલીમાં પોતાને અભિપ્રેત સૂકીવાદના જીવન જીથાન્નું સાગરે આલેખન કર્યું છે. પ્રત્યેક વાતામાં પ્રસૂતે પામવાનાં લિન્ન લિન્ન રાધનોનું મહાત્વ દશાવેલાનો લેખકે પ્રચલન કર્યો છે. હોણકની વિચારધારાની પ્રબળ છાપ આ વાતાઓની વરસ્તુ ફર્સંદગી તેમ જ અભિવ્યક્તિ પરતે જોઈ શકાય છે. માટ્ર બૃહયક્ષેવર જ વાતાનું છે. અનુ અતઃ તત્ત્વ તો 'સાગર'ની તાત્ત્વિક વિચારધારા વડે ઘડાયેલું છે. સ્વાસ્થ વિક રીતે જ આવિ ભાવના-પ્રધાન બોધાત્મક વાતાઓમાં પાઢોના વ્યક્તિત્વનો વિકાસ,

ચૂંધણે કે વલ્લતુર્ગૂધનાં કશું મહત્વ હોતું નથી. વાતાંકલાની દિષ્ટને
તપાસલાં આ ચોવીસ વાતાંઓમાંથી 'લીમની ભક્તિની વાત'
(વાતમાં વાતાં),^{૧૫૮} 'રાગ ભગતની વાત'^{૧૫૯} (દસમાં વાતાં) ૧૫૯
લેમ જ એક બાવાળના અસ્યારાની વાત^{૧૬૦} ભાવવાહી સચોટ શૈલી
તેમ જ પાંડુલિપિનાં દિષ્ટને ધ્યાન જોયે રેવી છે.

આ વાતાંઓમાં 'રાગર' ની ભાવવાહી લોકભોજ્ય શૈલી
તાત્ત્વિક સ્થિરાન્તોની અભિવ્યક્તિનો અમનો હેતુ સાધી આપે છે
અને એટલા પૂરતું જ આ વાતાંઓનું મહત્વ છે.

'પ્રભુપ્રાપ્તિ માટે પુસ્તકો વાચ્યવાની વાતમાં રાની સ્થિર-
અવરને એક વકીલે પ્રભુપ્રાપ્તિ માટે કથા પુસ્તકો વાચ્યવા ? તે
અંગે પૂછિતાં બાવાળાને આપેલા ઉત્તરની લાક્ષણીક લાખ-શૈલી જુઓ :
"બેટા ! શૈલી છે નિયમ કે કે કિ અની હુઠ કોઈ લિ કિતાબ
કલે ઘડના નહો - હુઠારે લોગોંને ઘડ ઘડકે છે યે સાથ
અરાધી ક્રિય છે. ચોજ્ય ગુણસે શ્રવણ કરના ઔર ઉદ્દેશ બિચાર
કરના. જો ઘડા, જો વાતો ક્રિય ઉસ સથકો ભૂલ
બન - ભૂલને કા ભિ અસ્યાસ કરો - ભૌન કા છે અસ્યાસ કરો -
એક શાખદકા અસ્યાસ કરો ઔર જૈસી તેરી યે કિતાબ
હમારી ધૂનીએ આપે હો ગઈ, જૈસી તેરે દિલમે ણુદ તેરી છે
લિણી હુઠ કિતાબ કો પૂર અધ્ય બનાયે - ફિર દર્શન હો જયગા -
કાયમી કાયમ બિલ જયગા વ્યારા, અલાય નિરંજન । ૧૬૧

૧૫૮. 'સીતોની વાતો', પૃ. ૧૬.

૧૫૯. એજન, પૃ. ૨૪

૧૬૦. એજન, પૃ. ૧૧-૧૨

૧૬૧. એજન, પૃ. ૪

પદ્ધતિઓના ભાષણા શેક્ષણની વાતમાં ગુરુ દસ્તાવેય ખગવાને
આપેલો બોધ - અકળી પોતાના ચિ - ચિ અવાજ ધ્વારા પરમાત્મામાં
પોતાનું ચિત્ત જોડવાનો તેમ જ કુકડો હેહ દાઢિ અને હેહ ભિમાનને
બુલા ડેનમાં લય કરવાનો બોધ આપે છે, તે સમજવે છે. ૧૬૨ :

‘દેવરે દ્વીપો લઈને ફરતાં પ્રત્યારોની વાત’ - દ્વીપ વાતમાં
સાથગુરુની શોધમાં નિકળેલા પ્રત્યારોને હૃદયની સૂભિકાનું શોધન -
વિશોધન કરવાનો તેમ જ પોતે જ પોતાના ગુરુ અનવાનો આત્માનુભવી
સંન્તો આપેલો ઉપદેશ રજૂ થયો છે. ૧૬૩ ‘શેક વાવાજના અસ્યાયની
વાત’ વાતાં પદ્મીમાં વૈરાગ્ય અને અસ્યાય ધ્વારા પરમાત્મપ્રાપ્તિ
કરવાનો બોધ સચોટસૌઠીમાં નિરપાયો છે. ૧૬૪

અનુભૂવાતાં ‘ગજણ ગુરુમંત્રની વાતમાં રાયાનેદ્દ પાણેથી
રાખમણ્ણ તેમ જ સાગ જવ નો ગુરુમણ્ણ કબીરે દેવીરીતે પ્રાણ કર્યો
તેની વાત રજૂ થઈ છે. ૧૬૫

રાયું બોલનારા છોકરાની આઠમીવાતામાં ચોરલોકોએ
કરેલી સત્યની કુદરા, ૧૬૬ તુકારામ જુવા અને વેદાન્તીઓની
નવમીવાતામાં ભાક્તેતનું ગહન્ત્વ, ૧૬૭ ક્ષેપૂજી ભગવાની વાત ૧૬૮
વીરતાનું મહન્ત્વ દર્શાવ્યું છે.

સૂફીવાદની ભાવનાઓનું નિરપણ કરતી ચિત્તરાઓની
વાત બારમીવાતા ૧૬૯ હુકરત મહામદ સાહેયની ભજનનાં લક્ષણોની
વાત - તેરમીવાતા ૧૭૦ તેમ જ હુકરત ઈશ્વરીમ પોગમારની ચૌદમી
વાતાં - પરમાત્માની ગહનગતિની વાત ૧૭૧ મનસૂરશાહની

-
૧૬૨. ઐજન, પૃ. ૬ : ૧૬૩. ઐજન, પૃ. ૭-૮ : ૧૬૪. ઐજન, પૃ. ૧૧-૧૨
૧૬૫. ઐજન, પૃ. ૧૪-૧૫ : ૧૬૬. ઐજન, પૃ. ૨૦-૨૧
૧૬૭. ઐજન, પૃ. ૨૨-૨૩ : ૧૬૮. ઐજન, પૃ. ૨૪-૨૭
૧૬૯. ઐજન, પૃ. ૩૦-૩૧ : ૧૭૦. ઐજન, પૃ. ૩૨
૧૭૧. ઐજન, પૃ. ૩૩-૩૪

‘માસેકના ધરના રસ્તાની વાત’ – વાતાં પદરમી, ૧૭૨ ‘મહાત્મા અયુષ્ણની – ભક્તની સહનશીલતાની વાત’ વાતાં ૧૬૫, ૧૭૩
 ‘હુરત અલીરાહેણની વાત’ – વાતાં રાતરમી, ૧૭૪ ‘શાહ સથાદ્વીન અને રાજ દ્રિચ્છની વાત’ – વાતાં અઠારમી, ૧૭૫ ‘હુરત શ્રીણલીની વાતો’ – વાતાં ૧૬મી, ૧૭૬ ‘હુરત અયુષ્ણારની વાત’ – વાતાં વીજસમી, ૧૭૭ ‘હુરત દાવુદની મુખેલીની વાત’ – વાતાં ૨૪મી, ૧૭૮
 ‘હુરત સુશાની અને દેહકાની વાત’ – વાતાં બાવીશમી, ૧૭૯ તેમ જ હુરત શ્રીણલીના વિલાપની વાત – વાતાં તેવીસમી, ૧૮૦માંની સૂક્ષીવાદની લાવનાથો રજૂ કરતી વાતાંએતુ ગૂળ ઇમીસાહેબના મસ્નવી માં જોઈ શકાય છે.

: ૧૦ : ગીતાની વિચારણા :-

ગીતાની વિચારણા માં રાગે ગીતાના કેટલાક મહત્વના રલોકોનો અનુવાદ તેમ જ સ્પષ્ટીકરણ કર્યું છે. ગીતાની તાત્ત્વિક વિચારણા નિષ્કર્ષ રજૂ કરતી થા ગીતાની વિચારણા નું અનુસૂધાન ગીતાનું હૃદય માં જોઈ શકાય છે.

ગીતાના બીજ અધ્યાયના ગીતાં રલોકમાં હેઠળી અસ્ત્યતા અને આત્માના શૈતન્ય તત્ત્વનો સંબંધ દર્શાવેલી વસ્તુને ચથાર્થી સ્વરૂપમાં જોવા માટે શ્રીકૃષ્ણે અર્ઘ્યને આપેલી સલાહ આગે ‘સાગર’ આ પ્રમાણે સમજાવે છે : “શરીર તે ખરં હું નથી કે શરીર તે ખરં તું નથી, પણ ખરં હું તો અનદર રહેલું શૈતન્ય છે, અને શરીર તો માત્ર રેને રહેવાનું એક ધર છે ધરના નાશ પામવાથી અનદર રહેલું શૈતન્ય નાશ પામતું નથી”. ૧૮૧

-
- | | |
|----------------------|----------------------------|
| ૧૭૨. ગૈજન, પૃ. ૩૬-૩૭ | ૧૭૩. ગૈજન, પૃ. ૩૮-૩૯ |
| ૧૭૪. ગૈજન, પૃ. ૪૦-૪૧ | ૧૭૫. ગૈજન, પૃ. ૪૨-૪૪ |
| ૧૭૬. ગૈજન, પૃ. ૪૫ | ૧૭૭. ગૈજન, પૃ. ૪૬-૪૭ |
| ૧૭૮. ગૈજન, પૃ. ૪૮-૪૯ | ૧૭૯. ગૈજન, પૃ. ૫૦-૫૧ |
| ૧૮૦. ગૈજન, પૃ. ૫૨-૫૩ | ૧૮૧. ગીતાની વિચારણા, પૃ. ૭ |

સાચા જ્ઞાનીઓ અનિત્ય પદાર્�ી માટે ઐં કરવો જોઈએ નહોં
એ સિધ્યાન્ત પણ સાગરે વિગતે સમજવ્યો છે : "જરણ એ માત્ર,
યૌવનમાંથી ધડપણમાં જવાય છે તેમ, એક હેઠમાંથી બીજ હેઠમાં
જવાની સ્થિતિ છે અને જ્ઞાનના અનુભવીને એ બેલકુલ ઐંદ્રનું કારણ
થશું નથી". ૧૮૨

આ ત્યાતું સ્વરૂપ સમજવતાં વીચમાં લોકની ટીકામાં
'સાગર' ની સચોટસૈલી જુઓ : "આ ત્યા જન્મત્યુ રહિત છે,
ભૂતમાં થયેલો અને પછી ભાવિમાં થનારો એવો નથી. તે તો છે,
છે ને છે એવો નિત્ય સાર્વત, પુરાણ અને શરીર મરતાં છતાં,
અમર રહેનારો છે". ૧૮૩

કર્તવ્યમાર્ગનો ઉપહેશ આપી વિવેકયુદ્ધ ધ્વારા કર્મમાંથી
સુકૃત થવાનો શ્રીકૃષ્ણે દ્વારેલો માર્ગ 'સાગર' વિવેકયુદ્ધ અને
મનોયુદ્ધના તાત્ત્વિક ઐં ધ્વારા આ પ્રમાણે દ્વારે છે :
"યુદ્ધના બે પ્રકાર છે (૧) નિરયયાત્મિક યુદ્ધ, (૨) બૃહુ
શાળાવાળી યુદ્ધ. નિરયયાત્મિક યુદ્ધ એ સારી યુદ્ધ છે ;
ઇતાં વેદના વાદવિવાદ કરનારની યુદ્ધ, કામનાઓથી ભરપૂર
સ્વર્ગ મેળવવાની ઇચ્છાવાળી યુદ્ધ તેમ જ ભોગ અને મહોટાઈ
યાહનારની યુદ્ધયોગમાં સેથર થઈ શકતી નથી". ૧૮૪

આ ત્યા દ્વિગુણી પ્રકૃતિથી પર છે એટસે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો
નિસ્ક્રેષ્ય થવાનો બોધ 'સાગર' લાક્ષ છિક્ષેલીમાં આ પ્રમાણે સમજવે છે :
"તહેરે જો કુઈ કરવાતું હોય તો એ જ છે કે તું જ્ઞાન ગુણથી પર

૧૮૨. એજન, પૃ. ૭

૧૮૩. એજન, પૃ. ૮

૧૮૪. એજન, પૃ. ૧૦

એટસે ત્રિગુણાતીત થા. હું સુખદુઃખ અના વંઘથી રહેત થા; વંઘ
માદ્રથી રહેત થા; સુખદુઃખ, હષિશોક, જન્મમૃત્યુ, ચડતી પડતી
વગેરે વંઘો છે, તે બધાં વંઘોથી રહેત થા".

...

આત્માને ચોગ કે વિયોગ તેમ જ ક્ષેમ કે અક્ષેમ હોતાં નથી એ હું
સારો ઐઠે જાણ અને આત્મવાન એટસે આત્મ વિત થા - બૃહમવેતા
થા - આત્મસ્વરૂપ થા - હું શરીરાં નથી પણ આત્મા છે, શેવો
સ્વત્નુભવ પોતામાં નિરન્તર અચૂત રાખ". ૧૮૫

યુદ્ધિધની સમતા એ જ ચોગ અને એટલા માટે ચિત્તની સમતા
પ્રાપ્ત કરવા માટે 'સાગર' લાક્ષ્મિક શૈલીમાં કહે છે કે : "યુદ્ધિધની
આવી સમતા એ જ ચોગ છે અને એટલા માટે આવી સમતાના
પ્રબળ અનુભવ વચ્ચે નિરન્તર અચૂત રહીને હું કર્મમાં પ્રવૃત્ત થા -
કર્મમાં પ્રમાદ કરીને, કર્મમાં અવરૂપું સિ ઉભી ન કર". ૧૮૬

ગીતવૃત્તિની કીનતાના દ્વારા અભ્યાસને આવ શ્યક ગણાવી
'સાગર' ચોગની, ભક્ત, કે જીની બધાંનો પૂર્ણપદનો સ્વત્નુભવ તો
એક જ હોય છે એ સમજવતાં કહે છે કે : "યુદ્ધિધની આવી સમતા
અણ ડેત કાયમ રાખીને દરેક ફરજ અદા કરવી. યુદ્ધિધની આવી
કાયમની સમતા - સમતાનો આવો કાયમનો ત્રિગુણાતીત પ્રવાહ
એ જ પૂર્ણતાનું એક સુહજ લક્ષણ છે". ૧૮૭

પોતાને આ હિંપ્રેત શબ્દાના દનો મૂળભૂત સિ ધ્યાન્ત વાસનાક્ષય -
મનોનાશ પર 'સાગર' ખૂબ જાર મૂકે છે. ગીતાની વિચારણાનો આ

૧૮૫. શેજન, પૃ. ૧૧

૧૮૬. શેજન, પૃ. ૧૩

૧૮૭. શેજન, પૃ. ૧૪

મૂલ પાયો સમજવતી 'સાગર' ની લાદાણિક શૈલી જુઓ :

"નિરયા તિસ્કા બુદ્ધિનોયોગ જીધ્ય થયો નથી હોતો, ત્યાં
મનુષ્યની અ-દરદું રાજ્ય આ શરૂઆતે રજોગુણી અને તમોગુણી
પ્રકૃતિએ પચાવી પાડેહુ હોય છે, અને મનુષ્યતા આપા આન્તર
ઉપર તે સત્તા ચલાવે છે, આટલા માટે, આ શરૂઆતનો વિનાશ
કરવાને પ્રથમ ઈન્દ્રિયોને સ્વલ્પન રાખ ; મનને સૌયમમાં રાખ અને
કામના માદ્રાનો - વાસનામાદ્રાનો વિનાશ થશે. દેહમાં પર
ઈન્દ્રિયો છે, ઈન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે,
બુદ્ધિથી પર પૂર્મ સત્ત વરસુ - આત્મા છે આ કમ બાળીને હું તે
પ્રમાણે, પોતે વશ રાખ અને કામનામાદ્રાનો - ઈચ્છામાદ્રાનો -
વાસનામાદ્રાનો આ રીતે કથ કર". ૧૮૮

: ૧૧ : ગીતાનું હૃદય :-

'ગીતાનું હૃદય' માં છૃદી અધ્યાયથી અઠારમાં અધ્યાય સુધીના
મહત્વના શલોકો ટોકા પદ્ધતિથી સમજવ્યાઠી છે. રંન્યાસીની
વ્યાખ્યા આપત્તાં રાગરે અભતવાદનો પોતાનો જી ધ્યાન્ત
નેરખો છે. જુઓ : "જેને રણ કે ત્યાગ યેમાંથી એકપણ પ્રતિ
મમતા નહીં, તે રંન્યાસી વાહયત્યાગી છતાં વૃત્તિએ કરીને અ-દર
રાગી હોય, તો તો જે ત્યાગી નહીં, પણ, મિથ્યાચારી જ
કહેવાય. કર્મ કરતાં છતાં - વાહયત્યાગી ન હોવા છતાં,
આન્તરમાં જ રમા ધિસ્થ હોવાથી, સમાન બુદ્ધિનો ચોગી
નેરન્તરનો મુક્ત છે". ૧૮૯

૧૮૮. ઐજન, પૃ. ૨૪

૧૮૯. 'ગીતાનું હૃદય', પૃ. ૧૧

નવમાં અધ્યાત્મના ચૌદારાં રલોકમાં અનન્યપ્રેમ-ભ જિતનું દર્શાવેલું મહત્વ 'સાગર' આ રીતે સમજવે છે : "નહાર અને નહાર જ સતત કોર્તન, અને તે દ્વારા નિયમનો અને દદ્વાર ધારણ કરીને ; નહારી અને નહારી જ પ્રણિપાતપૂર્વક ભજિત અને એક ક્ષણ થણું નહે વેગળો ન રાખે એવો નહારીને નહારી જ ઉપાસના". ૧૬૦

પરમાત્મા પ્રત્યેનો અનન્યપ્રેમ 'સાગર' રાહનું મુદ્દાનું લક્ષણ છે. 'સાગર' અનન્યપ્રેમવૃત્તિનું મહત્વ મસ્તીયુકૃત બાનીમાં આ પ્રમાણે સમજવે છે : "પોતાના પ્રેયતમ પરમાત્માનું આ રાવોપરિ વચન તેના હરેક આશકે પૂર્વી ગરજથી સાંસળનું જોઈએ. અહો તે વચન આપે છે કે આશકનો ઈજુનો અનન્ય અને આંતરાયાહ્ય દમ વિદ્ય દમ અસ્થાદિત ઠેતો જ હોય, તો ઈજુનો કિક રેમ જ પારલોડિક અને હુનિયાનો માભદો તે જરૂર જ સેસાળી લે છે. મુમુક્ષુ વિદ્યારક હવે તો પરમાત્માનો - પરમાત્માના પ્રેમનો ચાન્તર ફકીર છે - ઈજુનો જોગી, પણ જોગી ઝડપ વગરનો". ૧૬૧

ગીતાનો હૃદયપૂર્વકનો અસ્થારા કરનાર સહજવસ્થાની પરબરદશા પ્રાપ્ત કરે છે. 'સાગર' પુસ્તકાની પૂણીઝૂતિ કરતાં લાક્ષ છિકશીલીમાં કહે છે કે : "ગીતાની હૃદયજ્યોતનું તેણે પોતાના હૃદયમાં દર્શાન એટસે પ્રકટીકરણ થાને "રિવીશેશન" અનુભબ્યુ તેજું "ચિત" રખગોપી યાન્યુ - તેની "યુદ્ધ" અદ્વૈતાચાર્ય લગ્નાન વ્યાસજ મુમુક્ષુ વિદ્યારકને ભણવે છે રેમ, સાંપ્રયોગીની પ્રતિ જિઠત પ્રસા વની. અને તેનું "મન" ભગવતી શુતિ કહે છે રેમ, લાક્ષાત રસ્તો વે. સ. એજુ અતુભવતું બાન્યુ મનયુદ્ધ ચિત - જ્ઞાપુટી એક થઈ". ૧૬૨

૧૬૦. ગેજન, પૃ. ૧૩ : ૧૬૧. ગેજન, પૃ. ૧૪

૧૬૨. ગેજન, પૃ. ૧૭

‘ગીતાની વિચારણા’ રેમ જ ‘ગીતાનું હૃદય’ ના અસ્યાસનો ને કુષ્ઠ રજૂ કરતાં ‘સાગર’ અતમાં કહે છે કે : “મન, પુદ્ધ અને બિચની ક્રિપુટી જેવી રેના આ નારમાં આંદ ખ્રૈસ્ટસ હોય છે, રેવી જ રેના આ નારમાં હૃદાન, યોગ અને સક્રિત અથવા ઉપાસનાની અનુભવ ક્રિપુટી ખ્રૈસ્ટસ હોય છે એટલે કે આવો મુમુક્ષ વિચારક મહાયોગી પુરુષ જેખ મહાયોગી છે, રેમ તે મહાજ્ઞાની પણ છે, તે મહાભક્ત પણ છે, તે સાન્યાસીઓનો પણ મહારંન્યાસી છે”. ૧૬૩

ગીતાનો હૃદય પૂર્વકનો અસ્યાસ કરનાર પરમપદની સિથતિ પ્રાપ્ત કરે છે. લાક્ષ શ્રીકૃષ્ણામાં ‘સાગર’ કહે છે કે : “આવો મહાન અનુભવ, કેવળ સક્રિત વડે જ થવો જોઈશે, અને વિધિપૂર્વક એટલે યોગી થઈને જ થવો ચોચ્ય છે, એ મુદ્દા ઉપર પણ ગીતાનો આપ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પરમાત્મભાવનું પ્રકાશન અર્ઝુનના હૃદયમાં કરતાં કરતાં, છેવટે રે અના હિ અનન્ત - આપ રિ મિત ધનયક્તું - અલાર્નું સાનાતન નિયત્રણ સમજેવે છે”. ૧૬૪

શ્રીમદ ભગવદગીતાનો સવાંગી અસ્યાસ રજૂ કરતી આ વાને પુસ્તિકાયોમાં ‘સાગર’ ની લોકુશોભ્ય સરળ વ્યાપ્યા શૈલીનો ઉત્તમ આવિજ્ઞાર રેમ જ સાગરે એમાંથી સ્વીકારેલા સિધ્યાન્તરું વિશેદ નિરૂપણ જોઈ શકાય છે.

૧૬૩. ગૈજન, પૃ. ૨૧

૧૬૪. ગૈજન,

: ૧૨ : સ્વીપુરુષ વિચારણા :-

શાશુદ્ધવૃત્તિના બાર અકોમાં છેલ્ખી પુસ્તિકા 'સ્વીપુરુષ વિચારણા' છે. 'મુમુક્ષુ વિચારણા' ની માફિક આ પણ એક મુમુક્ષુયેનને લંઘાયેલો વિસ્તારી પદ્ધ છે. સ્વી અને પુરુષનાં વિભિન્ન ધર્મ વિષયક વિચારોનો 'સાગર' નો મૌલિક દાખિલો આ પુસ્તિકામાં જોઈ શકાય છે. પતિક્રિત સ્વર્ગોને પત્તિ ગે જ દેવ હે એવા અનુના સ્વર્ગાનું દદ્દતાપૂર્વક મનન અને અભિરણ કરવા માટે સીતાળ, તારમતી, ફિલે વગેરેનાં દાઢ્યાંતો આપી ગૃહસ્થાક્રમનો ધર્મ વિગતે સમજાવ્યો છે. સ્વીએ પોતાનું સ્વીત્વ અને પુરુષે પોતાનું પુરુષત્વ સાચવીને પોતાના કાર્યક્રેતું અનુસાર જ પ્રવૃત્તિ કરવી જોઈએ એવો દદ્દાચ્રાહ રાણવાનું સાગરે ઉદ્ઘોધન કર્યું છે. "પુરુષે સ્વર્ગીની શુદ્ધે પ્રમાણે યાદવાનું નથી પણ પુરુષના જ્ઞાનને અજ્વાળો જ સ્વીએ યાદવાનું છે" એ આ પુસ્તિકાનો મુખ્ય ભાવ છે. પાત્રયાત્ય કેળવણીની વિપરીત અસરથી કેતતા રહેવાની આજના ચુગને અનુદ્ધવાની પણ સાગરે કરી છે. 'સાગર' ની ઐહિક વિચારણા પ્રકરણ છ્યાં આપણે વીગતે જોઈ ગયા છીએ. ઐટલે અહીં પુનરાવર્તન કર્યું નથી.

શાશુદ્ધવૃત્તિની આ બાર પુસ્તિકાઓમાં નવમી પુસ્તિકા સંતોની વાતો તેમ જ દશમી અને અગ્નીયારમી પુસ્તિકા ગીતાની વિચારણા અને 'ગીતાનું હૃદય' આધ્યાત્મિક કોટિના સત્ત્વશાળી ગધની દાખિલે વિશેષ મહત્વની છે.

અપ્રગટ શધૂરી નવલક્ષ્ય। - શૈતન્ય જ્યોતિ : -

સાગરે પોતાના તાત્ત્વિક સ્થિતાનોની અસ્તિત્વ કિરત માટે
નવલક્ષ્યાના સુરપની પણ પર્સિફળી કરી હતી. 'સાગર' ની અપ્રગટ
શધૂરી નવલક્ષ્ય। - 'શૈતન્ય જ્યોતિ' તુ પ્રથમ પ્રકરણ 'અજળાજોગી'
ઉપરથી 'સાગર' નો પ્રથત્ન જોઈ શકાય છે. ૧૬૬

એ પ્રથમ પ્રકરણમાં સાગરે બાવણ સૂમાપતિ અને શૈતન્યાણ
વચ્ચે આધ્યાત્મિક વિષયમાં થયેલી ચર્ચાનું રંબાદેશીયમાં નિરૂપણ
કર્યું છે. બાવણાહી શૈક્ષિયમાં લાખાયેલા આ પ્રકરણમાં સચોટ સ્થિતાન્ત
નિરૂપણ એસ ધ્યાન હોયે છે. જુઓ : "જે કેળવણી ફક્ત મગજ સુધી જ
પહોંચીને અટકે છે તેના પર અમારા લોકને બેલકુલ શ્રદ્ધા નથી હોતી.
શૈવ સૂક્ત શાન કરતાં મૂળી રહેતું એ માનવીને વધારે ગુણકારક છે".

... રાધળા ધર્માંતુ મૂલ પ્રેમર્થ છે.
ધર્મગાંધી દેશકાળને અનુસરે છે અને હિથતિને આધારે એકે છે, પરંતુ
સત્યનો દેશકાળ અને હિથતિથી ઉપર સત્તા ચલાવે છે. પ્રેમર્થ એટલે
ધર્મનો કોઈ નવો પથ નહોં, ધર્મનો કોઈ જુદો માર્ગ નહોં. પ્રેમ
એટલે જ પરમાત્મા. પરમાત્મા એટલે જ સત્ય. સત્ય એટલે સૌપૂર્ણ સત્ય
અને એટલે જ પ્રેમનું સર્વોપરી તત્ત્વ". ૧૬૭ આ નવલક્ષ્યાની શાયોજના
પરત્યે બીજ વિશેષ માટેલી પ્રાપ્ત થઈ નથી.

વિચારક તરીકે સાગર : -

હિમાલયઘનિવાસ દરમ્યાન ઈ.રા. ૧૬૧૪ અને તે પછીનાં કેટલાંક
વધોમાં સાગરે પોતાની આધ્યાત્મસાધના દરમ્યાન લાઘેલી નોંધપોથી -

૧૬૮. શૈતન્યજ્યોતિ - અપ્રગટ નવલક્ષ્યાનું પહેલું પ્રકરણ 'અજળાજોગી' માટે
જુઓ પારિ શિષ્ટ દ

૧૬૭. અજન

૩૫૩

દુયરો માંથી "વિચારક તરીકે સાગર" ની વિચારણા એકથી ચારની નિગતે સમીક્ષા કરીશે.

ઇશાવાસ્ય, કૃ, પ્રસન, અંદોંય, મંદૂક્ય, મુષ્ટક, બૃહદૈરાયક, તૈતિરિય, રવેતાશ્વતર, તારજ્જાર વગેરે ઉપનિષદો, ગુરુવેદ, દેવીસાગવત, યોગવાસિષ્ઠય, નિવર્ણ પ્રકરણ - ઉપરાત્ત જલાઉછૂન ઇમી, કલાપી, બેઘલે, પ્રાઉનિગ, વર્દ્ધજવર્થ, શિલ્ષન, જેઈ મસ જેલન, સ્વીઠનાર્ગ, અખો, કબીર જેવા પાશ્યાત્ય અને પૌલાત્ય વિચારકો સગવદ્ધીતા પટંજલિ યોગશાસ્ત્ર, મસ્નવી શ્રીમદ્ભાગવત, વૈરાગ્ય શતક, જેવા ગ્રંથોમાંથી અવતરણો સાગરે આપેલાં અવતરણો પરથી આ શાસ્ત્રગ્રંથો લેમ જ વિચારકોની પ્રથમ અસર રેમના પર પડી છે તે જોઈ શકાય છે.

શ્રી સાગરશ્રમ ગ્રંથમાણા પુષ્ય યોથું "સાગર" ની વિચારણા પ્રથમાંક ૧૪૫૬નાં રાયપાદ્ક યોગીનું જ. ક્રિપાઠીએ પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ : "સાગરપ્રકૃતુંએ પોતાની નોંધપોથીમાં પરમાત્માનો સ્વાત્નુભવ કરવા માટેની મનનશીલ, તાસ્ત્વિક વિચારણા ષિકેશમાં, એકાન્તવાચ સમયે કરેલી, તેમાં રહેલી વિચારણા મુમુક્ષુઓને ઉપકારક થશે એમ દાગવાથી, એમાનો કેટલોક સાગ આ માળાના યોથાએક તરીકે "સાગર ની વિચારણા - પ્રથમાંક" ઇપે પ્રસ્તિધ્ય કરું છુ". ૧૬૮

"સાગર" ની અધ્યાત્મ વિચારણાનો નિષ્કર્ષ રજુ કરતો સાગર ની નોંધપોથી આ પ્રકારના સાહિત્યમાં વિશ્વીષ સ્થાન ધરાવે છે.

જુનાતન રાત્યના શિધ્યાન્તોરું આતું વિશ્વ નિરુપણ પોતાની નોંધપોથી ધ્યારા આપવાનો કદાચ આ પ્રથમ પ્રયત્ન છે. પોતાના શિધ્યાન્તને

૧૬૮. "સાગર" ની વિચારણા - પ્રથમાંક - પ્રસ્તાવના, પૃ. ૧

અનુરૂપ અર્થધારન ભાઈ અધવા અધ્યાત્મસાધનાની પૂર્ણતા ભાઈ આવ શ્યક અને સહાયક બને રેવા અધ્યાત્મનામ વિચારકોનાં લાણાણોમાંથી તેમ જ શાસ્ત્રગ્રંથોમાંથી ફેરફારી કરીને ઉદ્ઘૂરકરેલાં અવતરણો તેમ જ રે સમજવતી રહ્યાંથી ટીકા થાં નોંધપોથીનું વિશેષ લક્ષ્ણ છે.

'સાગર' ની અધ્યાત્મ વિચારણાનું નવનીત "સાગર" ની વિચારણા" ૧૧ થારથક ધ્વારા આપણાને મળે છે. થાં નોંધપોથીનું સ્વરૂપ્યાયવ વિશેત રીતે લાણી 'ડાયરી' જેવું છે. પરતુ તેનું આંતરસ્વરૂપ થાં ધ્યાત્મિક કોટિનું છે. અધ્યાત્મ વિચારણામાં સહાયક્ષુત થાય ગેવી દૂકીનોંધ માટ્ઝ એમાં હોઈ 'સાગર' ની તાત્ત્વિક વિચારણાનું સ્વરૂપ રામજ્વામાં આવ શ્યક નીવડે છે.

સૂફીવાદના પુરસ્કર્તા સાગર સ્વાચ્છ સૂફીનું લક્ષ્ણ આપ્રમણે
દર્શાવે છે. *Child of the present*, સૂફીવાદ અને વેદાની વચ્ચેનો સમબ્યા કરતાં 'સાગર'
બીજી ગેક નોંધમાં જ્યોતે છે કે : "વેદાનના જ્ઞાનને સોમલની સાથે
સરળાવી શકતાય, સૂફીવાદ પણ પ્રેમ અને પ્રેમભક્તિ પછી જ્ઞાનને
પરોષ્યાય તરીકે - યત્તિમ વિશેતિ તરીકે જહેર કરે છે". ૧૬૬

વર્ણનશીના એક અણેણ અવતરણમાંથી સૂફીવાદની પોતાની ભાવનાને પ્રિય ગેરું ગેક અવતરણ સાગર આપ્રમણે નોંધે છે : "જો
પ્રેમની વિજયવંત જ્યોતિ આપણાને દોરે છે અને આનંદ પોતે જ આપણી
સધ્યરતા છે તો આપણા દ્વિવારો સુણમય અને શાંતિમય હશે જ". ૨૦૦

નરસિંહ, અખો, પ્રીતમ, ધીરંધ્રાઇ વગેરે ભક્તોનું દ્રષ્ટાત આપી
તાં રફ શોગ્ય, ૧૯૧૪ની નોંધમાં સાગર પોતાની અધ્યાત્મસાધનાના

૧૬૬. શૈજન, પૃ. ૬

૨૦૦. 'સાગર' ની વિચારણા" - વિતીયાંક, પૃ. ૧૦

માર્ગનો નિર્દેશ કરતાં સ્પૃહ નોંધે છે કે આ બધાએ પોતાનું
લક્ષ્ય બિંદુ જ કિંતનામાર્ગથો શિધ્ય કર્યું છે. અણાને ગુજરાતના ભક્તોમાં
ગણાવે છે અને અણાના ગુરુ પૂલાનદ પાસેથી અણાને પ્રાપ્ત થયેલો
ગુરુમાટ્ર પણ એક નોંધણાં રાંકે છે.

શ્રીલીઙ્કાર પૂલ નિરાકાર રામ,

રામ, કાચા કાશી, હૃદયસનાન,

જ્યોતિસ્વરૂપ આત્મધ્યાન, તત્ત્વ નિરંજન રામ,

ત્રિભૂવન વ્યાપી તારકરામ, તન ત્રિવેણીમાં નાનુ,

સોણ પૂલમાં ખમાનું ૨૦૧

પૂલાનદે પોતાના શિધ્ય અણાને આ માત્ર આપ્યો હતો એનો
કોઈ આધાર રોકયો નથી પરંતુ અણાની પ્રણાલીકાનું શ્રી ભગવાનજી
મહારાજ (કહાનવા બંગાળો) પાસેથી એમને પ્રાપ્ત થયેલું હસ્ત વિ ગ્રિત
સાગરિત્ય અસ્યાસ માટે હેમાલય લઈ ગયા હતાં. આ સાગરિત્યના
અસ્યાસમાંથી આ માહિતી સાંપડી હોવાનો પૂરવો સંશાવ છે. જો
આ માહિતીની સત્યતા સ્વીકારીણે તો અણાના ગુરુ પૂલાનદ
વિષેની શકાનું પણ નિરાકરણ થઈ જાય છે. આ નોંધને અતે સાગર
લણે છે કે પ્રત્યેક પણ આ જ માત્રાનું ધ્યાન કરવું એ પ્રમાણે એમના
ગુરુદેવની શેમને આપ્યા હતી. અણાની ગુરુભક્તિ પણ એના રામયમાં
અપ્રતીમ હતી. અણાના કષ્ટાંત ધ્વારા સાગર અનન્ય ગુરુભક્તિ પર
પણ ખૂબ ભાર મૂકે છે.

સાગરની બધાાત્મવેશરણ પર મનવી અને ગુલ્ફની સીધી
અસ્યર છે. કેદાનામાંથી છૂટવા માટે હોંગ કરનાર સોદાગરના

૨૦૧. "સાગરની વિચારણા", તૃતીયાંક, પૃ. ૩

૨૦૨. અજન, પૃ. ૪

પોપટની વાત ટકોને સાગર સમજવે છે કે સાથે ભક્ત જગતનો
ત્યાગ કરતો નથી પણ અદરથી મનને પકડીને ભક્તમાં લીન
જની જય છે. એટલી અધી લીનતાથી તે અવન ગાળે છે કે અની
અધી હુનિયાદારોને તે નકામા જેવા થાય છે. અને હુનિયાદારી
ઓમને તળ હે છે. ૨૦૩

કળીરનું અવતરણ ટકોને 'સાગર' આ જ સિધ્યાત્ર જુદીરીઠે
અની એક નોંધમાં જમજવે છે : "મનને પકડીને આત્મામાં ઓગાળીને
સ્વરૂપમાં કાયમ માટે લીન થાતું બધું પ્રસુમય છે તેમાં જીવું
આ એક જ વિચાર દમ વિ દમ જગ્યાત રહે તો નકામું જોખવાને
અવકાશ જ કયાં રહે ? પ્રભુ વગર બીજું જોવાને આંખમાં જગા જ
કયાં રહે ?". ૨૦૪ લાક્ષ શિક્ષેકીમાં 'સાગર' કહે છે કે પરમાત્માં
જેને થઈ ઓગાળવાનો ધધો શીર સાટે કરવો છે તેણે તો આ
પણ પણ અનન્ત કરવાનું છે. ૨૦૫

'સાગર' ની વિચારણા ચર્ચાંદુંદું પ્રેમના શાસ્ત્રમસ્વરૂપ -
"વા સ્વિદે હક્ક" - "અકા વાદ ઉલફના" ની સ્વિદિતિનું નિરુપણ
કરતાં 'સાગર' કહે છે કે : "માશ્શુકના અજ્ય નૂરમાં આશકનું ગુમ થઈ
જરૂર એ હ શુની આ મિરની દશા છે. એ હલેમાંસો આશક જાતે હ શુ
અને છે. હ શુ વને છે એટદે ઘૂંઢ ઘૂંઢુંમી બને છે". ૨૦૬ ભગવદગીતા માં
અનને અત્યારા માટે વૈરાગ્ય અમે અસ્થ્યાસુ પર ઘૂંઢ ભાર મૂક્યો છે.
'સાગર' ભગવદગીતા અને સૂઝીવાદ વચ્ચેનું રામ્ય આપ્રમાણે દર્શાવે છે :

૨૦૩. એજન, પૃ. ૬ : ૨૦૪. એજન, પૃ. ૧૩

૨૦૫. એજન : ૨૦૬. "સાગર" ની વિચારણા, ચર્ચાંદુંદું,
પૃ. ૬

"અરો વિરાગ ઉપજે ત્યારે ભક્તિને જીવન વણુ-તેઠયાં હાજર થાય છે.
સૂક્ષ્મીવાદ ઇના ફના કહિને વિરાગનો ઉપદેશ કરે છે".^{૨૦૭}

નારદભક્તિસૂક્ષ્મના બીજી અને દ્વીજી ચૂંઠ - તે કોઈમાં પરમપ્રેમરૂપ
છે અને અમૃતસ્વરંપ છે તો નિહેશ કરી તા. ૧૪૩ નવેમ્બર, ૧૯૧૪ની
નોંધમાં 'સાગર' ભક્તિ અને સૂક્ષ્મીવાદ વચ્ચોનું સામ્ય પણ દર્શાવે છે :
"કોઈમાં આ શરૂદ સૂક્ષ્મીવાદને પુષ્ટી આપે છે. ગમે તો ગુરુ માં
કે ગમે તો કોઈ "પચાસ્યર" માં કે ગમે તે કોઈ અઙ્ગશ્ય Ideal માં
કે ગમે તો કોઈ પ્રેયમાં પ્રેય (Bean Ideal) મૂર્તમાં ભક્તિ એટલે
પરમ પ્રેમરૂપ, અમૃતરૂપ - કીનતા".^{૨૦૮}

અનુત્તવાદ અને સૂક્ષ્મીવાદનો સમન્વય કરતાં 'સાગર' બીજી એક
નોંધમાં રખીયાનું છાયાંત આપી સમજવે છે કે : "હું આ કે ઘિતા
જતે જ વધાપુષ્ટ જેવી વસ્તુઓ છે. મને એટલે અજ્ઞાનના અધકારે ઉટંગ
ઉખી કરેલી ભ્રમણાઓ છે. સૂક્ષ્મીઓ તો બધી હાલતમાં ગૌજ ઉડાવનારા
જ મસ્તો છે".^{૨૦૯} ડોસેમ્બર ૧૯૧૭ની શતીમ નોંધમાં સાગર
અનુત્તવાદનો સ્થિત્યાન્ત લાક્ષણિકશૈક્ષણીમાં આપ્રમણે સમજવે છે :
"જેનું મન મર્યાદ છે અને કે પોતાનું હોશનું જવન પૂર્ણ પવિત્રતાથી અને
તદ્વન આજ્ઞાભક્તિરસ્તુત ગાતો છે તે તદ્વન નિર્ણય છે. જેની ઇચ્છામાટ્ય
શરીર ગઈ છે. તેને તો સ્થળ કે સમયનું અધિન જ નથી".^{૨૧૦}

પરમાત્માપ્રેમ ધ્વારા વાસનાક્ષય - મનોનાશ અને સ્વાત્નુભવ -
સાગરની આત્મસાધનાનો માર્ગ સમજવતી આનોંધ રૂપે લિયારક
તરીકે સાગરનું દર્શન પણ પૂર્ણ થાય છે. પ્રભુપ્રેમને નશે તે તો સંદર્ભ

૨૦૭. ઐજન, પૃ. ૪ : ૨૦૮. ઐજન, પૃ. ૫

૨૦૯. ઐજન, પૃ. ૬ : ૨૧૦. ઐજન, પૃ. ૨૬

ચક્યુર જ છે. તે સુખી છે એટલું જ નહોં પણ સર્વસુખનું ભૂળ - પરમાત્મા
સાથે તે અદેશ અનુભવે છે. શાશ્વત સુખ, શાશ્વત પ્રેમ અને શાશ્વત આનંદ
તેનો જ છે. એના ગુવનના કોષમાં હું છુંઘ, દિલગીરી કે મૃત્યુ જેવા।
શાબ્દો છે જ નહોં. ૨૧૧

‘સાગર’ની વિચારણાના આ પરિચયાત્મક અભ્યાસ પરથી
પ્રતીત થણે કે સાગર ની ડાયરીમાં સ્વતંત્ર વિચારક થાત્માનુભવી
કોટિના સતપુરુષની આ આર્થિવાણી છે. “સાગર”ની વિચારણા આ
પ્રકારના અધ્યાત્મ વિષયક સાહિત્યનો સુદર નમૂનો છે. ‘સાગર’ની
આત્મસાધનાને સમજવામાં પણ “સાગર” ની વિચારણા સહાયભૂત બને
છે. અને ગુજરાતની અદ્ભુત ડાયરીઓમાં વિશેષ પ્રકારનું સ્થાન
પ્રાપ્ત કરે છે.

“સાગર”ની વિચારણાની તાત્ત્વિક સમીક્ષા સાથે ગધલોખક
તરીકે સાગર નું મૂલ્યાંકન પણ પૂરું થાય છે. “સાગર”ની પદ્ધરેષા”ના
પદ્ધલોખક તરીકે ગુજરાતી ગજ દિસ્તાન તેમ જ કદમ્બી અને અધ્યાત્મ
સંપાદનોના સંશોધક તરીકે, સવાદલોખક તરીકે, તર્ફાદોખક તરીકે
તેમ જ વિવેચક - વિચારક તરીકે ‘સાગર’ નો ગુજરાતી ગચ્છાહિત્યમાં
મહત્વનો ફાળો છે, એ જોઈ શકોશે. “સાગર” ની પદ્ધરેષા” ધ્વારા
અવર્થીનું શિતનાત્મક ગધકારોમાં ‘સાગર’ પોતાનું સ્થાન પ્રથમ
હરોળમાં પ્રાપ્ત કરી લે છે એમાં શક્તા નથી.